

પ્રકાશક :

શ્રી સ્થાનકવાસી જૈન કાર્યાલય  
પંચલાઈની પોણ :: અમદાવાદ

સંપાદક અને પ્રકાશક :  
જીવણલાલ છગનલાલ સંઘની

: વ્યવસ્થાપક :  
સ્થાનકવાસી જૈન કાર્યાલય : અમદાવાદ

‘સ્થાનકવાસી જૈન’ પત્રના ચોથા  
વર્ષના આહુકોને ભેટ ( નં. ૨ )

અન્ય માટે કિંમત ચાર રૂપાના

પ્રથમાંશી

સંવત ૧૯૬૩

મુદ્રક :

શા. મણીલાલ છગનલાલ  
ધી વીરશાસન પ્રો. પ્રેસ  
રતનપોળ સાગેરની ખડકી

અમદાવાદ

## આભાર પત્રિકા

૬. સં. ના આધુસ્થાપક શ્રીમાન ધર્મસિંહજી મુનિની આ કૃતિ પ્રસ્તિક્ષ થવાનો મુખ્ય યથા વાંકાનેરના શ્રીયુત સ્વર્ધમનગ્રેમા મહાશય રા. રા. સંઘવી ચત્રભુજ કચરાભાઈને ઇલે જાય છે. એક ઉપર બીજી લેટ આપવી એ સ્થાનકવાસી જૈન પત્રને પોતાય તેમન હતું, તેથી પ્રસ્તુત ઉદાર મહાશયને તેવી વિનતિ કરતો એક ૨. ન માત્ર પત્ર લખતાં, જેમને સાહિત્ય ઉપર શોઅ છે, જેમણે લક્ષ્મીને અંસ્થિર, ક્ષણિક ગણી તે પરથી મોઢ ઉતારવાનો સુઅવસર મેળવી લિધ્યા છે, એવા તે ઉદાર સનજીને મારી નમ્ર માગણી સ્વીકારી સ્થાનકવાસી જૈન પત્રના ચોથા વર્તના આહકાને પોતાના તરફથી લેટ આપવા આ દ્રોપદીયર્ચાં નામક પુસ્તકની ૫૫૦ નકલો ખરીદી મહારા કાર્યને જે પ્રશંસનીય વેગ આપ્યો છે, તે માટે હું તે શ્રીમાનનો અંતઃકરણુપૂર્વક આભાર માનું છું.

શ્રીમાન ચત્રભુજ કચરાભાઈ સંઘનીને છેક્ષા થોડાક વખતથી વર્તમાન પત્રોના વાચકો એણાખી શક્યા છે, તેનું કારણ પોતાની જીવદ્યા, ક્રેગવણી, સાહિત્ય વગેરે પ્રતિ શુભ ભાવના અને ઉદારતા. પોતે હાલ નિઃસંતાન હોધ ધર્મ માર્ગેજ ઉમય પતિ-પત્રી પોતાનું જીવન વ્યતિત કરે છે. તેમણે પોતાની અદ્ય છતાં લગભગ આખીએ સંપત્તિ નીચે પ્રમાણે સંસ્થાઓને દાનમાં આપી દીખી છે, તેજ તેમની ઉદારતાની ઝાંખી કરાવે છે.

(શ. ૨૦૦૦) શ્રી વાંકાનેર સ્થા. જૈન વિદ્યાશ્રીમાળા સંઘને ગરૂઠ જમાડવા ખાતે. રૂ. ૧૫૦૦) શ્રી ધાટકોપર સાર્વજનિક જીવદ્યા ખાતામાં. રૂ. ૧૦૦૦) ઢારોના ધાસ માટે શ્રી વાંકાનેર મહાજીનને. (રૂ. ૨૦૦૦) શ્રી જોરાવર નગરમાં ઉપાશ્રય ખાંધવા. રૂ. ૫૦૦) વાંકાને પાંજરાચેળમાં, રૂ. ૭૦૦૦)નું પોતાનું મકાન રાજકોટ બાલાશ્રમમાં. (વીલ) આમ એકંદર તેઓએ રૂ. ૧૪૦૦૦)ની સખાવત કરી છે.

આવા ઉદાર ગૃહસ્થનું નામ આ પુસ્તકની સાથે જોડતાં હું પણ નહાડે સહભાગ્ય માનું છું. કિંબદૂના ! —જીવનદાદ સંઘવી

## નિવેદન

આ પુસ્તકના મૂળ લેખક છે દરિયાપુરી સ્થા. જૈન સંપ્રદાયના આધુનિક સ્થાપક શ્રીમાન ધર્મસિહિજી મુનિ. તેમનો સમયકાળ હતો સં. ૧૬૭૦ થી સં. ૧૭૨૮ સુધીનો. શાયાલાચારી યતિ વર્ગમાં પ્રથમ દીક્ષા લઈ અનેક સૂત્રોનું રહસ્ય પામ્ભી, તેઓ સંવત ૧૬૮૫ માં સાચા ત્યાગને પંચ વજ્યા. અને પછી તેમણે ને શાસ્ત્રીય અને ઔપરેશિક કાર્ય કર્યું છે, તે ધર્મનું અદિલત અને મનનીય છે. તેમના જીવનનાં ઉત્તીવળ પૃષ્ઠા જ્ઞાસુઓએ અન્ય પુસ્તકો દ્વારા ઉકેલી લેવા.

તેઓશ્રીનો શાસ્ત્ર શોખ અપ્રતિમ હતો, લગભગ ૨૭ સૂત્રો પર ભાષ્ય રખીને તેમણે સમસ્ત સાધુ સાધીઓ માટે વાંચણીમાં સરળતા કરી આપીને - ભારે ઉપકાર કર્યો છે. તીવ્ર સમરલાંશિતિ, શુદ્ધાચાર, શુદ્ધ દ્વાય, નિર્દ્દેશ, વિવેક, સમનવવાની અદિલત શક્તિ એ વગેરે ગુણોથી તેમણે અનેક જ્ઞાસુઓનાં મન જીતી લીધાં હતાં.

તેમણે લખેલ અનેક અંશો-સમવાચાંગ, વ્યવહાર, સૂત્રસમાધિ વગેરેની હુંડી, ભગવતી, પન્નવણ્ણા, ધાણાંગ વગેરે સૂત્રોના ચંત્ર, ચંદ્રપ્રજ્ઞમિ સૂર્યપ્રજ્ઞમિ આદ્વિની દીપ, સાંતુસ્થાનિ, સામાયકની ચર્ચા, દ્રૌપદીની ચર્ચા, ધર્મસિહિંદુ બાવળી, અનેક ચંત્રો, સુતિઓ વગેરેમાંથી અદિયા “દ્રૌપદીની ચર્ચા” પ્રકાશિત કરવામાં આવે છે. ને વાંચી વાચકો તે સમયની યતિવાદની શિથિતતાનો, મૂર્તિવાદના અનિષ્ટ તત્ત્વોનો તથા સૂત્રના શુદ્ધ અથેને અદ્દલે કરવામાં આવતાં અનર્થી એ વગેરેનો આણોપાતળો નાનુભવ કરી શક્યો.

તેમના સાધુ અને શાચક અનુયાયીનોનો ને પુરાતન ભાંડારોમાંથી તેમના હસ્તલિખિત સાહિત્યને એકત્રિત કરી પ્રકાશિત કરવાનું મન પણ હ્યે તો આજે સમાજ પર ધંણો ઉપકાર થાય તેમ છે.

આ હસ્તલિખિત પ્રતિ વીસદપુરના અંથ ભાંડારમાંથી મેળવી આપવા અદ્દલ દરિયાપુરી સંપ્રદાયના પં. મુનિ શ્રી મૂલચંદ્રજી મ. નો હું ઝડિણું છું.

જુની લાખા ઉકેલવામાં પડતી મુશ્કેલી દૂર કરી મુશ્કે શુદ્ધિના કાર્યમાં પોતાના અમુલ્ય સમયનો લોણ આપી મને સહાય આપનાર દ. સં. ના ચિનયશરીર મુનિશ્રી લાઈચંદ્રજી મ. સા. નો તથા લીંબડી સં. ના પં. મુનિ શ્રી છાયાલાલજી મ. સા. નો હું ખૂબજ આસારી છું.

આ પુસ્તક જુની લાખામાં ખાના પર નેમ હતું તેમ સહજ શાખદક કેર સાથે છાપવામાં આવ્યું છે. લાખા અસલી હોઠ ધીરે ધીરે વાંચતા સમજ શકાય તેમ છે. સમય ઓછા હોઈ તથા જરૂરી આગમો લલ્ય ન હોઈ, તેમજ લહિયાઓની અશુદ્ધિયી, કાળજ છતાં આમાંના પ્રાકૃત મૂળ શ્વોકો-ગાયા-ઓમાં ધણી ખરી ક્ષતિ આની ગઈ છે તે માટે વાચકો દરગુજર કરરો, એની વિનાની કરું છું. કિંબનુના સુજોષુ !

આવણ શુક્રવ પંચમી

૧૯૯૩

}

જીવનલાલ સંધરી.

ॐ नमः

# શ્રી દ્રૌપદીની ચર્ચા

તતેણ તે ધર્મધોયા થેર, તરસ્સ સાલતિયસ્સ શેહુંવ  
ગાઢસ્સ ગંધેણું, અભિભૂયા સમાણી, નતેઃ સાલાધ્યા ઉષે-  
હાવગાઢાઉ. એગાં બિંદુયાં ગાહાયા કરયાંસિ આસાયેતિ,  
તિતગાં ખારાં કડુયાં, અખધાં અલોકયાં વિસભૂયાં જાણિતા. ધર્મદૃષ્ટિ  
આણગારાં એવાં વયાસિ જર્દણું ઉમાં હેવાણું પિયા  
એયાં સાલતિયાં જાવણે હાવ ગાઢાં, આહારેસિ, તોણું ઉમાં  
અકાલે ચૈવ જીવિયાઉ વવરેલિંજજસિ. તાં માણું ઉમાં હેવાણું  
પિયા, ઈમાં સાલતિયાં જાવ આહારેસિ. માણું ઉમાં અકાલે  
ચૈવ જીવિયાઉ વવરેલિંજજસિ. તાં ગર્ભામિણું ઉમાં હેવાણું  
પિયા, ઈમાં સાલતિયાં, એગાંત મણૂબાયે. અચિતેથથાંદિલે,  
પરિઠવેહિં ॥ ૨ ॥

પ્રક્રિયા—ધર્મરૂપી અણુગારે ગુરુની આજા વિના નાગસિરીનું  
સાલણું\* કેમ ભોગવ્યું ?

ઉત્તરઃ—શ્રી વીતરાગના માર્ગને વિષે ગુરુની આજા છે. જ્યાં  
જીવની દ્વારા છે ત્યાં આજા છે. એજ પાઠ મધ્યે ગુરુએ—ધર્મધીષ  
સ્થવિરને કહ્યું છે. એગાંતે અચિત થાંડિલે પરિઠવેહિં અચિત  
સ્થાંડિલે પરિઠવનો, એ રૂડી આજા છે. તેવો જોગ મલ્યો. સ્થાંડિલમાં  
પણ ધણ્ણા જીવોનો વિનાશ દીકો. તે વારે ધર્મરૂપી અણુગારે વિચાર્યું  
કુ એક બિંદુમાં આટલી બધી કોડીઓની ધાત થઈ તો સર્વ સાલણું  
પરઠવતાં ધણ્ણા જીવોનો નાશ થશે. તે વારે વિચાર્યુઃ—અચિત સ્થાંડિલ,  
નિર્દોષ એવો અહારો ક્રાંતા છે, તે માટે શરીરમાં પ્રક્ષેપ કર્યો.  
સાલણું ભોગવ્યું.

\*સાલણું=ગોચરી, આહાર પાણી ધત્યાદિ.

પ્રેરક બોલ્યો. સ્વામી ! ધર્મરચ્ચી અણુગાર સાલાણું કેઠને  
પાછા વળી, ધર્મધીષ સ્થવિર પાસે કેમ ન આવ્યા ?

ઉત્તરઃ—સુશિષ્ય હોય તે ગુરુનો અભિપ્રાણ જાણો. ને મને  
કેમ કહેશે કે તમે લોગવો અને જીવહિંસાની પણ આજા ન હોય,  
આજા તેજ દ્યાની, તે અભિપ્રાય જાણી ગુરુની આજા માંગવા ન  
આવ્યા, એટલે એમ જાણું કેન્યાં જીવની દ્યા ત્યાં ગુરુની આજા જ  
છે, એટલે આજા દ્યા ઇપ્પજ દીસે છે. કેટલાક એમ પ્રશ્ન કરે છે કે  
અમારે આજા એ ધર્મ કે દ્યા એ ધર્મ ? તેનો ઉત્તર—આ ધર્મ-  
રચ્ચી અણુગારના અધ્યયનથી જણાયું કે જયાં દ્યા લાંજ આજા.  
અને આજા દ્યા ઇપ્પજ દીસે છે. એટલે, દ્યાધર્મ મોક્ષવૃત્તિ કહીએ.  
શ્રી વીતરાગે ધણ્ણ સૂત્રામાં ધણી જગ્યાએ દ્યાધર્મ વખાણ્યો છે.  
અને દ્યા તે આજા ઇપ્પજ છે. વળી સૂત્રની સાખ કહી છે. સુધ-  
ગડાંગના દ્વારા અધ્યયનમાં પાઠ છે:-

**જંધન્તંવતથ્, એસા આણુનિયંદ્ધિયા,** તથા નહી ઉત-  
રતાં, ગુર વાંદવા જતાં ને અજ્યણુા થાય છે તે શક્ય પરિહાર છે.  
અને અજ્યણુએ જતાં ને દોષ લાગે તે વીતરાગને વચ્ચે આલોવવું  
સહિતે છે અને પ્રતિમા પૂજતાં જીવહિંસા થાય છે. તેનું આલોવવું  
સહાતા નથી. તો આજાધર્મ કયાં રહ્યો ? તે માટે વિતરાગની આજા  
અહિંસા ઇપ છે, વલી વિતરાગે કહ્યું:—સંવરદ્ધારને છેડે, શાસ્ત્રિયં  
ધર્ત્યાદિક દરસે, સેવે, તે આજાએ આરાધિક હોય, તે માટે એથોડું  
શું લખ્યું છે, તેથી સૂત્રામાં વિચારી વિસ્તાર કરીએ, પણ સર્વ  
સિદ્ધાંતનું રહ્યા એ, ને પરમાર્થે આજા ત્યાં દ્યા, દ્યા તે આજા  
ઇપ જ જણવી, પણ એમ નહિ કે આજા જુદી અને દ્યા જુદી,  
એમ ન સહિએ, પણ એમ સહિએ કે દ્યા તેજ આજા છે. ધર્મ-  
રચ્ચી ઋષિની પેરે. (૧) એ આજા દ્યા એક, પ્રશ્નોત્તર સૂત રીતે  
કહ્યો. હવે બીજે પ્રશ્નોત્તર કહે છે. તેણો પાઠ:-

દુર્મતાંથરઉણું નાગસિરીએ માહુણુંએ અધકાયે, અપુજા જવ નિષેલીયાએ જાએણું, તહુડવેણું, સાહુ સાહુ રૂવે, ધર્મરૂપરૂપ અણુગારસ. માસખમણુ પારણુગંસિ, સાલઈએણું જાવગાઢેણું, અકાલે ચેવ જવીયાઉ, વવરોવિએ.

એ પાછનો અર્થ કહે છે. અહિંયા ધર્મધોષ સ્થવિરે એમ કંદું ને ધિકાર છે નાગસિરી આલણીને કે જેણે સાલણું દેછ ધર્મરૂપી સાધુને જવથી જુહો કીધો.

અહિ પ્રેરક પૂછે છે. સ્વામી !:—

સુકૃતિ સુપક્કેતિ સુછિને સુહૃતે ભડે ।

સુનિદ્ધિ સુલિદ્ધિ, સાવજજં વજજએ મુણી ॥

એ ભાષાએ આહારને વખાણે વખોડે તો દ્રોષ લાગે એમ કંદું. તો ધર્મધોષ આચારેં નાગસિરીને હીલી-નિંદી તે કેમ ધરે ? તેનો ઉત્તર કહે છે.

અંતગડ સિદ્ધાંત મધ્યે ગજસુકુમાર સાધુને અધિકારે—  
સોમિલ આલણે સમશાન મધ્યે ભાથે પાળ બાંધી. ઐરના અંગારા ધગધગતા ભાથે ભૂક્યા. ભાથું ઇસ્ટયું પણ સોમિલ આલણુ ઉપર દ્રોષ ન કર્યો. વળી શ્રી નેમિશ્વરજીને કૃષ્ણજીએ પૂછ્યું:—મહારો ભાઈ કયાં છે ? નેમજ કહે: તમારો ભાઈ ને કામે ગયો તે કામ તેણે સાધ્યું. કૃષ્ણજી વળી બોલ્યા:—સ્વામી. ગજસુકુમારે પોતાનો અર્થ કેમ સાધ્યો ? તે વારે શ્રી નેમ બોલ્યા:—હે કૃષ્ણ. કાલ પાછલા પહોરે મને વાંદીને, મારી આજા બેધને સમશાને જઈને, બિક્ખુની બારમી પડિમા સાધી, તે પડિમા ધરીને વિચરે છે

તતેણું ગયસુકુમાલં અણુગારં એગે પુરિસે પાસેઈ ।  
એકપુર્ખે દીકો કલ્યો, પણ શ્રી વિતરાગે ‘થિરઉણું સોમિલે માહુણો, સાહુ સાહુ રૂવે જવીયાઉ વવરોવિએ’ એમ કેમ ન કંદું ?  
વળી કૃષ્ણજીએ પૂછ્યું:—સે કેણું લંતે પુરિસો, અપછિય પછિએ

જાવ પરિવનિજયે, જેણું ભમ સહોદરાં કણિય ભાયરે, ગય  
 સુકુમાલાં અણુગારાં અકાલે ચેવ લુચિયાઉ, વવરેવેતિ. તએણું  
 અરહા અરિઠનેમિ, કષુદ્રુવાસુદેવાં એવાં વયાસી; માણાં કષુદ્રુ  
 ઉમંતિસ્સ પુરિસ્સાપત્તો સમાવજજાહિં. એવાં ખલૂ કષુદ્રુ  
 તેણું પુરિસેણું ગયસુકુમાલે અણુગારેસ્સ, સાહિજજેદિણુ  
 અહિંથી પાડ ખડુકમણિજેરત્થં સાહિજજેહિને ત્યાં સુધી જાણુવો.  
 તતેણું સે કષુદ્રુ વાસુદેવે, અરહાં અરિઠનેમિ, એવાં વયાસી,  
 સેણું ભાતે પુરિસે મચે કષું જાણુ તત્થે, તચે અરહાં  
 અરિઠનેમિ કષુદ્રું વાસુદેવાં એવાં વયાસી. જણાં કષુદ્રુ તુમાં  
 બારવધુએ છુયરીએ, અણુ પવિસ્સમાણાં પાસિતા, ડિયએ ચેવ  
 ડિયણું કાલાં કન્નિસાઈ, તજાં તુમાં જાણુ જાસિ, એસણું સે  
 પુરિસ્સે, અહિંયા નેમળુએ કૃષ્ણાજુને સોભિલનું નામ ન બતાવ્યું.  
 કણું જે:-રખે કૃષ્ણ, તે પુરુષ ઉપર દ્રેષ કરતો, તે તો ગજસુકુમાલ  
 સાધકને સહાયનો હેનારો, વળી કૃષ્ણાજુએ પૂછ્યું-સ્વામી ! તે પુરુષને  
 હું એમ એળખીશ ? તે વારે ભગવાંતે કણું:-દારકામાં પેસતાં તને  
 દેખીને તે પુરુષ ત્રાસતો થકો જ કાળ કરી જશે. તે વારે તું જાણીશ  
 જે એ ગજસુકુમારને સહાયનો હેનારો. પણ એમ ન કણું જે  
 ધિક્કાર છે તે સોભિલને, પણ અહિંયાં ધર્મ ધોષ સ્થવિરે  
 નાગસિરીને “ધિક્કાર છે.” એમ કણી હેલી નિંદી તેકેમ ? ધતિ પ્રશ્ન—

ઉત્તરઃ—શ્રી નેમળુએ મોહકર્મ ક્ષય કર્યું છે. સર્વથા રાગદેષ  
 ગયો છે અને ધર્મધોષ સ્થવિરને મોહની કર્મ ક્ષય સર્વથા ગયું  
 નથી. તે માટે ધર્મરૂપી અણુગારે સાધક ઉપર દશ્ચિરાગે કરી નાગ-  
 સિરીને હેલી, નિંદી ઇજેત કરી. એ છભરસ્થપણુનો ભાગ આલોવવા  
 આતે, પણ કોઈ એમ કહે જે જિનશાસન ઉજાલો રાખવા માટે  
 નાગસિરીને ધિક્કારી તે ખોટું, એમ હોય તો નેમળ સોભિલને  
 ધિક્કારે. ધર્મરૂપી સાધુ કરતાં ગજસુકુમાલને પરિસહ ધણો,  
 પણ જિનેંદ્રના ભાગને વિષે યથાર્થ ભાખવું. આદે પાછે કણે અવગુણું

થાય. ને ભણી ભગવતી શતક ખીજે ઉદ્દેસે પહેલે રકંધકને અધિકારે ખંધકને ગૌતમ સ્વામી સામા જવા માટે અનુરોધીતા, આસન ત્યજતિ, યચ્ચલગવતો, જૈતમસ્યાસયંતં, પ્રત્યતપુષ્ટાનાં તદ્ભૂવિસયં તચ્ચે ન તૂસ્ય પક્ષપાત વિષયશ્વાત् જૈતમસ્ય ક્ષીણ રાગશ્વાત् ધતિ વૃત્તા ॥ ને ખંધકની સામા ગયા, ત્યાં વૃત્તિકારે ક્લાબ્યું ને રાગ ક્ષય ગયો નહિ માટે, તો ધર્મધોષને પણ રાગ ક્ષય ગયો નહિ, તે માટે નાગસિરીને ઘિંજારો. અહિંયા એમ જાણુવું. સરાગદાષ્ટિએ કહ્યું, પણ વિતરાગની આજા નહિ. તે વારે ક્રાઈ પૂછરો ને ધર્મધોષ સ્થવિરે આદોબ્યું કહ્યું નથી? તેનો ઉત્તર, ન કહ્યું માટે એમ જાણુવું, ને ધર્મધોષ સ્થવિરે આદોબ્યું નહિ, પણ સૂત્ર નથે એક એક ભવ્ય આદોવવા ચોગ્ય સહદિયે. જેમ અર્થમાં કુમાર અમણે પાત્રની નાવા કરી, રમ્યા, પણ તે આદોવવા આતે, પણ આદોયું સૂત્રે કહ્યું નથી, પણ એ સૂત્રના પાઠની રીતે આદોવવા જેગ એ કર્તવ્ય. તેમ અહિંયા પણ આદોવવા જેગ જાણુવું. આદોઈ શુદ્ધ થથા વિના આરાધક પદ્ધતી ન હોય. અત્ર ધર્મધોષનો આલાવો (આધકાર-વર્ણન) નથી ચાલતો. દ્રોપદીનો અધિકાર છે તે માટે ધર્મધોષનો સંપૂર્ણુઃ—

ના ભાગ દષ્ટરાગે, પણ વીતરાગની આજા નહિ. એમ જાણુવું. વીતરાગની આજા એ કે:—જય સંચા અવત્તંબા, સંચા મોસાયજ સુસા, જય બુદ્ધેંનાઈજા, નત લાસિજજ પત્રવં ॥ તથા ન કહે કાણુને કાણો, ચોરને ચોર ન કહે. (દશ વૈકા. ૭ મે.) એ વિતરાગની આજા. તથા વળી કહ્યુઃ પુઢવી સમાણે સુણું, હુવેજા. (દશવૈ. ૧૦ મે) તથા અવિહુમમભાણે ક્લલગાવતઠી ( સુયગડંગ ૭ મે ) આચારાંગે સુધ્યચ્ચે મૃતકને ક્રાઈ હીલે નિંદે તોપણુ ભોકે નહિ, તેમ સાધુને ભારે, ગાળો આપે, હીણો આહાર આપે તો પાછો હીણો જવાબ ન હે. વળી સાધુ જોચરી ગયો હોય તો આહાર સારો તથા હીણો ભલ્યો, વોહરો નીકલ્યા.

પછી ગૃહસ્થ પૂછેઃ—સ્વામી, શો આહાર વોહર્યો? તે વારે તે સાધુ ગૃહસ્થ આગળ ન કહે. જે અમે આહાર સારો કે હીણો વહેર્યો. તો પછી તે ગૃહસ્થને ઇજેત ક્યાંથી કરે? એ સૂત્ર વિચારિને યથાર્થ સદહીએ, જે એ ધર્મધીષ સ્થવિરને તથા ધર્મધીષના શિષ્યને ધર્મરચ્ચી અણુગાર ઉપર દાખિરાગ હતો, તે માટે નાગસિરોને હેલી. અહિં વિતરાગની આજ્ઞા નહિ. એ સૂત્ર સમાધિ જાણવી. એ બીજે પ્રશ્નોત્તર કર્યો.

હુવે ન્રીજે પ્રશ્નોત્તર કહે છે:—અહિં કોઈ પ્રશ્ન કરે; જે નાગસિરોના જીવ નાગસિરીના ભવથકી દ્રૌપદીના અવતાર સુધી વચ્ચમાં કેટલો કાલ ભર્યો?

ઉત્તર:—સંધાચાર નામા અંથ કોઈકનો કર્યો છે તેહની વૃત્તિ દ્વૈંદ્રસ્ફુરિએ કીધી. તેમાં ત્રણુ આધિકાર છે તે પ્રથમ અધિકાર, તે મધ્યે ત્રણુ મુદ્રાને અધિકારે જોગ મુદ્રામાંહિ, ધર્મરચ્ચી સાધુનો અધિકાર છે. ત્યાં નાગસિરીના ચરિત્ર મધ્યે કહ્યું છે તે ગાથા.—

હુખુતો હુખુતો, હુખુતા સાસત મન રચેસુ, અમિયા જહ ગોશાલો, અણુંતકાલ ભવારહલો ॥ ૩ ॥ અહિં એમ કહ્યું જે, એમ ગોશાલો ભર્યો તેમ નાગસિરી ભવ રૂપીયા અરણુવ માંહિં ભર્યો. પણ અનંતો કાળ સૂત્ર સંધાતે ન મળે તેનો શોન્યાય?

ઉત્તર:—ગોશાલાના અધિકાર મધ્યે કહ્યું છે જે:—ઉદ્દસલું ચણું કડૂય રખેસુ, કડૂય વહીસુ, સથત્થવિષું સત્થ વજે જાવ કિન્ચ્યા । અહિં એમ કહ્યું કે-પ્રાયે બહુલપણે કડુક વૃક્ષને વિષે, કડૂય વેલને વિષે એ સધળે “શાસ્ત્રવંદ” જાવ કહ્યું ત્યાં દાહેજવર ઉપનો, કાળ કરી ભર્યો. તો અહિં પ્રાયે કડૂય વનરપતી તે બાદર વનરપતી, અને બાદરપણે જીવ કાયસ્થિત ભર્યો. તે અસંઘાતો કાળ, શ્રી પત્રવણું ૫૬ ૧૮ મે કહ્યું છે, જે બાદરેજું જાંતે બાદરેત્તિ કાલઉ કેવચિરં હોઈ,

ગોયમા ॥ જહુનોણું અંતો મુહુતં । ઉછો સેણું અસંખી-  
જજંકાલં, અસંખીજાઓ ઉસપિણીઉસપિણીઓ કાલાઓ,  
ઘેતાઓ અંગુલસસ અસંખીજઈ ભાગં, ધતિ પનવણું  
સૂત્રને ન્યાયે નાગસિરી અસંખ્યાતો કાળ અમી કહીએ, અને  
ગોશાદો અસંખ્યાતો કાળ અમશે એમ કહોએ. અનંતો કહે એ  
સૂત્રથી વિરદ્ધ ॥૩॥

### હવે ચૈથા પ્રક્રિયા ભેદ કહે છે:—

તતેણું સે હાવ એ રાયા, કંપિલપુરં નથરં । આણુંપ-  
વિસ્સઈ (ર)તા । વિઉલં અસણુંપાણું ખાઈમં સાઈમં, ઉવ-  
ખડાવેદ (ર)તા । કોડુંખિય પુરિસે સદ્વાવેદ (ર)તા । એવં  
વયાસી ગણહુણું તુજે હેવાણુંપિયા. વિઉલં અસણું પાણું  
ખાઈમં સાઈમં સુરંચ મજજાં ચ, મહુચ મંસંચ સિંધૂચ  
પસજં ચ સુષ્ઠુ પુરું વત્થ ગંચ મલ્લાલંકારં ચ વાસુદેવ પા-  
મોખાણ્યા રાયસહસ્રસાણું, આવાસેમું સાહુરહતે વિમાહુરંતિ।

તતેણું તે વાસુદેવ પામોખાણું તં વિઉલં અસણું પાણું  
ખાઈમં સાઈમં જાવ પસજં ચ આસાએમાણી (૪) જાવ વિહુ-  
રંતિ ॥ એ દ્રૌપદ રાજનો ધર સમદાઢી નહી, માંસ સામટાં કેલવ્યાં  
માટે ॥૧॥ પરણવાને અવસરે દેહરો પ્રતિમા પૂજ તે કામદેવની ॥૨॥  
પૂજતી વેળા દ્રૌપદી સમદાઢી નહી. નિદાન ભોગકાલ આવ્યું  
નથી. નિધાણું સહિત વરતે છે તે માટે ॥૩॥ હવે જિણું પડિમાણું  
અંગ્ચણું કરેદ કરેદતા ॥ જુની પ્રતિ અધ્યે એટલોજ પાછ છે  
અને પાછાંતરે એટલો પાછ છે તે કહે છે ॥ નહાયા કયામલિ  
કરાયા કાયકોઉય અંગળ પાયથિતા, સુદ્રાપવિસાયં અંગલા-  
યં વત્થાયં । પવર પરિહિયા, મંઅણ ધરાઉ પડિ નિખમધ  
(ર) તા ॥ જેણેવ જિણું ધરે, તેણું ઉવા ગંચઈ (ર) તા ॥  
જિણુધરં અણુ પવિસ્સઈ આદોએ પરિણામં કરે ઈ (ર)

તા, વંદ્દી નમં સહતા. લોમહુથથગય પરામુસઈ (૨) તા, એવં  
જહા સુરિયાભો, જિણુ પડિમાઉ અચ્ચેઈ, તહેવ લાણુથબ્બ,  
જવ પૂવ ડહુક્તા; વામ જાણુ અચ્ચેઈ, દાહિણુ જાણુ ધરણુ-  
તલાંસિ નિહુંકુ, તિકખુતો સુદ્ધાણુ ધરણીતલાંસિ, નિમઈ  
ધસિ અચ્ચણુમઈ કરયલ જવ તિકુ, એવં વયાસી, નમો-  
શુણુ અરિહંતાણુ ભગવંતાણુ જવ સંપત્તાણુ, વંદી નમં  
સઈ, જિણુધરાઉ પડિનિખમઈ, એટલા સુધી પાછાંતર છે. ૩૩  
નહાયા૦ વાચનાંતર પાઠ છે. નહાયા કૃય અલિકમ્મા, કૃય કોઉ  
મંગળ પાયછિતા, શુદ્ધ પરેસાંદ મંગલાંદ વથ્થાંદ પવર  
પરિહિયા મંજણુ ધરાએ પડિનિખમઈ (૨) તા. જેણુવ  
જિણુ મંદિરે તેણુવ ઉવાગછીએ ॥ એટલે કેટલીક નવી પ્રતિમાંહિં  
જિણુધરે કેટલીક નવી પ્રતિમાંહિં જિણુમંદિરે છે. પણ નિર્ણય નથી.  
પણ જૂની પ્રતિમધ્યે જિણુધરે જિણુમંદિરે, એ પાઠ મધ્યે એકે  
પાઠ નથી. એટલું જ છે જિણુ પડિમાણુ અચ્ચણુ કરેઈ (૨)  
તા, જેણુવ આંતે ઉરે તેણુવ ઉવા ગંછીએ (૨) ધત્યાદિ પાઠ  
છે. પણ જિણુધરે જિણુમંદિરે એ પાઠ કોણકે પ્રક્ષેપ્યો જણુવો.  
કારણ કે ક્યાંક જિણુધરે ક્યાંક જિણુમંદિરે, એ પ્રક્ષેપ્યા વિના  
પાછાંતર ન હોય. એ મૂળ પાઠમાં ગણુધરના કરવામાં સમાસ ફેર  
વિના પાઠ ફેર ન હોય. જિણુ પડિમાણુ અચ્ચણુ કરેઈતા.  
અહીંં કેટલાક એમ કહે છે જે દ્રૌપદીએ તીર્થીકરની પ્રતિમા પૂજ.  
૧ અને પૂજ તે વેળા દ્રૌપદી સમદાષી (૨) અને સમકિતી ન હોય  
તો નમોથુણુ કેમ કહે ? તો સમકિતધારીનો જ ધર હતો. તે માટે  
ધરે દેહરાસર હતો. તો પૂજ પણ હતી એમ કહે છે. તેહનો શો  
ઉત્તર ? ધતિ પ્રશ્ને. અથ ઉત્તર :—જિણુ શાખે અર્થ ધણુા છે. જેમ  
મંસ શાખે માંસ કહીએ. તથા મંસ તે વનસ્પતિના અર્થ છે. તથા  
મંસ શાખે અવર્ણાવાનો અર્થ છે. દશ વૈકાલીકે, પિઠિમંસં ન  
અધિજના ॥ ધતિ વચનાત ॥ તથા સિદ્ધાંતમાં એક રાહુ દેવના

અગવતી સૂત્રે સતક ૧૨ મે ઉદ્દેશો ૬ દુનવ નામ કહ્યાં છે. તે મધ્યે ભગર ૧ મછર ૨ નક ઉ આહ ૪ દિલી ધત્યાદિક જલચર જીવને નામે નામ છે. પણ અહિં જલ કેમ કહીએ? તે માટે શખદ એક પણ અર્થ ધણ્ણા. સર્વ જીવ ગામ શખદે આવે. ત્યાં માંસ કહે, તો મૃષાવાદ લાગે. અર્થનો અનર્થ થાય. પણ અવસર પ્રસ્તાવ હેઠી અર્થ કરે તો હોષ ન લાગે. તે માટે કેટલાક છલ શખદમાં ભૂલ્યા. ગાથા ॥૧॥ જિણુ વયણે ન કુસલા, જિણુવયણું પરમત્થયં ન જાણુંતિ. સદ્ગલેણુ છલિયા, ભાસાંતિતે અલિય વયણાઈ ॥ ૧ ॥ ધતિ જિણુ કહેતાં શ્રી વીતરાગનાં વ૦ વચનને વિષે, ન૦ નહીં, કુ૦ કુશલ જાણા, જિ૦ વીતરાગનાં વચનનાં, ૫૦ પરમાર્થ નથે, ન૦ ન જાણે, સ૦ શખદ છળ ॥ જિન પડિમા રૂપ તે । છલ શખદ તેણે કરી છ૦ છલ્યા ભડકયા, તેણે કરી ભા૦ કહે છે, અજાણુપણે, મિથ્યાત્વ મોહનીને વશે કરી, અ૦ અલીક મૃષા વચનોને, જિણુ પડિમા શખદે તીર્થેકરની પાડમા ॥ ધતિ ॥ એહવા મૃષાવાદ ઓલે છે. ને જિન વચનને વિષે અજાણુ પુરુષ છે તે. હવે ને જાણુ પુરુષ છે તે શે અર્થ કરે છે? તે લખીએ છીએ.

જિન એહવું ને નામ છે તે ॥ ૧૪ પ્રકારે જિન નામ કહી ઓલાવે ॥ તે સંક્ષેપમાં લખીએ છીએ ॥ શ્રી તીર્થેકરને જિન કહીએ ॥ ૧ ॥ શ્રી સામાન્ય કેવળીને જિન કહીએ ॥ ૨ ॥ અવધજાનીને જિન કહીએ ॥ ૩ ॥ મનપર્યવ જ્ઞાનીને જિન કહીએ ॥ ૪ ॥ આરમા જીવસ્થાનકના ધરણુંહાર સાધુને જિન કહીએ. ॥ ૫ ॥ ચૌદ પૂર્વધરને જિન કહીએ ॥ ૬ ॥ દશ પૂર્વધરને જિન કહીએ ॥ ૭ ॥ ૧૧મા જીવણાણાના ધરણુંહાર સાધુને જિન કહીએ. ॥ ૮ ॥ આગલી ચઉફીસી આવતીને જિન કહીએ ॥ ૯ ॥ જિન નામે દીપ છે તેહને જિન કહીએ ॥ ૧૦ ॥ જિન નામે સમુદ્ર છે તેને જિન કહીએ ॥ ૧૧ ॥ કંદર્પને જિન કહીએ ॥ ૧૨ ॥ નારાયણુઝને જિન કહીએ ॥ ૧૩ ॥ બૌદ્ધને જિન કહીએ ॥ ૧૪ ॥

એ ચૌદ મધ્યે કંદપને જિન કહીએ એમ કહું તે કયા અંથની સાક્ષી કહીએ, તે લખીએ છીએ.

હેમી અનેકાર્થી ( હેઠો નામભાલા હેમાચાર્ય હૃત ઉ. ૪ ) મધ્યે કહું છે. વિતરાજૌ જિનો ચૈવ નારાયણો જિનસ્તવા ॥ કંદપોચ જિનોસ્ત્યાત્ જિનસામાન્ય કેવળી ॥ ૧ ॥ અર્થ=વિન અરિહંત સકળ કર્મ કષાય મોહ પરિસહ ૨૨ જીતે, તે માટે જિન ॥ ૧ ॥ વાસુદેવ તરતમાંહો ઉ ખંડ ભુજયે જીતે તે માટે જિન ॥ ૨ ॥ કામહેવે સકળ સંસારને જીત્યો તે માટે કંદપને જિન કહીએ ॥ તાં સામાન્ય કેવળીએ પણ ચાર ધનધાતીયા કર્મ જીત્યા, તે માટે જિન કહીએ. દ્રૌપદી તે વેળા વિષયાર્થી છે, લરથાર સારો પામું એહવી છંચા છે તે છંચાએ જઈને જિન પડિમા પૂજુ છે. તો તે અવસર દેખતાં જિન શબ્દે કામહેવની પડિમા પૂજુ છે, પણ તીર્થ-કરની પડિમા પૂજુ કહી છે તે ખોંડ ॥ ૧ ॥ વળી જહુ સૂરિયાલો । જિન પડિમાચો અચ્ચેછ, એમ સૂરિયાલ દેવતાએ જિનપડિમા પૂજુ તેમ દ્રૌપદીએ જિન પ્રતિમા પૂજુ, સૂરિયાલની જિનપડિમા તે કોની પડિમા ? છતિ પ્રશ-

ઉત્તર-સૂરિયાલે જિનપડિમા પૂજુ તે જિનપડિમા કોઈ તીર્થ-કરની પડિમા નહી. તે કહીએ છીએ.

એ જિનપડિમા શબ્દે તીર્થકરની પડિમા નહિ. તે કેમ જણાય. ને સૂરિયાલે જિનપડિમા પૂજુ છે ત્યાં આગળ ૨-૨ જક્ષપડિમા ૨ નાગ પડિમા ૨ ભૂત પડિમા ધત્યાદિક કહી છે. નેટલી સારવતી, જિનપડિમા તેટલી સધળી એવી. સર્વ થઈને ૪ નામ પણ પાંચમું નામ ભલે નહિ. તેણે કરી જણાયું ને તીર્થકરની પડિમા નહિ. તીર્થંકર પાસે, જક્ખાદિકની પડિમા ન હોય, કદાચિત ગણુધરાદિકની હોત તો, વિશ્વાસ ઉપજત, વળી વિચારતાં તે તો ન કહી. તો તીર્થંકરની પડિમા નહિ. અને ભળાવી તો જહુ સૂરિયાલો,

જિન પડિમાંએ અવચેદ, સુરિયાલે જિનપડિમા અર્થી. લલાવી તે માટે એ જિનપડિમા, તે ધરખારીની ઉપમા, બોગી, નિભોગીની ઉપમા હેવાય. તીર્થંકર તો અભોગી, અભોગીને તેહવી પૂજા નહિ તે માટે, તીર્થંકરની પડિમા નહિ. તથા ક્રોધક કહેશે જે, તો સુરિયાલ પ્રમુખ હેવ સંખાંધી, પડિમા સાસવતી માટે. કયા જિન તીર્થંકરનું નામ કેવાય ? નામાદિ ૪ નિક્ષેપામાંહિ, તે એ કે નિક્ષેપામાંહિ નહિ. તે માટે ક્રોધ તીર્થંકરનું નામ ન કેવાળું. ઇષ્ટબાનન પ્રમુખ (૪) નામ તે ક્રોધ પ્રત્યેક (૨) પડિમાનું નામ નહિ. તો પૂછુંછે છીએ. દ્રૌપદીએ પૂજા તે તો અશાસ્ત્રી, ૨૪ તીર્થંકર મધ્યે, કયા તીર્થંકરની ? તે નેમનાથ પ્રમુખ, આગલ્યા પાછલ્યા ક્રોધ તીર્થંકરનું નામ લઈને ન કહ્યું, કે અમુક તીર્થંકરની પ્રતિમા. ॥ દ્રૌપદી સરીખી પૂજનારી અને તીર્થંકર સરીખા હેવાધિહેવની પૂજા, ત્યાં પૂજનારીનું નામ કહ્યું અને તીર્થંકરનું નામ ન કહ્યું તે શું ? વળી પ્રદુઃખની ૮ પદરાણી ૨ વધુ ॥ એવં ૧૦ ॥ ગૌતમ કુમારાદિ ૪૧, થાવચ્ચા પ્રમુખ ૧૦૦૦ છત્યા-દિક નેમનાથ પાસે દીક્ષા લીધી. એમ ધણે સ્થળે ચારિત્રના કેનારા ત્યાં ગુરુનું નામ કહ્યું. ક્યાંક તીર્થંકર જ્યવંતા નહી ચાલ્યા હોય ત્યાં સ્થવિર પ્રમુખ સમુચ્ચયે કહીને પણ એમ કહ્યું. અને અહિં ક્રોધ તીર્થંકરનું નામ, અમુકની પડિમા, અથવા તીર્થંકરનું બિરદ પણ ક્યાંછું ન કહ્યું. સૂર્યાલે પૂજા તે પડિમા ૨ જક્ષની, ૨ નાગ પ્રમુખની પડિમા છે. એ બિરદ તો તીર્થંકરનું નહિ. દ્રૌપદીને તે લળાવી તેણે કરી જણુંછે છીએ. જે તીર્થંકરની પડિમા નહિ. તીર્થંકરની હોત તો નામ કહેત. ॥ ૩ ॥ આથી એ તીર્થંકરની પડિમા જણ્ણાતી નથી. જે આટલાં પહેલા ૧૫ ક્ષેત્ર મધ્યે અનંતી ચોવીસી, અનંતા તીર્થંકર કલ્યા. વર્તમાન આ ચોવીસીના ૨૪ તીર્થંકર સર્વ શ્રાવક શ્રાવિકા થઈને અનંતા અનંત ભેટ થયા. જે તીર્થંકરની પ્રતિમા પૂજાતી હોત તો, પૂર્વે એને

ક્રોદ્ધાચે ધડવી હોત, ભરાવી પૂજ હોત, તો તો સૂત્ર પાડે તેહનાં નામ દામ જિન સંકાચે ચાલત, પણ જે તીર્થુંકરની પડિમા નહીં. દીપ, ધૂપ પુષ્પાદિકે પૂજન ન હોય. છકાય આરંભ માટે. જિનમતનું મંડાણું તો દ્યા ઉપર છે, માટે જિન પડિમા પણ, તીર્થુંકરની પડિમા નહીં. (૪) તથા વળી પૂઢીએ છીએ. જે તીર્થુંકરની પ્રતિમા છે તો કહો. સૂત્રપાડ બણીને એ ક્રોણ મિથ્યાત્વીએ ધડી? શું સમકિત દાણીએ ધડી? ॥ ૧ ॥ ધડચા પછી તે વંદનીક, કિંવા પ્રતિષ્ઠા કીધા પછી વંદનીક? (૨) તે પ્રતિષ્ઠા કરે તે સંયતિની કરે કિંવા અસંયતિની કરે? ॥ ૩ ॥ કર્દ રીતે પૂજવા ચોગ્ય ઇલદાયક થાય? તે સૂત્ર મધ્યે કહ્યું હોય તો પાડ બણીને કહો. જે બણી સૂત્ર મધ્યે સમકિત પામીને પ્રવર્તનની વિધિ:-૧-૧૨ પ્રત ૧૧ પડિમા, સામાચિક, પોષા પ્રમુખનો વિધિ સૂત્રપાડ તથા પંચ મહાવત, ૧૨ લિક્ષ્ય પડિમા, રત્નાવળી પ્રમુખ તપ, અણુસણુ એ સર્વની વિધિ અને તેહના સૂત્ર પાડ. તેમ જે પુહગલની પ્રતિમા કરી અને પૂજનિક થાય. એહવા ગુણુ આણુવા માટે ૧૦૮ કુપના પાણી ૧૦૮ વનસ્પતિ ફૂલ, અતકનામ દામેં પ્રતિષ્ઠા કરવા માન મધ્યે છત્યાદિ પ્રમુખ ધણું સાવદ્ધ કર્તવ્ય આવે છે. પ્રતિષ્ઠા કલ્પ મધ્યે ક્રોણિકે ધાત્વા છે. તેહનો વિધિ સૂત્ર પાડે આલાવા (અધિકાર) જોઈએ. સૂત્ર મધ્યે જેહ બણી જિનમાર્ગનું મંડાણું સર્વ તીર્થુંકર ભાષિત સૂત્રપાડ ઉપર અને તેહની પ્રતિમા મુક્તિ પદ આપે. તેહની વિધિ સૂત્રપાડે સર્વથા જોઈએ. તે તો સૂત્ર મધ્યે વિધિ પાડ ન મળે. મૂક્તિ ગ્રામિને અથેં ચતી હોત તો વિધિ સૂત્રપાડે હોત. તે માટે એ તીર્થુંકરની પ્રતિમા એહવી પ્રતિત નજ આવે અને વર્તમાનકાલે કરનારે પ્રતિષ્ઠા કલ્પ કીધો છે. તીર્થુંકરના ગુણુ આણુવા માટે નહિં. તે માંહિ તો ૧૦૮ કુપના પાણી ૧૦૮ સમૂલીવનસ્પતિ પ્ર. ધણું આરંભના પાડ લખ્યા છે. તે જેતાં તો સર્વ કામી વસ્તુ જણ્યાય. તેણે કરીને એ દ્રૌપદીએ

પૂજ તે તીર્થીકરની પડિમા જણ્યાતી નથી. વિવેક હોય તો વિચાર-  
નો. ॥ ૫ ॥ એટલે ૫ જવાબે કરી તીર્થીકરની પ્રતિમા નહિ  
પણ કામહેવની પ્રતિમા છે.

હવે સૂત્ર પાડે દેવતાની પ્રતિમા હરે છે તે લખીએ છીએ.  
તથા દાણાંગે તચ્ચે જિણ્યા પક્ષંતા, અવધિજ્ઞાની ૧ મનપર્યવ-  
ર્શાની ૨ કેવળજ્ઞાની ૩ એ ત્રણુને જિન કહીએ. કેવળજ્ઞાની અને મન-  
પર્યવર્શાનીની તો એ પડિમા નહિ. જે લખ્યું એ ૨ જિન નીરારંભી,  
૪ કાયને આરંભે લક્ષ્ણ પૂજ માને નહિ. પ્રઢે પણ નહિ.  
અનુમોદે પણ નહી. ધણ્યા આવક શ્રાવિકાએ તીર્થીકરને વાંદા, પણ  
કૂલની માલા ધાલી નહિ. દીપાદિક ન કીધા તો જાણ્યીએ છીએ  
જે જિન પડિમા કહી તો જિન શખ્દે અવધિજ્ઞાનીને કહીએ.  
વિલંગજ્ઞાનીને પણ અવધિ કહીએ. યથા મિથ્યાત્મી દેવતા ઉહ્ણિણ્યા  
આલોચેમાણે અરણિકાદિ પ્રસુખને અધિકારે તથા અવધિવિલં-  
ગનું દર્શન પણ, અવધિ દર્શન, તે માટે અવધિવિલંગજ્ઞાનીમાણે  
સર્વ ૪ જાતિના દેવને જિન કહીએ. તે જિન સંબંધી તે અંગીકાર  
કીધા તે માટે, જિન પડિમા સંબંધી વાચી નામઃ-નેમ દેવદત્તનું  
ધર એ જિન સંબંધી નામ જણુવું. પણ દેવદત્તની મૂર્તિ, એમ જ  
સમજવું, તે એ મૂર્તિ આકાર છે. કોઈ દેવતાની પડિમા તે જિન-  
પડિમા. તે જિન તો છ કાયના આરંભી અનિરારંભી પૂજા, લક્ષ્ણ  
માને. નાગભૂત યક્ષાદિકની પૂજા પ્રત્યક્ષ આરંભાદિકે હોય છે. તે  
માટે જિન શખ્દે અવધિ વિલંગજ્ઞાની કોઈ દેવવિશેષ તેણે માની  
તે પણ પોતાની કીધી. તે માટે તેહની પડિમા તે જિન પડિમા. પણ  
તીર્થીકરની નહિ. જે તીર્થીકરની પડિમા, તો એવડો છ કાયનો આરંભ  
કુમ? પ્રશ્ન વ્યાકરણ મધ્યે તો દ્વા તે પૂજા કહી છે. યથા પૂજા  
જનો ધતિ વચ્ચનાત ॥ પૂજા યજ તે જોતાં એ તીર્થીકરની પ્રતિમા  
નહિ. એ તો સૂત્રની સાખે. જે જિન શખ્દ ૩ ઓલે પ્રવર્તો. તે  
મધ્યે અવધિજ્ઞાની પણ આણ્યા. તે માટે સૂત્ર સાખે. દેવદત્તને

જિન કહીએ. અવધિ માટે; જિન શાખદના એટલા અર્થ કહ્યા છે.  
યદુકતા વિતરણો જનોહેવ: ॥ ૧ ॥

જિન સામાન્ય કેવળો ॥ ૨ ॥ જિન કંદર્પ વાસસ્તિ ॥ ૪ ॥  
૧૧ ઈસ્યાદિક ભધ્યે કંદર્પ દેવનું ભંદિર તથા આમહેવનું ભંદિર દ્રૌપદીને  
પરણવાના અવસરને અનુમાને જાણીએ છીએ. વરની વાંચ્છા છે માટે એ  
જિન પડિમા તીર્થીકરની નહિ. ને જાણી ધરેથી પડિમા ધડાવી માંડે  
ત્યાંથી નીપજે અને નીપજા પછી પ્રતિકા કરે ત્યાં સુધી પણ છ કાયનો  
આરંભ ચાલ્યો જથ. તો તીર્થીકરની પડિમા કેમ મનાય? ॥ ૬ ॥  
વળી કેટલાક ઓલ્યા ને, એ પૂર્વોક્ત શ જવાએ કરી એ દ્રૌપદીએ  
કંદર્પદેવની પડિમા પૂજ કહી તે સત્ય, પણ સૂત્રમધ્યે કંદર્પદેવનું  
ચિનહ કલ્યાણ હોય તો કહો. જેથી જાણીએ. કે એ કંદર્પદેવની જ  
પડિમા. ચિનહ વિના કેમ જાણીએ કે એ દેવતાની જ પડિમા?  
ઈતિ ચિનહ પ્રશ્ન:—

ઉત્તર-સૂત્ર ઉવવાઈ ભધ્યે, પૂર્વુભદ્ર ચૈત્યને આધકારે, યક્ષનું  
વર્ણન કર્યું છે તે લખીએ છીએ.

ણાએ સત્થતેસજણુસંઘટેસ પડાગે પડાગાઈપડાગમંડિ-  
એ સલોમહૃથે લોમભય પ્રમાર્જન ચુક્તાં ઈતિ ઉવવાઈ વૃત્તૌ  
॥ ઉ. ૧૨ ॥ ત્યાં ઉવવાઈ ઉપાંગે કહ્યું, કે તે યક્ષ કેવો છે?  
સલોમહૃથ્થ કહેતાં લોમહરસ પુંજણી, મોરપીંછી, તેણે કરી સહિત  
એટલે પૂર્વ લદ યક્ષની પડિમાને મોરપીંછીની પુંજણી છે. તે મોર  
પીંછીની પુંજણીએ, ને ઝાઈ તેહના સેવક પૂજના કરનારા હોય તે,  
તે મોર પીંછીની પુંજણી લઈ પ્રતિમાને પૂંજે. પૂંજને પછી પૂજ  
કરે. તેમ અહીંયા પણ દ્રૌપદીએ આલોએપણામં કરેધ (૨) તા  
વંદ્ધ ણુમંસાઈ (૨) તા; લોમહૃથગં પરામુસાઈ એટલે અહીંયા  
દ્રૌપદીએ પણ મોર પીંછીની પુંજણીએ પુંજયા પછી પ્રતિમાની અર્ચા  
કરી તે માટે તે ઉવવાઈ ઉપાંગને મેળે એ દ્રૌપદીની પડિમા તે  
દેવતાની પડિમા; પણ તીર્થીકરની પડિમા નહિ. ॥ ૭ ॥

વળી કોણ પૂછે જે તીર્થકરના ભાગ્યમાંહિ મોરપીંછીની પુંજણી રાખવી ધટે કિંવા ન ધટે? ઈતિ ગ્રશ-અથ ઉત્તર-તીર્થકરના ભાગને વિષે મોરપીંછીની પુંજણી રાખવી ન ધટે. તે સાક્ષી પાંચમા ઢાણ્ણા મધ્યે પાઠ છે જે નિર્ગ્રથનિર્ગ્રથીનીને પાંચ જતિના રન્નેહરણુ રાખવા કહ્યા છે તેના નામ. ઉનિનાએ૦ ઉનનો ૧ ઉદ્દિનો ૦ ઉંટ-ના વાળનો ૨ સાણુએ૦ (૩) શાણુનો પંચાપિચિયએ૦ (૪) તુણુ કુટીનો ॥૪॥ મુંજપિચિયએ૦ (૫) મુંજ કુટીત એ પાંચ રન્નેહરણુ મધ્યે ઉત્સર્ગ માર્ગ ઉનનો રન્નેહરણુ કરવો. અપવાહે આગલા ૪ નો પણુ કરવો. પણ મોરપીંછ યતિને રાખવો ન કલ્પે. તથા શ્રી પ્રશ્ન વ્યાકરણ પાંચમા સંવરદ્ધાર મધ્યે મોરપીંછ નામ લઈ નિષેધ્યા છે. નાથેઉણુ ઈતિ વચનાત એટથે સાધુને મોરપીંછની ના કહી છે. તો તીર્થકરની પ્રતિમા હોય તો મોરપીંછની પુંજણી ન હોય. અને દ્રૌપદીએ મોરપીંછની પુંજણીએ પુંજ તે માટે તીર્થકરની પ્રતિમા નહિ. ॥૮॥ વળી જે તીર્થકરની પ્રતિમા હોય તો ખોજન ઇરસ કરે નહિ. વેગળેથી ગ્રણામ કર્યા હોત તો વિશ્વાસ ઉપજત, પણ અહીં તો કહ્યું જે લોમ હૃત્થગં પરામુસદ્ધ તે માટે તીર્થકરની પ્રતિમા નહિ. પણ દેવની પ્રતિમા; માટે શરીરે ઇરસ કીધો. જિનરોહાની કથા મધ્યે સૂત્રપાઠ પંચપિયરોય, નંદી-સૂત્રે તે રોહે રાજ પ્રત્યે પોતાના પાંચ પિતા કહ્યા છે. તે રાજએ તે રોહાની ભાતાને પૂછ્યું છે. તે વારે ભાતાએ કહ્યું છે, કે જ્યારે હું નગર બહાર વૈશ્રમણ દેવની પ્રતિમા પૂજતી હતી ત્યારે તેના ઇપ પર મોહિત થઈને મેં સ્પર્શ કર્યા હતો. ॥૧॥ તે માટે એ સંસારિકની પૂજા, સંસારની અર્થી, પણ ધર્મમધ્યે નહીં. તેમ દ્રૌપદીએ શરીરે ઇરસ કીધો છે. તે દેવતાની પ્રતિમા માટે, પણ તીર્થકરની પડિમા જ નહિ. વળી વિશેષે જે મિથ્યાત્વો દુપ્દ રાજને ધરે અશાશ્વતી પ્રતિમા છે. અને લોમપુંજણીએ પુંજ કહી તે માટે એ મિથ્યાત્વીધરે મિથ્યાત્વ દેવનીજ પડિમા, પણ તીર્થકરની જ નહિ. ઈતિ

સત્યं ॥ ૧૦ ॥ ઈતિ જિન પડિમા. આશ્રયે ૧૦ પ્રત્યુત્તર  
પુરા થયા.

જિનપડિમા તે કામહેવની જ પડિમા. તે ઉપર ૬ હેતુ  
લખીએ છીએ. પ્રતિજ્ઞા. ૧ હેતુ ૨ દષ્ટાંત. ૩ ઉપનય. ૪ સમાચિ.  
૫ કારણ ૬ એ ૬ ના અર્થ નમિ પ્રવળયા અધ્યયન ઈ  
આ ઉત્તરાધ્યયનથો જાણવા. ૧ દ્રૌપદીએ પરણવાને અવસરે કામ-  
હેવના પડિમા પૂજી. ઈતિ પ્રતિજ્ઞા તે પક્ષઃ ॥ ૧ ॥ ૨ કોણું હેતુએ  
કામહેવની પડિમા પૂજી. મોરપીંછની પુંજણીએ પુંજી કહી તે માટે, કામ-  
હેવની પડિમા એ હેતુ ॥ ૨ ॥ ૩ કોણું દષ્ટાંતે, સાગરદાત સાર્થ-  
વાહની ગંગદાતા ભાર્યાને દષ્ટાંતે, જેમ ગંગદાતાએ ઉંઘરદાત જક્ષની  
પડિમા મોરપીંછીએ પૂંજી. પુત્ર વાંચ્છા જાણીને. તેમ  
દ્રૌપદીએ વરની વાંચ્છા જાણીને, કામહેવની પડિમા પૂજી. ઈતિ  
દષ્ટાંત. સાક્ષી વિપાક સૂત્ર અધ્યયન ૭ માં ॥ ૩ ॥ ૪  
ન્યાં ન્યાં મોરપીંછની પુંજણી ત્યાં ત્યાં કામહેવની  
પડિમા ઈતિ ઉપનય: ॥ ૪ ॥ ૫ તરમાત તથા ન્યાયેણું તે માટે તે  
ન્યાયે કરી દ્રૌપદીએ પરણવાને અવસરે, કામહેવની પડિમા પૂજી.  
ઈતિ નિર્ગમનં ॥ ૫ ॥ ૬ કિંકારણં, લોમ હુસ્ત પરામરશવિનં,  
કામહેવ પડિમા ન ભવં ઈતિ કારણં ॥ ૬ ॥ એ છ  
હેતુ કારણે કરી દ્રૌપદીએ કામહેવની પડિમા પૂજી. ઈતિ પ્રથમ  
પ્રશ્નનો ઉત્તર કહ્યો. જિન પડિમા આશ્રી. ૧૦ ઉત્તર કહ્યા.

હવે ખીને પ્રશ્ને કહ્યું હતું કે દ્રૌપદીએ જિન પડિમા પૂજી તે  
વેળા સમક્રિતધારિણી કિંવા નહિ. તેહનો ઉત્તર એ કે દૂપદ  
રાજનું ધર ભિથ્યાદદ્ધિનું દીસે છે. દૂપદ રાજદિ દ્રૌપદી સુદ્ધાં સર્વ  
ભિથ્યાત્ત્વી જાણાય છે તે એ ભૂતઃ-તતોણં સેદુવઅરેયા, કંપિલપુર  
નથરં, અણુ પવિસધ્ર (૨) તા, વિલુલં અસણું પાણું ખા  
ઇભં સાધમં, ઉવખડાવેદ્ધ (૨) તા. કોડંબિય પુરિસે સદ્વાવેદ  
(૨) તા. એવં વયાસી ગંભુરતુજ્ઞસે દ્વાણુપિયા,

અસણું પાણું ખાઈબં, સાધમં, સુરંચ, મજજું ચ, મંસં ચ,  
સિંહું ચ, પસનં ચ, સુખું પૂર્ખ, વત્થ ગંધ મહલાલંકારં ચ;  
વાસુદેવ પામોખાણું, રાય સહુસસાણું આવાસેસુ સાહુરહુ,  
તે વિસાહુરંતિ. એ સૂત્ર પાઠ મધ્યે કહ્યું ને દુપદ રાજએ મધ,  
માંસ મોકલ્યાં. તો વિચારી જુઓ કે પરણુતી વેળા, મધ માંસ  
સામરાં કેલબ્યા છે. તે તો સમકિતદષ્ટિ ન કરે. અને શાવક હોય,  
તો ત્રસ જીવ ઉદ્દેરી હણુવાના પચ્ચખાણુ હોય. તો માંસને અર્થે ત્રસ  
જીવને હણે કેમ ? તે માટે દુપદ રાજનું ધર જ ભિથ્યાત્વ દષ્ટિનું.  
વળી કોઈ પૂર્છે ને સમકિતદષ્ટિ રાજ થું માંસને અર્થે જીવ ન  
હણે ? તે કયા સૂત્રની સાક્ષી. ઉપાસક દશાંગ અધ્યયન ૮ મા મધ્યે  
કહ્યું જે:-તતેણું રાય ગિહેનયરે, અજ્ઞયા કયાઈ, અનાધાએ  
હુઠે આવિહેત્થા. અહિં એમ કહ્યું ને શ્રેષ્ઠિક રાજએ સમકિતદષ્ટિ  
માટે અમારીનો પડહ વગડાવ્યો. કે જેથી કોઈ ત્રસ જીવ ન મારે. તો  
પછી સમકિતદષ્ટિ હોય તે ત્રસને હણે ને માંસ કેલવે એ કેમ બને ?  
માટે તે દુપદ રાજ ભિથ્યાત્વી હીસે છે ॥૧॥ વળી કોઈ કહેશે કે પિતા  
ભિથ્યાત્વી હોય તો શું દીકરી સમકિતદષ્ટિણી ન હોય ? તેનો  
ઉત્તર:-ભિથ્યાત્વ અનાદિ કાળનું છે. અને સમકિત તો નવું  
પામે છે. તે માટે સૂત્ર મધ્યે કહ્યું નથી કે તે વેળા દ્રૌપદી સમકિત  
દષ્ટિણી હતી. અને શાવિકા પણ કહી નથી. તો ક્યાંથી કહીએ ?  
॥ ૨ ॥ વળી વિશેષે જે શ્રી નમિનાથ ૨૧ મા તીર્થકર  
અને શ્રી અરિષ્ટનેમિ ૨૨ મા તીર્થકરનું આંતરં ૫ લાખ વરસનું  
છે. એવડું આંતરં છે તે માટે. તે દ્રૌપદીને પરણુવાની વેળાએ નેમ  
પ્રલુના શાસનનું પ્રવર્તન થોડું થયું જણાય છે. જે પ્રવર્તન ધણું  
હોય તો ત્રસ જીવની ડિંસા એવડી ન હોય. વળી કોઈ પૂર્છે ને તે  
વેળા શ્રી અરિષ્ટનેમિ બાવીસમા તીર્થકરનું પ્રવર્તન હશે.  
તેનો ઉત્તર:-જે શ્રી અરિષ્ટનેમિ ૨૨ મા તીર્થકરનું પ્રવર્તન  
હોય તો શ્રી કૃષ્ણ વાસુદેવ સમકિતદષ્ટિ હોય. અને જે સમકિતદષ્ટિ

હોય તો માંસાદિ બોગવે નહીં. અને કહ્યું જે-તતેણું તે વાસુદેવ પામાભ્યા, તં વિપુલં અસણું પાણું ખાદિમં સાધિમં સુરંચ્ય અજજંચ્ય મંસંચ્ય સિંધુંચ્ય, પસન્તં ચ આસાએ માણુા ॥૪॥ વિહુ-રંતિ, એ સૂત્રપાઠને અનુમાને, તે વેળા કૃષ્ણજી સમકિતદષ્ટિ નહીં. અને માંસ બોગવતાં નરકતું આચુષ્ય બાંધે અને સમકિત છતે નરકતું આચુષ્ય ન બાંધે, તો એ સૂત્ર પાઠ કેમ મળે ? સમકિત છતે માંસ ન બોગવે એ સત્ય, એમ સિદ્ધાંત મળે તે માટે, તે વેળા કૃષ્ણજી સમકિતદષ્ટિ નહીં, પછી શ્રી નેમીશ્વરતું પ્રવર્તન થયું ત્યારે કૃષ્ણજી સમકિત પામ્યા. તે માટે તે દ્રૌપદીએ જિન પડિમા પૂજી તે વેળા સમકિતધારિણી નહીં. બાળક માટે ॥ ૩ ॥

હવે સૂત્રને પાડે તે વેળા દ્રૌપદી ભિથ્યાત્વી જણ્ણાય છે તે લખીએ છીએ. જ્યાં સુધી ભિથ્યાત્વ મોહનિ કર્મનો ઉદ્ય હોય ત્યાં સુધી સમકિત ન પામે. ભિથ્યાત્વ મોહનિનો ક્ષયોપશમ હોય ઉ પ્રકૃતિનો તે વારે સમકિત પામે. અને દ્રૌપદીએ પાંચ પાંડવ પાસે જઈને વરભાલા ધાલી. તે પહેલો ભિથ્યાત્વનો ઉદ્ય તે માટે, જિનપડિમા પૂજતી વેળા સમકિતદષ્ટિણીને એટલે જ્યાં સુધી નિદાન ભિથ્યાત બોગવીને, ક્ષયોપશમ નથી થયો ત્યાં સુધી સમકિત નહીં. તેણીએ નિદાન કીધું છે. તે અનુભાગ બંધનું. તે તો સાક્ષાત બોગવવું જોઈએ. પ્રહેશ બંધે બોગવે. એમ સમજવું જે નિદાન બોગવ્યા પહેલાં સમકિત ન પામે. તે માટે સમકિતદષ્ટિણી નહીં. ॥ ૪ ॥ વળી વિશેષે કરીને પરણ્યા વિના પાછલા દિન કુમારિકાવરથાએ તથા પરણ્યા પછી પણ પૂજી કહી નથી તે માટે એ પૂજ તે પરણ્યાના પ્રયોજનના કામની જણ્ણાય છે. તે માટે આગલી પાછલી પણ પૂજ નહીં, માટે તે સમકિતદષ્ટિણી નહીં ॥ ૫ ॥ તથા વળી એ વિશ્વાસ કે જો જિણું પડિમાણું અચ્યણું કરેઈ. એટલો જ પાઠ છે. અને વાચનાંતરે જહા સૂરિયાભાં નમોદથુણું છત્યાદિ.

મૂળ પાઠમાંહિ તો સુર્યાલને ભળાવી નહિં એ વિચારવાનું સ્થળ. અને વાચનાંતરે તો સુર્યાલને ભળાવી. સુરિયાલ તો અનંતા અભય કૃષ્ણપક્ષી મિથ્યાત્વીપણે સર્વ જીવ સુર્યાલ અનંતીવાર થયા. સમકિતદદ્ધિપણે થયા. તેણે તો ઉપજતી વેળા જિનપડિમા પૂજી, તે સર્વની કુળરીતિ. સમકિતદદ્ધિ મિથ્યાદદ્ધિની. કાંઈ વિગતાવિગત કહી નહિં. સુરિયાલની ઉપમા દેવાનું શું કારણું ? એ દેવતા સહુ સમકિતદદ્ધિ નહિં. જે ઉપમા દેવી હતી તો ઋષભદેવથી માંડિને મહાવીર સુધી સમકિતદદ્ધિ મનુષ્ય, આવક આવિકા મનુષ્ય, અસંખ્યાતા થયા, તેમાંના ક્રોધિએ પૂજી હેત તો તેની ઉપમા દેત. જેમ સિદ્ધાર્થ, તથા ત્રીશકાદેવી ગ્રસુખ. આવક આવિકા તથા ઉદાર્થ રાજ અને સુઆહુકુમારના પોસાને જેમ શંખ, કામહેવ તથા આણંદની ઉપમા આપી તેમ અહિ ઉપમા દીધી નહિં. આથી દ્રૌપદી સમકિતદદ્ધિ હતી, એવી પ્રતિત નથી આવતી. ॥ ૬ ॥ તથા વકી જે પૂર્વ કૃત સંસારના ભોગની અર્થી, ભોગનિયાણાની, પાંચ વરતી ભાગનારી. તેણીએ પરણુતી વેળા પૂજી. તેમ બીજી ક્રોધ ભોગનિયાણાની કરનારી તથા નિયાણાની અણુ કરણુહારી અને પરણુતી વેળા તેણીએ પૂજી એવી ક્રોધ દ્રૌપદી સરખી સૂત્રમાંહિ બતાવી નહિં, કે જેથી વિશ્વાસ ઉપજે જે એ નિદાન અનુદ્ય થકી. એટલે એ ઊ એકે કરી, દ્રૌપદી પૂજાની વેળાએ સમકિતદદ્ધિણી નહિં ॥૭॥ અત્ર એમ કહ્યું જે નિદાન ભોગવ્યા, ઉદ્ય આવ્યા વિના સમકિત ન પામે. તો દ્વારાશુત્રસ્કંધ મધ્યે કહ્યું જે પ્રથમના ૪ નિદાન મનુષ્યનાં ભોગ સંબંધી. તે ભોગવ્યા પછી પણ તે ભવ મધ્યે સમકિત ન આવે. ધર્મ સ્થાનભળવા જ અયોગ્ય. અને નિદાન ભોગવીને દક્ષિણગામી નારકી મધ્યે ઉપજે. આગળ દુર્લભએધી હોય. એમ કહ્યું તે તો મહ્યું નહિં. કારણુકે દ્રૌપદી તે ભવમધ્યે દીક્ષા પામી. કૃષ્ણ ગ્રસુખ અનેઝે ક્રોધ ૧૦ મું. નિયાણું દિસે છે. તેણે ભોગવ્યા વિના, અને ભોગવ્યા પછી

પણ સમકિત-દિક્ષા પામતા દીસે છે. દ્રોપદીની પેરે. તથા કૃષ્ણાદિકની પેરે. ઈતિ પ્રશ્ને:-

ઉત્તરઃ—નિયાણું તે ૬ સું દસમું નથી. નિદાન ભોગવ્યા વિના સમકિત ન આવે; તે પણ સત્ય. ભોગવ્યા પછી, જે સમકિત ન આવે અને આવે તેહનો એ લેદ, પજવણા પદ ૨૩ મા મધ્યે ઉત્કૃષ્ટ ભિથ્યાત્વના બંધની સ્થિતિ ૭૦ કોડા કોડી સાગરની અને સંશી જ્યધન્ય સ્થિતિ અનંત કોડા કોડી સાગરની, ભિથ્યાત્વ ન વાધે તો, અનંત કોડા કોડી સાગર વચ્ચેમાં રહી. તેમ સ્થિતિ જાણવી. ઉત્કૃષ્ટ ભિથ્યાત્વને રસે ઉત્કૃષ્ટો ૭૦ કોડા કોડી સાગરની સ્થિતિ બાંધે. તે ૩૦ મહા મોહનીના સ્થાનક કલ્યાં. તે ઉત્કૃષ્ટે રસે ઉત્કૃષ્ટ સ્થિતિ. ॥ ૧ ॥ મધ્યમ રસે મધ્યમ સ્થિતિ ॥ ૨ ॥ જ્યધન્ય રસે જ્યધન્ય સ્થિતિ બાંધે ॥ ૩ ॥ તે અવને વિષે સમકિતાદિક, ૩ વાનાં ન પામે તે ઉત્કૃષ્ટ રસનો ધણી, જ્યધન્ય રસનો ધણી, સમકિતાદિ ૩ યથાયોગ્ય પામે. અજના તે માટે. દ્રોપદીને ઉત્કૃષ્ટ સ્થિતિ નહિ. તે માટે દ્રોપદીને લવે દીક્ષા પામી. જે લણી ૩૦ મોહનીના સ્થાનક સેવતાં સહુ મહા મોહની જ બાંધે. કોઈ જ્યધન્ય મધ્યમ સ્થિતિ પણ બાંધે. પણ પાઠ મધ્યે તે મહામોહ કર્યું તે ઉત્કૃષ્ટ રસ આશ્રી. તેમ દશાશ્રુતસ્કંધ મધ્યે કર્યું, તે પણ ઉત્કૃષ્ટ રસની સ્થિતિ આશ્રી. વાસુદેવ પ્રમુખ જ૦ મધ્યમની સ્થિતિ માટે સમકિત પામ્યા. દ્રોપદી પણ તેમ જ એટલે નિદાન ભોગવ્યા પછી સમકિતાદિ ૩ વાના પામે. પણ નિદાન ભોગવ્યાના કાલ પહેલાં, જ્યધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળાનો કોઈ સમકિતાદિકન પામે. એ ચાલણા કીધી. તેનો પ્રત્યુત્તર દ્રોપદી સમકિતદિષ્ટિણી નહિં. તે ઉપર ચાલણા સહિત ૮ ઓલ કલ્યા. ॥ ૮ ॥ વળી કોઈ પૂછે જે દ્રોપદીએ નારદ આવ્યો. તે વારે નારદ અસંજતીને અસંયતિ કલ્યો, આદર ન દીધો. તે વળા સમકિતદિષ્ટિણી કહીએ ? ઈતિ પ્રશ્ને:-

ઉત્તરઃ-નારદને આદર ન દીધો તે વેળા તો નિયાણું ભોગકાળે આંધું છે. તે માટે સમકિતદિષ્ટિથી હોય, પણ પહેલાં સમદાચિ જણુંતી નથી. ધતિ ઉત્તર ॥ ૬ ॥ વળી અહીં કોઈ કહેશો કે ને દ્રૌપદીએ નારદને અસંજ્ય અવિરયો ધત્યાદિ કલ્યા માટે સમકિતદિષ્ટિથી નહિ. યથા ભગવતી શતક ૧૮ માં ઉદેશા ૮ માં ભગવંત ગૌતમ-સ્વામીને અન્ય તીર્થીએ કહું છે; તુષણેણું અજઓ તિવિહુંતિ-વિહેણું, અસંયય, અવિરય ધત્યાદિ ઓલ કલ્યા છે. તથા ભગવતી શતક ૮ મે ઉદેશો ૭ મે અન્ય તીર્થીએ સ્થવિર ભગવંતને તિવિહુંતિવિહેણું અસંજ્ય ધસ્યાદિ કહેલ છે. તો અસંજ્ય અવિરય કલ્યા માટે દ્રૌપદી તે વેળા સમકિતદિષ્ટિથી કેમ? ધતિ પ્રશ્ને-અથ ઉત્તરઃ-ને દ્રૌપદી તે વેળા ભિથ્યાત્વદિષ્ટિથી હોય તો ભિથ્યાત્વી તાપસને અસંજ્ય અવિરય ધસ્યાદિક કેમ કહે? ભિથ્યાત્વી ભિથ્યાત્વીને અસંજ્ય ન કહે. સ્વયંમતિને કોઈ હીણો ન કહે. અને અન્ય તીર્થીએ ગૌતમ સ્વામીને અસંજ્યતી કલ્યા તે અન્ય તીર્થી ભિથ્યાદાચિ માટે અને દ્રૌપદી સમકિત દાચિ માટે નારદ ભિથ્યાત્વીને અસંયતિ કહ્યો. એટલે સમકિત દાચિ, ભિથ્યાત્વીને અસંયતિ કહે અને ભિથ્યાત્વી સમકિતદાચિને અસંયતિ કહે. માટે દ્રૌપદી તે વેળા સમકિતદાચિ છે. હવે સમાહાર જવાય કહીએ છીએ. એક નામ શાવક સૂત્રે નથી અને પાંચ ભરતાર આવિકાને કેમ કહીએ? ત્રણ વ્યવસાય કલ્યા છે. દાણાંગે, તે ધર્મ વ્યવસાય, તે સાધુજીને, ધર્મધર્મ વ્યવસાય મનુષ્ય તીર્થીને, ને ભણી અનુપ્રત પાળે તે માટે, અને વળી અધર્મ વ્યવસાય તે દેવતાદિ ૨૨ દંડક મધ્યે. તો દેવતા અધર્મ વ્યવસાયે, તેહને ભળાવી તે માટે દ્રૌપદી તે વેળા સમકિતદાચિથી નહિ. નિયાણું ભોગવ્યા પહેલા ધર્મઉદ્ય ન આવે. સૂર્યિયાભ અવિરતી છે તેહને ભળાવી છે. તો જણ્યાય છે કે તે આવિકા નથી અને જ્યારે પરણી ત્યારે ભઘમાંસ સામટાં કેળવ્યાં છે તે તે આવકને ત્રસ જીવ

ઉદ્દેરી હણવાના પર્યખાણુ હોય. વિવાહને કાળે તો ધણુ ભાંસ કેળાયા. એજ અધ્યયનમાં કહ્યું છે. જાણા હોય તે વિચારી જોને. ॥ ૧૦ ॥ અત્ર પંચાવયવર્ષ્ય હેતુ કારણુ મહા પ્રતિમા પૂજના અવસરે દ્રૌપદી મિથ્યા દશ્ઠિણી. ઈતિ પ્રતિજ્ઞા પક્ષં ॥ ૧ ॥ પૂર્વકૃત નિદાન ઉદ્ય બલવાન ઈતિ હેતુ ॥ ૨ ॥ કુમારાવરસ્થાએ વાસુદેવ વત, ઈતિ દશ્ઠાંત ॥ ૩ ॥ પટ્ટકાય મધ્યે ધર્મભુદ્ધિ વિના મિથ્યાત્વં ભવતિ. ઈતિ કારણું. એ પંચાવયવહેતુ કારણે કરી, દ્રૌપદી પ્રતિમા પૂજવાની વેળાએ મિથ્યાદશ્ઠિણી જાણુની. ઈતિ ખીજ પ્રશ્નનો જવાબ કહ્યો. ॥ ૧૦ ॥ હવે ત્રીજ પ્રશ્ને એમ કહ્યું હતું જે સમકિત ન હોય તો નમોથ્યુણું કેમ કહે? નમોથ્યુણું કહ્યું માટે સમકિતદશ્ટિ હતી. કેટલાએક એમ કહે છે તેનો પ્રત્યુત્તર સાંલણો.

જુની પ્રતિ મધ્યે નમોથ્યુણુંનો પાઠ નથી. પાઠ એટલો જ છે-  
 જિનપડિમાણું અચ્યાણું કરેઈ, જુની પ્રતિ મધ્યે તો એટલો જ  
 પાઠ છે, તેણે કરી જાણીએ છીએ જે નમોથ્યુણું કહ્યું નથી ને  
 નમોથ્યુણુંનો પ્રસ્તાવ પણ નથી દેખાતો, એવં જહા સુરિયાલો  
 જિણુ પડિમાએ અચ્યેઈ, તહેવ લાણિયંવંજવ ધૂવં ડહેઈ  
 વામંજાણુ અચ્યેઈ, દાહિણું જાણું, ધરણિ તલાંસિ નિષ્ઠું-  
 તિગુતો ઝુદ્ધાણું, ધરણિતલાંસિ, ઈસિ પચ્ચાણુમધ  
 કરયલ જવતિકદૂ, વંદ્ધ નમંસઈ એટલો પાઠાંતરનો પાઠ  
 ભાસે છે. પછી ડાણું કે સુરિયાલના અલાવાથી સુરિયાલને ભળા-  
 વી માટે પાઠાંતર પાઠ મધ્યે આટલો પાઠ પ્રક્ષેપ્યો ભાસે છે. જેમ  
 તેમ પ્રતિમા હરાવવા માટે, પણ અવસર જોયા વિના જહા સૂર્યા-  
 લનો પાઠ, નમોથ્યુણું કાંઈ અહિયા ન જાણીએ, યથા જહા  
 સૂર્યાલો પાઠ કહ્યો. અને સૂર્યાલે તો ત૧ બોલ પૂજયા.  
 તે કહે છે:-જિન પ્રતિમા પૂજ ૧ બારસાખ પૂજયું ૨

ઉત્તરંગ પૂજયું તે ઉંઅર પૂજયો। ૪ દીવડી પૂજુ પ મણી પીઠ પૂજ  
 ૬ ક્રહપાણીનો પૂજયો। ૭ વાવ પૂજુ ૮ પૂતળી પૂજુ ૯ ગદગ્રાકાર  
 પૂજયો। ૧૦ આરામ પૂજયો। ૧૧ વણુરાય પૂજયો। ૧૨ બારસાખ  
 પૂજુ ૧૩ થુલ પૂજયો। ૧૪ ચૈત્યવૃક્ષ પૂજયું। ૧૫ હથીયાર પૂજયા  
 ૧૬ પુરતક પૂજયાં ૧૭ પાવડીયારાં પૂજયા ૧૮ ત્રિક ચોક પૂજયું। ૧૯  
 પોળ પૂજુ ૨૦ વન પૂજયું। ૨૧ કાનન પૂજયું। ૨૨ ઉત્તંગ પૂજયું。  
 ૨૩ દંડ્બવજ પૂજયો। ૨૪ આલરણુ પૂજયા ૨૫ ઉત્પત્તિ સેનયા  
 પૂજુ ૨૬ તોરણુ બાર પૂજયું ૨૭ \*ચુચ્ચરચુચ્ચ પૂજયા ૨૮ પોળનું  
 તોરણુ પૂજયું ૨૯ ઉઘાનવન પૂજયું ૩૦ વનખંડ પૂજયું ૩૧ જાવ-  
 ધૂવ ડાઈ કહ્યું છે તે જાવ શખદ માટે એટલા બોલ દ્રૌપદીએ પૂજયા  
 હોવા જોઈએ, પણ અહિંયા એમ નથી. એ ૩૧ બોલ તો નહિ, પણ  
 એક બોલ જિણુ પડિમાનોજ પૂજયો માટે જહા સુરિયાલો એ પાછાં-  
 તર. જેમ એ ૩૦ બોલ પાછાંતર મધ્યે નહિ તેમ નમોાથ્યુણું પણ  
 નહિ. જે એ ૩૦ બોલ દ્રૌપદીએ પૂજયા માનીએ તો નમોાથ્યુણું  
 પાછાંતરનું મનાય. જહા સુરિયાલો કહ્યું માટે. સર્વ બોલ જેમ ન  
 આવે તેમ નમોાથ્યુણું પણ ન આવે. ॥૧॥ તથા વલી કોઈ  
 કહેશે કે, નમોાથ્યુણું કર્યાનો પાડ છે તે શું ન જોઈએ? નમોાથ્યુણું  
 કહે સમકિત દીસે છે. તેમ છતાં પાડ ઉત્થાપો છો? તેહનો  
 ઉત્તર કહીએ છીએ. યથાર્થ સદ્ગણ્યા વિના સમકિત ન કહીએ.  
 યથાર્થ સદ્ગણ્યા વિના નમોાથ્યુણું કરતા દીસે છે તેને શું સમ્યક્કદિષ્ટ  
 કહેશે? વિચારી જોજો. નમોાથ્યુણું કહે પણ સમકિત ન હરે. અનુયોગ-  
 દ્વારામાં કહ્યું છે કે: દોકાનાતર દ્વયાવસ્થકના કરણુંથાણ દીન પ્રત્યે વાર  
 એ આવસ્થક કરે, તે માંછી નમોાથ્યુણું કરે અને વિતરાગે સમકિતદિષ્ટ  
 ન કહ્યા. આત્મા બહાર કહ્યા. તો જુઓને જે કોઈ એમ કહે છે જે  
 સમ્યક્કદિષ્ટ ટાળી નમોાથ્યુણું કોણું કરે, તે વાત સુત્ર વિરુદ્ધ દીસે

\* જ્યાંથી ધણુ રસ્તા નીકળે તે ચોક-ચોંદું ધર્ત્યાદિ.

છે ॥ ૨ ॥ તથા શ્રી નંદીસૂત્ર માંહિ એમ કહ્યું જે ચૌદ્પૂર્વના ભણુનારને ભતિ સમી હોય, જવ દસપૂર્વના ભણુનારને પણ ભતિ સમી હોય અને નવ પૂર્વના ભણુનારને ભતિ સમી પણ હોય અને ભિથ્યાત્ પણ હોય એટલે નમોત્થુણું આદિ ધણા ગ્રંથ ભણે પણ ભતિ ભિથ્યાત્વી હોય અને સમી પણ હોય તો એ મેળે જોતાં જે એમ કહે છે જે જે સમ્યક્ષદાધિ ટાળી અનેરા કોઈ નમોત્થુણું ન કહે તે વાત સૂત્રથી વિરુદ્ધ દીસે છે તથા પ્રત્યક્ષ પ્રમાણુ પ્રમુખ ધણ્ણાએ નમોત્થુણું કહે છે, તે કાંઈ સમ્યક્ષદાધિ જણ્યા નથી. ડાઢા હોય તે વિચારી જોજે ॥ ૩ ॥ તથા દેવતા સમ્યક્ષદાધિ તથા ભિથ્યાત્વી સિદ્ધાયતનને વિષે પ્રતિમા આગળ નમોત્થુણું કરે છે તે શ્રી સિદ્ધાંતને મેળે રાજ્યસ્થિત સહાયીએ છીએ જે ભણ્ણી ઉપજતી વેળાએ રાજ્યસ્થિત માટે અનેક વર્સતુની પૂજા તથા પ્રતિમા આગળ નમોત્થુણું ભણું ૧ વાર કરે છે અને જે ધર્મસ્થિત હોય તો વારંવાર શું ન કરે ? તથા સમ્યગ્દાધિ ભિથ્યાત્વી મધ્યે સમ્યગ્દાધિ નમોત્થુણું કરત અને ભિથ્યાત્વી ન કરત, તો ધર્મ સ્થિત તથા તે પર બીજું કરે છે તો ધર્મસ્થિત કેમ કહિએ ? તથા નવારીવેકે અને પાંચ અનુત્તાર વિમાનને વિષે રાજ્યસ્થિત નથી તો પ્રતિમા પણ નથી. અને વળી પ્રતિમા આગળ નમોત્થુણું કરતાજ નથી. તે પ્રતિમા અપૂર્ણ રહે છે. પરે પણ નથી લાગતા, વાંદતા પણ નથી, તો એમ જણે છે એ ક્લોકસ્થિત છે, પણ ધર્મસ્થિત નથી ॥ ૪ ॥

વળી સૂર્યાલનું નમોત્થુણું તે ક્લોકાતર પક્ષ મધ્યે નહિ. તે એ સૂર્યાલ પહેલા અવ્ય જીવ, અભ્ય અલાભ્ય ભિથ્યાદાધિ પ્રમુખ ૧૨ ઓલવાળા સૂર્યાલપણે અનંતીવાર ઉપજયા. તેણે સર્વે નમોત્થુણું અનંતીવાર કીધાં, સમકિતદાધિ તો તીર્થકરનો ભાવ પડિમા ઉપર ન આણે પણ અલાભ્યભિથ્યાત્વી સૂર્યાલ પણ જિન પડિમાને તીર્થંકર ન જણે અને નમોત્થુણું પણ

તીર્થકરના લાવ આણી ન કરે. એહુને પરંપરા રીતી છે. જે નમોત્થણું સમકિત દષ્ટિતું જ કર્તવ્ય સ્વરૂપ હોત તો, અભિવ્યભિત્થયાદદ્વિ સુર્યાલે કયાં કયાં કીધું અનંતખુતાને આલાવે, અનંતીવાર ઉર લાખ પ્રમુખ વિમાને સર્વ જીવ ઉપજ્યા. ॥ ૫ ॥ અનુત્તર વિમાન વર્જને સર્વ જીવ વિમાને દેવપ્રમુખ પણે ઉપજ્યા. તે પહેલા સુર્યાલના કહેણુંની પરંપરાએ એણે પણ કીધું. એ કુળ પરંપરા.

લોકોક મધ્યે પણ તીર્થકર જાણીને પડિમા આગળ કારણે તથા તીર્થકરનો લાવ આણી સમકિત દષ્ટિએ નમોત્થણું નથી કીધું. તીર્થકર જાણી કરે તો ભિથ્યાત્ લાગે. જેમ ભરતેશરે ૧૩ અદમ કીધા. અભયકુમારે અદમ કીધા. કૃષ્ણજીએ અદમ કીધા. તેને જે લોકોત્તર જાણે તો ભિથ્યાત્ લાગે. એ નમોત્થણું તો પદાભિષેકને આરણુકારણ મધ્યે જાણું. ઉપર ઓલ પૂજયા તે સર્વ આરણુકારણ મધ્યે નિર્જરાનું કારણ નહિ. એ નમોત્થણું એજ સ્થળ પૂર્વે સર્વ ભવ્ય અભિવ્યાદિક સુરિયાલ થયા તેમણે કહ્યું તે માટે. એ ન્યાયે પણ કહ્યું. તે પડિમા તિનાણું તારયાણું કાંઈ નથી. અને તે આગળ કલ્યા માટે લોકોત્તર ગુણો ઉપજે. પણ શાતી થાળી મધ્યે લોજનવત્. તે માટે એ નમોત્થણું પૂર્વના સર્વ સુરિયાલની પરંપરા માટે, લોકિક કર્મબંધન, પણ નિર્જરાનો હેતુ નહિ. સ્તુતિમંગળનો લાલ એ મધ્યે નહિ. જેમ કોઈક નમોકાર ગણીને ચાલે તે આરણુકારણ મધ્યે તેમ એ સુરિયાલે નમોત્થણું કીધું. તે પદાભિષેકના આરણ કારણ મધ્યે, જાણું. જેમ એ સુરિયાલે લોકિક મધ્યે નમોત્થણું કીધું તેમ દ્રૌપદીએ પરણુતી વેળા જિણુ પડિમા આગળ નમોત્થણું કર્યું હશે તો આરણ કારણ લોકિક મધ્યે, પણ લોકોત્તર ગુણ ન ઉપજે. કર્મબંધનો હેતુ જાણુવો. જહા સુરિયાલો કહ્યું માટે. સુરિયાલના નમોત્થણુંનો જવાબ લખ્યો છે ॥ ૫ ॥

નમોત્થુણં એ છળ શાખદ માટે ભૂલ્યા. પ્રતિમા આગળ દેવતાએ તથા દ્રૌપદીએ નમોત્થુણં જાવ સંપત્તાણં કહ્યું તેથી કાંઈ સિક્ષને નથી કીધું. તે ભણી વિમાનના અધિપતિ, પદાલિષેક પછી એકવાર કરે તે દેવતા, અભ્ય ૧ અભ્ય ૨ સમકિતદષ્ટિ ઉ મિથ્યાત્વ દષ્ટિ. ૪ સુલભ બોધી. ૫ દુર્લભ બોધી. ૬ આરાધક, ૭ વિરાધક. ૮ પરિત્ સંસારી. ૯ અનંત સંસારી. ૧૦ ચરિમ. ૧૧ અચરિમ. ૧૨ એ બાર જતિનાં વિમાનાધિપતિ હોય. જે ભણી આ ૧૨ બોલના નમોત્થુણં સુરિયાલ હોય તે ભણે. એ કુળ પરંપરા સ્થિતિ બંધ માટે કરે, એ સંજ્ઞા માત્ર, ધના અણુગારાદિક તથા આણુંદાદિક શ્રાવકે નમોત્થુણં અરિહંત સિક્ષને કીધા છે, તેમ દેવતા દ્રૌપદીનાં ન જણુવા. એ છલ શાખદ માટે ભૂલ્યાનું નહિ ॥ ૬ ॥ તથા શાખદ એક અને અર્થ-માંહિ દેર ધણો. એક કર્મ નિર્જરાનો હેતુ અને એક બંધનો હેતુ, જેમ શંખશ્રીપાસકે પોસો કર્યો કહ્યો છે. ભગવતી થતક. ૧૨ ઉદ્દેશે ૧ જેણું પોસહસાલાએ તેણું ઉવાગચ્છ્ય (૨) તા. પોસહસાલાં અણુપવિસસધ (૨) તા. પોસહસાલાં પમજજ્ય (૨) તા. ઉચ્ચાર પાસવણ ભૂમિએ પડિ લેહેઠ (૨) તા. (૨) દલલ સંથારગં સંથરદ્ધ (૨) તા. (૨) દલલ સંથારગં દુર્લહ્ય (૨) તા, પોસહસાલાએ પોસહિએ બંધયારીએ, ઉમ્ભૂક્ષમણિ સુવણે, વયગય માલાવણુગાવિલેવણે, નિખિત સત્ય મૂસલે, એગેઅભીએ દલલ સંથારે ઉવગએ, પકિખ્ય પોસહં, પડિજાગરમાણે વિહુરંતિ, એ શંખશ્રાવકનો અધિકાર. હવે ભરત રાજને અધિકારે, જંયુદ્રીપ પત્રતિએ:-તતેણંસે ભર-હેરાયા, અભિસેખાઉ હૃતિથરયણાએ, પચ્ચોરૂહંતિ (૨) જેણું પોસહસાલા, તેણું ઉવાગચ્છ્ય (૨) તા. પોસહસાલાં અણુપવેસધ (૨) તા. પોસહસાલાં પમજજ્ય (૨) દલલ સંથારગં સંથરદ્ધ (૨) તા, દલલસંથારગં દુર્લહ્ય (૨) તા,

માગહંતિથ કુમારદેવસસ. અઠમ લતાં પડિ ગિનહૃદ (૨) તા. પોસહુસાલાએ પોસહિએ. બાંલયારી ઉમુજ્જમણુ સુવણે. વવગય માલા વણુગવિસેવણે; નિખિત સત્ય મૂસલે. દક્ષ સંથારોવગએગે અથીએ, અઠમ લતાં. પડિ જગરમાણે-વિહરંતિ. એ ૨ પાઠ પોસહિએ ઈત્યાદિક વિહરંતિ સુધી ઉ. ૨ નો ॥૩॥ પાઠ સરિએ છે. પણ વૃત્તિ મધ્યે ને અર્થ ઇલાબ્યો છે તે લખીએ છીએ. એ એણુ મિત્યાપિ ૨૫૪૮ નવરં આવ સત્યમાવાસ-મિતિ અથભરતઃ કિ ચકે ઈત્યાહ. તએણું મિત્યાહિ તતઃ સભરતો રાજ આલિષેક્યાત હુસ્તી રત્નાત્ પ્રત્યાવ રોહતિ પ્રત્યક રૂહા વય ત્રૈવ પૌષ્ઠ્રશાળા, તત્ત્વેવોપાગાષ્ટતિ ઉપાગત્યં ચ પૌષ્ઠ્રશાલામનુપ્રવિશ્ય પૌષ્ઠ્રશાળા  
 પ્રમાજન્તિ પ્રમાજર્યવાહલ્ સંસ્તારક સંસ્લેષણાતિ સંસ્તીર્યચ દલ્ સંસ્તારકં દુર્દુંંતી આરોહંતી અર્દ-  
 દ્વાંચ મા ગધ; તીર્થકુમાર નામેનો દેવસ્ય સાધનાયેતિ.  
 શેષ: અથવા ચિન્દિયેષિ. તેન માગધ તોર્થ કુમારાય  
 દેવાય અ૪૮મ લક્તમ સમય પરીસાપયોપવાસ તૈય સુચ્યંતે  
 યથા અષ્ટમ લક્તમિતિ સાવયં નામ તર્યેવં એકેકદિમન  
 દિને દ્વિવારંલોજનૌચિતાન દિન નયસ્યષણું લક્તાનાં  
 સુતાર પારણુક દિનયોરેકેકસ્ય લક્તસ્યચ ત્યાગેનાષ્ટમં લક્તાં  
 ત્યાજયં અત્ર તત્થા પ્રગૃહણુંતિ અનેનાહાર પૌષ્ઠ્ર સુક્તાં  
 પ્રચુર્યાં ચ, પૌષ્ઠ્રશાલાયાં પૌષ્ઠ્રિક પૌષ્ઠ્રવત્તાત્ પૌષ્ઠ્ર ના  
 મેહાલીવત દેવતા સાધનાર્થક. વૃત વિશોપા અલિથહ ઈતિ  
 યાવત.

નત્વેકાદ્શાદ્રત ઇપસ્તહવત્, સંસારિકાય: ચિતાના  
 નૌચિંત્યાત નત્વોપમેકાદ્શસપ્રતિકો ચિતાનો, તત્ વતો અહાચ્યર્ય  
 ઘતુણાનાનિ સુત્રેકથ સુપાતાનિ ઉચ્યતે, એહી કાર્ય સિદ્ધિ

રપિ, સંવરાતુણાન પૂર્વકેવલવતિત ઉપાયે પેયલાવ હર્ષનાર્થી અભયકુમાર મંત્રો, શ્રી વિજયરાજે ધમિલાહિનામિન અત એવ પરમ જગરૂક પુણ્ય પ્રકૃતિકા: સંકદ્ય માત્રેણુસી સાંખ્યિકિત સુર સાધનમિદ્ધિ નિશ્ચય જાનાનાજિન ચક્કીણુતેડતિસાનો, દ્વિન: કુણાતુણાન નેડ્યામાંદો.

એ વૃત્તિનો આશય, એ કે ચક્કવૃત્તિએ પોષો કર્યો. તે દેવતાને સાધવાને. વત વિશેષ અભિગ્રહ પણ અગિઆરમું વત નહિ એ સંસારિક કાર્ય કર્યું. તેમ સુરિયાભાદિ દેવતા તથા દ્રૌપદીએ નમોત્થુણું કર્યું તો સંસાર સાધક સ્તુતિ પણ લોકોત્તર સ્તુતિ નહિ, (૭) નમોત્થુણું કર્યું માટે સમક્રિતદષ્ટિ એમ ન જાણું. સાક્ષી શ્રી જ્વાલિગમ સૂત્રે. વિજય નામા દેવે પ્રતિમા પૂજી છે, નમોત્થુણું પણ કર્યું છે. અને સૂર્યાભે પણ પ્રતિમા પૂજી નમોત્થુણું કર્યું છે અને વિજય દેવને સમદિદી તથા ભવસિદ્ધિ ન કર્યો. સૂર્યાભને ભવસિદ્ધિ કર્યો. સૂર્યાભે પ્રતિમા પૂજી નમોત્થુણું કીધું તેમ વિજયદેવે પૂજી નમોત્થુણું કીધું. એક લભ્ય થયો એક ન થયો. તો દેવતા પ્રતિમા પૂજે નમોત્થુણું કીધે સમક્રિતદષ્ટિ હોય તો બીજાને સમક્રિતદષ્ટિ કર્યા જોઈએ. અને બારમા દેવલોક ઉપરાંત પ્રતિમા જાણી નથી તો નમોત્થુણું કયાંથી કરે તો તે સમક્રિત દષ્ટિ ક્યે પ્રકારે છે? (૮) વળી વિશેષે દ્રૌપદીનાં નમોત્થુણું આશ્રી જ્વાખ લખોએ છીએ— દ્રૌપદીએ નમોત્થુણું સમક્રિતના રસ વિના કીધું તે કર્ય રીતે? પૂર્વે સમક્રિત દષ્ટિ વિના કોઈ ભિથ્યાત્વીએ નમોત્થુણું કીધું છે?

ઉત્તર—અગવતી શતક ૧૨ મે ઉદ્દેશે અનંતખુતાને આલાવે. સર્વ જીવ જીવ પલાદિ દેવ, જીવ નવગ્રીવેક સુધી દેવપણે ઉપન્યા. ૧૨ દેવલોક સુધી જિન પરિમા છે. ત્યાં વિમાનના અધિકાર્યક ઉપજાતી વેળા સર્વ પ્રતિમાદિ પૂજે. નમોત્થુણું પણ કરે. તે સર્વે

જીવ મધ્યે અભિવ્ય કૃષ્ણપક્ષી ભિદ્યાત્વીએ અનંતીવાર નમોત્થુણં કીધા. નમોત્થુણં કીધે સમકિત હો નહિં. જેમ પદોત્તર રાજ પ્રમુખે અઠમ કીધા પણ છ કાયના આરંભ કીધા તેમ તામલીએ છુટ આંખિલ પ્રમુખ કીધાં છે. આગલ પાછલ છ કાયના આરંભ કીધા. તેમ દ્રૌપદી આરંભીએ નમોત્થુણં કીધું કખુલ નહિં. જેમ ભિદ્યાત્વી અઠમ છુટ આંખેલ આદિક તપ કરે, પણ જિનમતમાંહિ ન ગળાય. જેમ દેવતામાંહિ ભિદ્યાત્વીએ પણ નમોત્થુણં કીધાં પણ જિનમતમાંહિ ન ગળાય. તથા સર્વ અભિવ્ય, સર્વ ભિદ્યાત્વીએ મનુષ્યમાંહી અનંતીવાર નમોત્થુણાદિ સિદ્ધાંત ભરણા માટે સમકિત દાણ ન થયા. કોઈ ભિદ્યાત્વી ઉર કલા તથા ૬૪ કલા મધ્યે નમોત્થુણં ભણે તો પછી આર્તિ ઉપજે, નમોત્થુણં ભરણું તેને કાંઈ સૂત થઈ ન પરગમ્યું. તેમ દ્રૌપદીને સૂત થઈ પરગમ્યું નહિં. અને દ્રૌપદીનું નમોત્થુણં વાચનાંતરને પાડે છે. શ્રી ભરણા ભાંડાર મધ્યે તાડપત્રની પ્રતિ ૭૦૦ વરસની છે તે મધ્યે એટલો પાડ છે:-**જિણ પડિમાણું અચ્ચણું કરેઠ (૨) તા, જેણું વ અંતે ઉરે; તેણું ઉવાગચ્છદ (૨) તા.** પણ નવી પ્રતિ, વાચનાંતરનો પાડ લખે છે, પણ અસલો જુની પ્રતિ મધ્યે નથી. તે માટે નમોત્થુણનો નિરધાર નહિં. અને જે કીધું તો અનંતવાર, ભિદ્યાત્વ પણુભાંહિ કીધું. સમકિતહિની દેવ તે પ્રતિમા આગળ નમોત્થુણં માંહી “ અરિહંત સિદ્ધના ગુણું કીર્તનનો તે ભિદ્યાત્વી લાભ ન જણે (જ. ૬.) જાણે તો ભિદ્યાત્વ લાગે. અને ભિદ્યાત્વી નમોત્થુણં કરે તેથી કાંઈ તેને સમકિત ન આવયું. જે નમોત્થુણં કીધે સમકિત આવે તો અભિવ્ય અનંતીવાર કીધું. તે કાંઈ લબ્ધ ન થયા. સમકિત તે સુમકિતને રસે હોય. તે માટે દ્રૌપદીએ જે નમોત્થુણં કીધું તો સમકિતના રસ વિના કીધું. પરમાર્થ શુન્ય મૂલગી, તે વેળા સમકિત દાણણી નહિં. પરણા પછી સમકિત પામ્યાની ના પણ ન કહેવાય. દીક્ષા પામી. પાંચમે દેવલોકે પહોંચો ॥૬॥ તથા સંગમ દેવતા અભિવ્ય. આવશ્યક

निवृत्ति वावीसहस्री हरिभद्रसूरिनी कीधी. सामान्यक अध्ययननी दीका पाना २६८ ते भध्ये पाने ८० मां अलब्ध संगमनो अधिकार छे. महावीरना उपसगं भध्ये ज्यारे शकेन्द्रे कहुं—महावीरने चणावी केहि न शके, त्यारे संगम ऐत्योः—ईहु संगमो नाम सेहुम कुपवासी हवे, सक्ष सामाणियो, सेलषुद्ध हेवराया, अहो रागेषु उद्दलवर्ध, कोमाणुसो हवे, नचालिसध, अहुंचालेभि, ताहेसकडेत न वारेई भा जाणिहिति, पर निस्तसाए अगवं तवोऽभम् करेई एसो आगतो, अहिंदुं समो हेवता सकहेवेऽन्ने सामानिक अने अलब्ध कहो छे. संदेह हो-हावकी अंथ छे तेनी वृत्ति अः ४७५० छे. सर्वत्र ५० छे. ते भध्ये कहुं छे. नन्वे वंतहिं संगमकः प्रायमहा भिथ्यादृष्टि हवे. विभानस्थ सिद्धायतन प्रतिभा अपिनायतन भितिचेत, न नित्य चैत्येषुहि संगमं वद्वलब्धपिहवा. भद्रिय भद्रीय भिति अहुमानात् कृपस्थित व्यवस्थानुरोधात् तद्भूत प्रलावाद्वा न कदाचित्तडसमंजसकियाः—आरबते ए संगम हेवताने अलब्ध कहो छे. ज्यां अलब्ध कहुं छे, त्यां ईद्रनो सामानिक हेवता कहो. तो सामान्यक हेवता ईद्र सरीभा विभाननो धणी होय, ते तो ज्यारे उपने लारे उपन्यानी करणी करे. संगमनी पेरे. भीज पणु अलब्ध हेवता पोताना कृपनी स्थिति आए सिद्धायतनस्थ प्रतिभाने माने छे. आशातना वर्ण छे. जुओ ने अलब्ध सरीभा पूजे, नमोत्थुणुं करे एम कहुं. तो नमोत्थुणुं कीधे समकित कुम हरे ? समकितदृष्टि ज नमोत्थुणुं करे एम नहि ॥ १० ॥ वणा विशेषे करीने ने भिथ्यात्वी नमोत्थुणुं करे ते कहीये छीये. गोशालाना छ दिशायार तथा गोशालाना आवक, गोशालाने तीर्थेकर जाणीने नमोत्थुणुं करे तो शुं समकितदृष्टि कहीये ? पणु भिथ्यात्वी थकां नमोत्थुणुं कीधे समकिती कुम कहीये ? तथा जमाली आवश्यक करे ते वारे नमोत्थुणुं करे,

તે તો સમકિતદાષ નહિ તથા દિગંબર પ્રતિભા પૂજે છે. તે અને નમોત્થુણું કરે તો શું સમદાષ કહીએ ? પણ નમોત્થુણું કીધે ધર્મ કરણી ન આવે. મિથ્યાત્વી પણ નમોત્થુણું કરે ॥ ૧૧ ॥

હવે ૫ હેતુ (૧) કારણ. મિથ્યાત્વીના નમોત્થુણા ઉપર કહીએ છીએ. ૧ મિથ્યાત્વી પણ નમોત્થુણું કરે. એ પક્ષઃ ॥ ૧ ॥ ૨ કયો હેતુ ? કુલ પરંપરાની ચાલે એ હેતુઃ ॥ ૨ ॥ ૩ કયા દષ્ટાંતે, વિજયદેવાદિકને દષ્ટાંતે ॥ ૩ ॥ ૪ જે જે સંસારની ઘર્યાએ તથા કુલ પરંપરાની ચાલે નમોત્થુણું કરે તે તે મિથ્યાત્વ ॥૪॥ ૫ તરમાત્ર તથા ન્યાયેણ, મિથ્યાત્વીપણે નમોત્થુણું કરે એ ન્યાય ॥ ૫ ॥ ૬ કિં કારણું, સંસારની ઘર્યા તથા કુલ પરંપરાની ચાલ વિના મિથ્યાત્વીને નમોત્થુણું ન હોય. ॥ ૬ ॥

હવે દ્રૌપદી આશી ૬ બોલ ઉતારીએ છીએ. ૧ દ્રૌપદીએ નમોત્થુણું કીધું હશે તો તેથી કર્મની નિર્જરા ન થઈ, કર્મનો બંધ ॥૧॥ એ પક્ષ (૨) શા માટે મિથ્યાત્વપણે ? સંસારની ઘર્યાએ કીધું તેમાટે એ હેતુ ॥૨॥ કયા દષ્ટાંતે, વિજય દેવ ૧ તથા સંગમ ૨ તથા જમાલી ઉસ્યાંબ તથા દ્રોગ લિંગી સાંધુ તથા ભરતાદિના અઠમ તથા ગોસાલાદિકના આવકને દષ્ટાંતે ॥૩॥ ૪ જે જે મિથ્યાત્વપણે તથા સંસારની ઘર્યાએ નમોત્થુણું કરે તે તે કર્મ બંધ એ ઉપનય ॥ ૪ ॥ ૫ તે માટે તે ન્યાયે કરી. દ્રૌપદીએ નમોત્થુણું કીધું હશે તો કર્મનો બંધ થયો. એ સમાખ્યિ ॥૫॥ ૬ કિં કારણું, નમોત્થુણું કહે મિથ્યાત્વ ન હોય તો કર્મનો બંધ ન હોય. એ કારણ ॥૬॥ એ ૧૧ પ્રશ્નો-તરે નમોત્થુણુંનો જવાબ કહ્યો, ધતિ ૩૧ પ્રશ્નોત્તરે કરી દ્રૌપદીનો અધિકાર જાણવો. ૧૦ ઉત્તર જિણુ પડિમાના ૧૦ મિથ્યાત્વ દસ્તિથીના ૧૧ નમોત્થુણુંના એવં ૩૧ ઉત્તરે કરી કહ્યું જે વિવાહને અવસરે પૂજી, વળી સ્વર્યાંબને ભળાવી તે દેવની કરણી તેમ એહની

પણ ધરની સ્થિતિ જાણવી. એટલે દ્રોપદીની જિણુપડિમા તે કામ-  
દેવની પડિમા ॥૧॥ તે વેળા મિથ્યાત્વ દષ્ટિણી ॥૨॥ સમકિતના  
રસ વિના નમોત્થુણું કહ્યું જાણું ॥૩॥ એ દ્રોપદી આશ્રી ઉભોલનો  
ઉત્તર કર્યો ॥૩॥

હવે ઓધ નિર્યુક્તિ અંથને અભિપ્રાયે પ્રતિમા પૂજ તે વેળા  
દ્રોપદી સમકિત ધારિણી નહિ, તે દેખાડે છે.

દ્વારા જિણુહરા ધર્તિબ્યાખ્યા, ઓધનિર્યુક્તિ બ્યાખ્યેયં,  
દ્વારા લિંગી પરિશૃષ્ટિતાનિ ચૈત્યાનિ કિં સમ્યગ્રહણિન સંભાવિ-  
તાનિ ॥ ધર્તિ કર્યાત યર્યાત દ્વારા લિંગી મિથ્યાદાણિત્વાત  
યદેવંતહિ હિગાંબર સંબંધીની, ચૈત્યાનિ કિં સમ્યગ્રહણિન  
સંભાવિતાનિ એતત સત્યં યદેત સત્યં તહોઁ સ્વર્ગલોકેષુ,  
શાયિતાનિ ચૈત્યાનિ, સ્વર્યાભાઘાદેવા: સમ્યગ્રદ્વારયઃ પ્રપૂજયતે  
તરચૈત્યાનિ સંગમવત અભાવ્યદેવા: મહીયં મહીયં મિતિ  
ખલુમાનાત, પ્રપૂજયતે પૂર્વાપર વિરુદ્ધનસ્યાત ॥ નહુ સ્વર્યા  
ભાગ દેવા: સ્વર્ગ લોકેષુ સાસ્વતાનિ, ચૈત્યાનિ પ્રપૂજયંતિ.  
તત્કદ્રિપ સ્થિતિવશાનુરોધાત, અત એવ વિરુદ્ધં ન સંભાવતિ  
યદેવંતહિ દ્રોપદા, સમ્યકુદ્યુરણ્યાયાતિ, ચૈત્યાનિનમસ્કૃતાનિ-  
તાનિ કિં દ્વારાલિંગ પરિશૃષ્ટિતાનિ, ન ભવ  
મિત્યાહ, દ્રોપદી ન સમ્યકત્વ ધારણીસ્યાત કથં  
ઓધ નિર્યુક્તયા ધર્તુકતાં, ધર્તી જણુસંહં તિવિહુ  
તિવિહેણાં વજણાએ સાહુ ધર્તિ વચનાત, સ્ત્રી જન સંસ્યરી,  
સ્ત્રીવિધિ ત્રિવિધેન, સાધુનાં વર્જનીયઃ સાધોશ્ચ અકદ્વપનીયઃ  
કર્માચયરતઃ સમ્યકત્વ ભાવાત, દ્રોપદી આગમેષુશ્રૂયતે.  
લોમ હત્થં પરામુસંઈ, લોમ હસ્તેન પરામુસતિ પરિ  
માર્જયતીત્યર્થઃ । તત્પરિમાર્જનેન જિનસ્ય સંસ્ય શૌ-

જાતઃ જિનસ્ય સ્વી જન સરપરેન આશાતનાસ્યાત  
આશાતના સમ્યકૃત્વાભાવઃ અત એવ દ્રૌપદી ન સમ્યકૃત્વ-  
ધારિણી. સંભાવ્યતેપુનઃ એવ નિરૂક્તિચિરંત નદી કાયાં,  
ગંબ હુસ્ત્યાયૈલુચ્યુક્તાં. દ્રૌપદાનૃપ પુત્રિકા, નિદાન  
કૃતિલિ, ર્ભર્તાર પંચસ્યાછતા નિદાન લોજ્યત તથા જ્ઞાતે  
પુત્રઃ પુનઃ પત્રા સાહુસકાશમાયેદ્વરં, સમ્યકૃત્વ માર્ગ  
ધિરતેનિગયાત્વ મહાન્ન વશાચ્ય પ્રતિમા પૂજયાચ પુષ્પાદિ  
લિઃ જિન પ્રતિમા અભિધાનં, તસ્ય પ્રકરં ન વેએવ  
કસ્યંજનં તત્પૂજ્ય તં કૃતાસ્તિ પુસ્તક પૂરેદ્દસ્યત ।  
ધૃતિ પાડાંતરે મિથ્યાત્વ જનાર્દું જન વિધિ. ધેનુજ  
કથાંપ્રાયેતે, મુગ્ધાચ્યતિ જિન, દ્રૌપદિ મિદં કુર્યા જિના-  
શાતના ॥૪ ॥

એટલા સુધી દ્રૌપદીનો ઉત્તર કહ્યો. હવે સ્વયં પરને ઉપકાર  
ખુદ્ધિએ નિક્ષેપાદિના ઉત્તર લખીએ છીએ. તથા કોઈક કહેશો. તીર્થીકરના  
નિક્ષેપામાંછી પોતાનો ભાવ ધાબે. તેથી મુક્તિ ઇણ પ્રામ હોય. ધૃતિ  
ચાલણા પ્રશ્ને. ઉત્તર—એમ સ્થાપના નિક્ષેપા મધ્યે ભાવ આણ-  
વાથી તે વસ્તુની ગરવી સરે, તો તે દાઉમ આંબાદિક વૃક્ષ, રૂપીઆ,  
સેનીયા પ્રમુખ નાણું ધેવર પ્રમુખ હાથી ધોડા ગાય પ્રમુખની સ્થાપના  
કરી માંછી ભાવ ઇણના સ્વાદનો દૂધાદિકનો રાખીએ તો મીઠા મધુ-  
રાનો સ્વાદ આપે. તે તો દીસતું નથી. તો તીર્થીકરની પડિમાએ  
મુક્તિઇણ રસ કેમ પાભીએ નિક્ષેપા જેતાં પણ હરતી નથી વળી  
દૃષ્ટાંતે કરી કહીએ છીએ. શ્રી તીર્થીકર દેવતું રૂપ અનોપમ છે,  
તો તે રૂપે પણ સરીખી પડિમા નહિ અને ગુણે તો કાંઈએ નહિ.  
તો તે પુરુગળ પ્રતિમા, આરાધ્યક માટે જિનસ્તવન કહીએ છીએ.

## ॥ રાગ કેદારો મહાર આજ્યાનની દેશી. ॥

શ્રી જિનવરગુણ શશિકર નિર્મણ, સકલ સુખદાતાર, જનમન મોહન ઇપ અનોપમ, વિશ્વજિન આધાર ॥૧॥ સુરપતિ કોડકોડ ભળાને, પ્રતિબિંદુ જે નીપળવે, સાર પદાર્થ સાહિત સોહાવે, તો જિનવર તોલ નાવે ॥૨॥ સમવસરણુ સુરવર મલી આવે, આવે તે માનવવૃંદ, વિવિધ જાતિનાં માનવ આવે, પામે તે પરમાનંદ ॥૩॥ હંસ ભયુર સુક કેકિલ ચાતુક, મૃગપતિ મૃગ પ્રમુખાણી, શ્રી જિનવરજીની વાણી પ્રોછે, સાતા લહે સર્વ પ્રાણી ॥૪॥ એહવેં ગુણે કરી જિન વિરાને, પૂરે વંછિત ધ્યાને, પણ તે માનવની ખુદ્ધિ કેહવી, જે ઝૂટમ દેવતે માને ॥ ૫ ॥ ૫ંચ ભળાને કરી સ્થાપના, તેહને જિનવર કહી ઘોલાવે, જે વેળા જિનના ગુણ જોઈએ, તે ગુણુ કિંદાંથી લાવે ॥૬॥ જિમ ચિતારે કેસરી ચિતરીએ, પ્રત્યક્ષ સંધ ઉન્માદ, ગજદળ ભંજનની વેળાએ, તિહાં કોણ કરે સંધનાદ. ॥૭॥ આગકને માતાને ય અલાવે, કરે ઝૂટમ સ્વરૂપ, માય કહી તેહને ધવરાવે, કિમ સ્વાદ લહે પય રૂપ ॥૮ ॥ ધેવર ઢામેં જાણીને પ્રોછે, કુપુરીયાં આલાદ, ધેવર ભાવ ધરીને જમતાં, નાવે ધેવરનો સ્વાદ ॥૯ ॥ કલ્પવૃક્ષનાં ઇળ અતિ સુંદર, જેહનો સ્વાદ અપાર, કનકદળ તસ ઉપમ જાણે, તે મૂર્ખભાં સિરદાર ॥૧૦ ॥ ગવરી દૂધ સાકર શું ભેળી, પીધિ સુખ ઉપજવે, તાસ ભરોંસે આક તણો પય પીએ તે ધણું વરાસે ॥૧૧ ॥ તિમ તીર્થંકર સપટંતર કિમ આવે ઝૂટિમ દેવ; ચતુર હોય તે કરે પરીક્ષા, કરે જિનવરની સેવ. ॥૧૨ ॥ તે જિનવરની સેવા કીને, જે સેવા કીધી જાણે, એકુંજાન નહિ જેહમાંછે, તેહને કવિજન કિમ વખાણે ॥૧૩ ॥ કેવળજાન સાહિત બિરાને, વલી અતિશય ચોત્રીશ, તે જિનવરની સેવા કીધે વંછિત ઇળ જગીરશ. ॥૧૪ ॥ અતીત અનંતા અતિ જયવંતા, જિનવરજી જગલાણુ, ધર્મસંધ મુનિ કહે, સેવક જનને કુદ્રો સકળ કલ્યાણુ ॥૧૫ ॥ ધતિ શ્રી જિન સ્તવન સંપૂર્ણ ॥૧૫॥

તथा વળી કોઈ કહેશે ને તીર્થકરનું નામ લઈ કેમ સ્તવો છો ? નામ નિક્ષેપો થાય છે. જેમ નામ નિક્ષેપો માનવા ચોગ્ય તેમ સ્થાપના નિક્ષેપો પણ માનવા ચોગ્ય. ધતિ પ્રશ્ને. અથઉતરં-તીર્થકરનું નામ લઈએ, તે કાંઈ નામ નિક્ષેપો નથી. તે તો નામ એવી સંજ્ઞા છે. નામાણિ જાણિકાણિવી, દંતાણુગુણાણુ પંજવાણુવા, તેસિં આગમ નિધિસે, નામે નિરપવિયાસના ॥ ધતિ અનુયોગ દ્વારે ॥ તે નામ સંજ્ઞા, પણ નિક્ષેપો નહિ. વસ્તુને પટંતરે સહભાવથી વસ્તુનું નામ તે નામ સંજ્ઞા. તે વસ્તુ સગુણુને પટંતરે કહીએ. બોલાવીએ. નિર્ગુણ વસ્તુનું નામ સગુણ વસ્તુ બોલાવીએ ત્યાં તે નામ નિક્ષેપો થાય. પણ સુગુણા મહાવીરનું નામ તે નામ સંજ્ઞા, પણ નિક્ષેપો નહિ. ધતિ નામ નિક્ષેપાનો ઉત્તર કહ્યો ॥ ૬ ॥

હવે નિક્ષેપા ચારનું સ્વરૂપ કહીએ છીએ. તે મધ્યે એક લોકોત્તર ભાવ નિક્ષેપો આરાધ્યક, લોકોત્તર ભાગને વિષે સમક્ષિતદિષ્ટ, ભાવ અરિહંત હેવને વંદનીક સદ્ગુરૂ, માંહિ અરિહંતના ગુણું સહિત માટે, પણ નામ અરિહંત તથા સ્થાપના અરિહંત, તથા દ્વય અરિહંતને વંદનિક સદ્ગુરૂનું નહિ. માંહિ અરિહંતના ગુણું રહિત માટે. જત્થય જંજણેજણ નિષેવં નિષેવે નિરવિસેસં, જત્થયવિય ન જણેજણ, ચઉઙ્ગં નિષેવે-॥ ૧ ॥ શ્રી અનુયોગ દ્વાર મધ્યે એકુક પદાર્થના ચાર ચાર નિક્ષેપા કહ્યા. છેલ્દો લોકોત્તર ભાવ નિક્ષેપો, આરાધ્યક કહ્યો. એ ગાથાને મેળે, અરિહંતના ૪ નિક્ષેપા થાય. ૧ નામ અરિહંત. ૨ સ્થાપના અરિહંત ૩ દ્વય અરિહંત ૪ ભાવ અરિહંત. ત્યાં નામ અરિહંત પ્રમુખનો અર્થ લખીએ છીએ.

જેમ માતા પિતા પોતાના પુત્રનું નામ ઇષલ તથા વર્ધમાન, જિનદાત તથા જિન પાલિએ તથા જિનરખીએ એવું નામ આપે, તેમ કોઈક પોતાને છાંદે, જીવનું તથા અજીવનું અરિહંત એવું નામ આપે તે નામ અરિહંત. જેમ શ્રાવકનું અર્હત્વક એવું નામ.

॥ ૧ ॥ તથા ભક્તિ કુમારીના ભાઈના ધરને વિષે ભલ્લિનાથનું રૂપ ચિતરૂં તથા ભલ્લિનાથે પોતાની સુવર્ણભય પ્રતિમા કરાવી; માંહિ પોલી, માથે છિદ્ર, માંહિ દિન દિન પ્રત્યે તેણે એકેકે કવલ મૂક્યો. વિણુસી, હુર્ગંધ થયો. તો તેણે ૬ રાજને પ્રતિષ્ઠાધ્યાનું નિમિત્ત થયું. તો તેથી ૬ રાજ પ્રતિષ્ઠાધ્યા.\* તે રૂપ અનિત્ય અસાર દેખાડવે કરી, તથા તે રૂપ ચિતરૂં તથા તે પ્રતિમા સ્થાપના આરિહંત, અથવા અનંતે કાળે અછેરાને પ્રભાવે, પંચમ આરામાંહિ વેષધારી અસાધુએ નામ માત્ર આચાર્યે ચૈતાલાં કરાવ્યાં તે સ્થાપના આરિહંત. એ ઐહુ નિક્ષેપા નિર્ગુણ માટે વંદનીક નહિ, અને વંદનીક હોય તો ચિતારાને દેશવટો કેમ આપે? કવલ કેમ મૂકે? આશાતના થાય. તથા કમલપ્રભા આચાર્યે જિણુલાં (જિનાલયો) સાવદ્રય કુલ્યા. તથા પ્રશ્ન વ્યાકરણ સૂત્ર મધ્યે આશ્રવદાર માંહિ થૂલ દેહરાં

\* જેમ એ પ્રતિમાને, પાસે આવીને ભક્તી કુંવરી ન સમજવે તો પુતળી કામમાં ન આવે. એ તીર્થીકર નિશ્ચયવાદીએ એ નિમિત્તે એ ૬ રાજ પુતળી દેખી મોદ્યા. પછી ઉધાડી ત્યારે હુર્ગંધે મહોં ઢાંક્યા. ત્યારે ભક્તીનાથ ઓલ્યા-મુખ કેમ ઢાંકો છો? ત્યારે છ રાજ ઓલ્યા.-હુર્ગંધ છે માટે. ત્યારે ભક્તીનાથે ઉત્તર દીધીઃ:- કેને પુતલી મધ્યે દિન દિન એકેક કવલ નાખવાથી આટલી હુર્ગંધી છે, તો મહારા શરીરમાંહિ કેમ રાચો છો? એમ કલ્યાથી બુઝ્યા. શ્રી ભક્તીજીના કલ્યાથી બુઝ્યા, પણ પૂતલી દેખી બુઝ્યા નથી. પૂતળી દેખી મોદ્યા છે ખરા. ॥૩॥ અને જે સ્વીતું રૂપ દેખી બુઝે તો સ્વીએ તો ધણીએ દેખી હશે તેવારે કેમ ન બૂજે? ચક્વત્યાદિક અલદ્ધત પ્રમુખ બૂજ્યા જોઈએ, પણ રૂપ સ્વીતું દેખી બૂજે નહિ. પૂતલી દેખી બૂજે તેવું નથી ॥૩॥ વલી પૂછને જે બુઝ્યા પછી ૬ રાજ પૂતલીને પગે લાગ્યા નથી જેમ સમુદ્રપાલ કુમાર ચોર દેખી બૂજ્યા પણ ચોરને પગે ન લાગ્યા.

પ્રતિમા કલ્યાં તથા પંચમ આશ્રવદાર મધ્યે પ્રતિમા પરિગ્રહમાંછિ આણું છે. એવો પરિગ્રહ મોક્ષમાર્ગનો કળદાતા નથી. એહ સરીખું પાસ કહ્યું છે તે સૂત્ર ચેષ્ટિયાણિય ઈત્યાદૌ. તથા પાંચમા સંવર દ્વાર માંછિ પ્રતિમા સામું જેવું નિષેધ્યું તો સ્થાપના અરિહંત વંદનિક કેમ હોય ? ॥૨૨॥ તથા દ્રોગ અરિહંતના ૫ નિક્ષેપા થાય. જાણ્ય શરીર દ્રોગ અરિહંત ૧ ભવિય શરીર દ્રોગ અરિહંત ૨ લોકીક દ્રોગ અરિહંત ૩ કુપ્રા વચનિક દ્રોગ અરિહંત ૪ લોકોત્તર દ્રોગ અરિહંત ૫ ત્યાં ભાવ અરિહંતદેવ મુક્તિ પહોંચ્યા તેહનું જીવ રહિત શરીર તે જાણ્ય શરીર દ્રોગ અરિહંત, જેમ ધૂતનો ધડો હતો. ૧૧॥ તથા ગૃહ વાસે વસે છે અને આગમોક કાલે અરિહંતના ગુણ આવશે. તે ભવિય શરીર દ્રોગ અરિહંત જેમ ધૂતનો વટ હશે. (૨) તથા લોકમાંછિ દ્રોગ અરી વેરી શત્રુ મહિવાસી પ્રમુખ. જેણે તે લોકિકદ્રોગ અરિહંત જેમ કૃષ્ણજીનું નામ કહ્યું છે ॥૩॥ તથા કુપ્રા વચનિકમાંછી. રાગદેષ અણુલ્લતે, કેવળજીન અને અતિશય વિના દેવ કહેવડાવે છે. તે કુપ્રા વચનિક દ્રોગ દેવ અરિહંત. જેમ હરિહર અલ્પા ॥ ૪ ॥ તથા જમાલી, જોસાલા પ્રમુખ જિન શાસન માંછી નામ ધરાવી કેવળજીની અરિહંતપણું કહેવરાયું, તે લોકોત્તર દ્રોગ અરિહંત ॥૫॥ એ પાંચ દ્રોગ અરિહંત. અવંદનીકમાંછિ અરિહંતના ગુણ નહિ તે માટે એકેક એમ કહે છે—ભરતરાજએ મહાવીરનો જીવ મરિયિ ત્રોદંડિને વંદના કરી. આગલ અરિહંત થશે તે માટે તેહનો પ્રત્યુત્તર—તે વાત સિદ્ધાન્તમાંછી નથી. અને સૂત્ર સાથે પણ મળે નહિ. નેમનાથે સભામાંછિ કૃષ્ણજીને કહ્યું. તમે બારમા તીર્થીકર થશો. તે વારે કોઈએ કૃષ્ણજીને વાંદા નહી તથા મહાવીર દેવે સભામાંછિ કહ્યું—શેણિક રાજ પહેલા તીર્થીકર થશે. તે વારે શેણિક રાજને કોઈએ વાંદા નહી, તથા સમવાયંગ મધ્યે ઋષિ-લાટિક ચોવીસ તીર્થીકરને વંદના કરી પણ આગમ્યા કાળે ચોવીસી થશે તેહને વાંદા નહી. તથા જીવ રહિત અરિહંતના શરીરને તથા

ગર્ભાવાસે અરિહંતને તથા શાશ્વતી જિનપડિમાને દેવતાએ વંદના કરી. તે તીર્થકરની આજા નહીં. પોતાને છાંદે દેવતાની સ્થિતિ માટે તથા સિદ્ધાંતમાંહિ લગવંતે ચરિત્રાનુવાદે કહ્યું છે પણ લોકોત્તર માર્ગ માંહિ નથી કહ્યું ॥૬॥

હવે ભાવ અરિહંત વંદનીકનો પાઠ લખીએ છીએ. સમણે લગવંત મહાવીરે મહામાહણે, ઉપજનાણ દંસણ ધરે,.....  
.....જવપળજ્ઞવાસણિજને. ઉપાસક દર્શાંગના ૭ મા અધ્યયન મધ્યે મહાવીર દેવને ભાવ મહા ગોપ કલ્યા, તથા ભાવ સાર્થવાહ કલ્યા તથા ભાવ નિજજમી કલ્યા, ભાવ અરિહંત વંદનીક કલ્યા છે. તથા નમોત્થુણં, અરિહંતાણં, લગવંતાણં, જવ સંપત્તાણં:-એનો અર્થ-નમોદ્ધુણં કહેતા નમસ્કાર હોણે, અરિહંતાણં કહેતા અરિહંતને, તે અરિહંત ચાર છે. નામ અરિહંત ૧ સ્થાપના અરિહંત ૨ દ્રવ્ય અરિહંત ૩ ભાવ અરિહંત ૪ ત્યાં ભાવ અરિહંતને નમસ્કાર કરવા માટે લગવંતાણં પ્રમુખ ગુણવાચી પદ કલ્યા છે. એટાં નમોત્થુણંને ગુણે કરી સહિત ભાવ અરિહંતને નમસ્કાર કીધો. તથા રાયપસેણી નિવૃત્તિ માંહિ પણ એમજ અર્થ કર્યો છે. તથા આવશ્યક સૂત્રની વૃત્તિ માંહિ પણ એમજ અર્થ કીધો છે. વળી વૃત્તિકારે કહ્યું છે. ત્રણે કાળના દ્રવ્ય અરિહંતને લોકના પૂર્વ આચાર્યે વંદના માની છે તો એ વચન મેળે સ્થાપના અરિહંત તથા દ્રવ્ય અરિહંત વંદનીક તે લોકના પૂર્વાચાર્યને ભતે, પણ તીર્થકર ગણધરના ભાષ્ય સૂત્રને ભતે નહીં. તથા નિર્યુક્તિની ગાથા માંહિ પણ ભાવ અરિહંતને જ નમસ્કાર ફ્રલાયો છે, તે માટે કેવળજ્ઞાની ઉપ અતિશય સહિત, ઉપ વચના-તિશયે કરી બિરાજમાન એવા ભાવ અરિહંતને વંદનીક માને, સદ્ગે. તેહને સમક્રિત જાણું. જેમ ગોસાલાએ પોતાનું માન મૂકી, પોતાના સંધ મધ્યે કહ્યું જે અમણું લગવંત મહાવીર અરિહંત જિનકેવલી

સાચા અને હું છદમસ્થ છું. અરિહંત જિન કેવળી નહીં. એમ આદેશ, નિંદી સાચું સદ્ગુરું તો સમકિતની પ્રાપ્તિ કહી, તે માટે ભાવ અરિહંત વંદનીક ॥૭॥

હવે ચાર નિક્ષેપા ગુરુ ઉપર કહીએ છોએ. લોકોત્તર માર્ગને વિષે સમકિતદિષ્ટ ભાવગુરુ સુસાધકને વંદનિક સહદે. માંહિ ગુરુના ગુણું સહિત માટે. પણ નામ ગુરુ તથા સ્થાપના ગુરુ તથા દ્રોય ગુરુને વંદનીક સહદે નહીં, માંહિ ગુરુના ગુણું નહીં તે માટે ॥૮॥ સે ભયવંતિંદ્રીકર સંતિયં આણુંનાઈ કર્મજોગ, ઉદ્ઘાસુ, આયરિયં સંતિયં, ગોયમા, ચિહ્નિદ્વા આયરિયા લવંતિ, તંજહા, નામાયરિયા (૧) ઠવણુાયરિયા (૨) દ્રવ્યાયરિયા (૩) ભાવાયરિયા (૪) તત્થણું જે તે ભાવાયરિયા તે તીર્થીકર સમા ચેવ દડવા, તેસિં સંતિયં, આણુંનાઈ કર્મજોગ, સેલયવંતિ કયરેણું, સેભાવાયરિયા લવંતિ, ગોયમા, જે અજગ્રપવદ્ધાએ વિ, આગમ વિહિએ, પથં પચેણુાણુસંચરંતિ, તે ભાવાયરિયા, જેઉણું વાસસયદિખીએવિ, વાયા મેતેણુંપિ, આગમઓવાહિ કરંતિ, તે નામ ઠવણુાંભિલિ ઉલધર્યિવે,

આચાર્યને ગુરુ એકજ કહીએ. આચાર્યના ૪ નિક્ષેપા, નામ આચાર્ય ૧ સ્થાપના આચાર્ય. ૨ દ્રોય આચાર્ય ૩ ભાવ આચાર્ય ૪ ત્યાં ભાવ આચાર્ય તીર્થીકર સરીખા વંદનીક કહ્યા. અને દ્રવ્ય આચાર્ય નામ આચાર્ય સરીખા તથા સ્થાપના આચાર્ય સરીખા કહ્યા. એટલે ત્રણું નિક્ષેપા અવંદનિક જાણુવા. ભાવ નિક્ષેપો વંદનીક જાણવો. ગુરુના ચાર નિક્ષેપા થાય. નામગુરુ ૧ સ્થાપના ગુરુ. ૨ દ્રવ્યગુરુ ૩ ભાવગુરુ ૪ લાં ઝેઠું જીવ અળુવનું નામ કરે તે નામ ગુરુ (૧) ગુરુનો આકાર આદેશે તે સ્થાપના ગુરુ (૨) એ એ નિક્ષેપા ગુણું રહિત માટે અવંદનીક જાણુવા. તથા દ્રવ્યગુણના પાંચ નિક્ષેપા થાય. લાં ગુણવંત ગુરુએ કાલ કર્યો, તેહના જીવ રહિત શરીરને જાણુય શરીર દ્રવ્યગુરુ કહીએ. તથા જીવને શરીરે ગુરુના ગુણું આવશે, પણ આભ્યા નથી તેહના શરીરને અવિષ શરીર દ્રવ્યગુરુ

કહીએ. ॥૨॥ તથા કલાચાર્ય જરૂર કલા પ્રમુખ ભણ્યાવે તે લોકોની દ્રવ્ય ગુરુ ॥૩॥ તથા ઉડુક અન્યદર્શની મિથ્યાત્વી કુપ્રા વચન સંભળાવી, લોકને પાખંડ ધર્મ હેખાડે છે તે કુપ્રાવચનીક દ્રવ્યગુરુ ॥૪॥ તથા જિનશાસનમાંહિ નામ ધરાવી સાધુનાકગુણુ રહિત આધાર્માદિક સહોષ આહાર ઉપગરણુ ઉપાસરો લોગવે કરી, છકાયનાં જીવની અનુકંપા રહિત તથા લગામ વિના ઘોડાની પેરે હીંડે, તથા ગજની પેરે નિરંકુશ, તથા શરીર, હાથ, પગ પ્રમુખ પ્રક્ષાલવે કરી તથા વસ્ત્રો વગેરેનો વિસુધા કરી, જિનની આજ્ઞા બાહિર રહીને લોકોત્તર આવશ્યકાદિ ધર્મ સાચવે, તે લોકોત્તર દ્રવ્યગુરુ. પાસત્થા કુસીલીયાદિ તથા નિનહુવ પ્રમુખ અસાધુ ॥ ૫ ॥ એ પાંચ દ્રવ્યગુણુ અવંદનીક; માંહિ જ્ઞાન દર્શન ચારિત્ર ગુરુના ગુણુ નહી માટે, તથા સુદર્શન શેડ આવકે શુક પરિવ્રાજકને તથા ભક્તિ-કુમારી પ્રમુખે ચોખી સંન્યાસણીને કુપ્રા વચનીક દ્રવ્ય ગુરુ જાણી વંદના ન કરી તથા સદાલપુત્ર કુંભાર આવકે ગોસાલાને તથા જમાલી અણુગારના કેટલાક શિષ્યે જમાલીને તથા સેલગ રાજ-ક્રાંતિને પાસત્થા કુસીલીયાદિક જાણી લોકોત્તર દ્રવ્યગુણુ જાણી, વંદના ન કરી. ૪૮૮ શિષ્ય મૂકીને નિકલ્યા તે માટે દ્રવ્ય ગુરુ અવંદનીક જાણવા ॥૩॥ તથા લોકોત્તર ભાવગુરુ સાધુ વંદનીક પૂજનિક જાણવા. જ્ઞાન દર્શન ચારિત્ર ગુરુ, ગુરુના ગુણુ સહિત માટે ॥૬॥ વય છકંકાય છકં, અકપોગિહિ લાયણું, પલિયં નિસિજનાય, સિણુણાણં સોાલ વજણણું ॥૭॥ દશવૈકાલિકના છઢા અધ્યયન મધ્યે એ અદાર ગુણે કરી સહિત સુસાધુ ગુણવંત જાણવા. તથા સમવાયંગ મધ્યે અણુગારના જરૂર ગુણે કરી સહિત સુસાધુ લોકોત્તર ભાવગુરુ તરણતારણ જાણવા. એહવા ગુણવંત ગુરુને વંદનિક પૂજનિક, સહિત માને. તેહને શુદ્ધ સમક્રિત, જેમ શેણીક રાજને સમક્રિતની પ્રાપ્તિ કહી, અનાથી નિર્ગ્રિથ લોકોત્તર ભાવગુરુને વંદનીક પૂજનીક તરણ તારણ સાચા સદહિએ તેમ ॥૩॥૨॥૮॥

હવે ઉ બોલે ધર્મ, તે ધર્મના ચાર નિક્ષેપા કહીયે છીએ. દોકોતર ભાગને વિષે, અતીત અનાગત વર્તમાન ત્રણે કાળના તીર્થકર દ્વારા ધર્મ પ્રરૂપે. તે ભાવ ધર્મ સમકિંત દર્શિ, મોક્ષદાયક કરી સહિતે. પણ નામ ધર્મ સ્થાપના ધર્મ, મોક્ષદાયક કરી સહિતે નહિ. અવિરતિ ધર્મ માટે. ધર્મના ૪ નિક્ષેપા થાય. ૧ નામધર્મ ૨ સ્થાપના ધર્મ ઉ દ્રવ્યધર્મ ૪ ભાવધર્મ. ત્યાં જીવનું તથા અજીવનું ધર્મ એવું નામ કરે. તે નામ ધર્મ. તથા ધર્મવંતનો આકાર આલેખે તે સ્થાપના ધર્મ. ॥ ૨ ॥ તથા દ્રવ્ય ધર્મના ૫ લેદ. ધર્મવંતનું જીવરહિત શરીર તે જાણ્ય શરીર દ્રવ્ય ધર્મ ૧ તથા આગમીક કાળે જીવને શરીરે ધર્મ કરશે તે અવિષ્ય શરીર દ્રવ્ય ધર્મ ॥ ૨ ॥ તથા દોકાનું આવરણ તે દોકિક દ્રવ્ય ધર્મ. ॥ ૩ ॥ તથા સૌચ ધર્મ તથા તિર્થાલિષેક ધર્મ તથા દેહરામાંહિ લીપવું, પ્રતિમાને પૂજવું, પખાલવું, ધૂપ હીપનું કરવું. તે કુપ્રાવચનીક દ્રવ્ય ધર્મ. ૪ તથા જમાલી પ્રમુખ નિનહુનો આચાર તથા પાસત્થા કુસીલીથાહિ અસાધુનું આચરણ તે દોકોતર દ્રવ્ય ધર્મ. ૫ એ નામ ધર્મ ૧ સ્થાપના ધર્મ ૨ દ્રવ્યધર્મ ૩ મોક્ષ દાયક નહી. આરંભ અવિરતિરૂપ પાખંડ ધર્મ માટે, ધાવચ્ચા પુત્ર અણુગારે સુદર્શન શેડને કહ્યું જે ઇધિરે ખરાયું વસ્ત્ર ઇધિરે ઘોતાં શુદ્ધ ન હોય, તેમ આરંભે જીવ ધર્મ સ્થાનકે વળી આરંભ કરતાં શુદ્ધ ન થાય. એહને દર્શાંતે કરી સાવદ્ધ દાનધર્મ, સૌચધર્મ, તિર્થાલિષેક ધર્મ છંડાવી, જીવદ્યારૂપ ભાવ ધર્મ અદરાવ્યો. તથા કમળપ્રલા આચાર્ય નિઃસંક, નિર્ભાય થઈ સભામાંહિ કહ્યું, યદ્વપિ જિણુલાં, જિનાં દેહરાં તે સાવદ્ધ કરણો, હું મને કરી અનુમોદું નહિ, લાલ ન કહું. તે દ્રવ્યધર્મ સાવદ્ધ કરણોમાંહિ સ્થાપ્યા, માટે તીર્થકર ગોત્ર નામ કર્મ ઉપરાજયું. અને જેહને એ વચ્ચે ઇચ્છાનું નહી તેણે કમળપ્રલનું નામ ફેરવી સાવદ્ધ આચાર્ય નામ કહ્યું. જિણુલાં સાવદ્ધ કહ્યા માટે. તે માટે મુક્તિ ભાર્ગ સાવદ્ધ પાય

કરણી આરાધ્ય નહી તથા અરિહંત ભગવંતે એકાંત દ્વા ધર્મ પ્રરખો, તે ભાવધર્મ સાચો મોક્ષદાયક સહૃદે તેજને શુદ્ધ સમકિત જાણું. સંવેવિજ્ઞેય અતીતા જેય પડુપત્રા, જેય આગમિસસા, અરહંતા, ભગવંતો, તે સંવે એવમાઈખંતિ, એવં ભાસંતિ, એવં પત્રવંતિ, એવં પ્રરખવંતિ, સંવેપાણા, સંવેભૂયા. સંવે જીવા, સંવે સત્તા, નહંતવ્યા, ન અજળ વેયવ્યા, ન પરિઘેતવ્યા, ના પરિતાવેયવ્યા, ન કિલામેયવ્યા, ન ઉદ્વેયવ્યા, એસ ધર્મે સુધ્ધે, નિતિએ, સાસએ, સમેચ્ય લોગાં, ઐયને હિંપવેઠાએ તંજહા ઉઠિએ સુવા, અણુઠિએ સુવા, ઉવઠિએ, સુવા, અણુચઠિએ સુવા, સોવહિએ સુવા, અણુચહિએ સુવા, સંજોગરાએ સુવા, તચ્ય ચેયં, તહાચેયં, અસિચેયં, પવુરચેયં તં આઈઉનનિહે, ન નિષેવે, જાણિઉ ધર્મ જહુતહા ॥૭:॥

આચારાંગના ૪ ચોથા સમકિત અધ્યયન ભધ્યે એકાંત જીવદ્યાએ, લોકોત્તર ભાવધર્મ સહૃદે, તેજને શુદ્ધ સમકિત કર્યું. ॥૮૮॥ હવે પાસત્થાદિક અસાધુ સિદ્ધાંતનો માર્ગ આદરી તે માર્ગ ચાલે નહી, અને પોતાને છાંદે વિરદ્ધ માર્ગ ચાલે. તે સંસાર સમુદ્ર તરવા તારવા સમર્થ નહિ તે કણીયે છીએ.આચારાંગના બીજ લોક વિજ્ય અધ્યયન ભધ્યે ભગવંતે ભાખ્યું, સુધર્મી સ્વામી જંબુ પ્રત્યે કહે છે. એ જે આગળ કહેશે તે તીર્થેકર દ્વે કર્યું કે લોકમાંહિ પ્રત્યક્ષ પાસત્થાદિક અસાધુ સંસારસાગર તરી પાર પામે નહિ, અનેરાને પાર પહોંચાડે નહિ. તે એટલા માટે, આદરવા ચોગ્ય સિદ્ધાંતનો માર્ગ આદરી અંગીકાર કરી, પછી પ્રમાણને વશે સિદ્ધાંતને વશે સિદ્ધાંતને માર્ગ ચાલે નહિ, અને સિદ્ધાંત વિરદ્ધ કુગુરની કહેલી કુડી પરંપરા આગળ કરી, પોતે ખાટે માર્ગ ચાલે-પ્રવર્તે, તે માટે, તે વિપરીતાચારી સંસાર સમુદ્ર તરવા અસમર્થ ॥ ૭:॥

વળી ખીજ અંગ મધ્યે લગવતે કહ્યું કે:-નેમ સચિદ નાવા પોતે  
તરે નહિ, તે વારે ભાલ મિલકત સહિત બેસનારને તારે નહિ. તેમ અ-  
સાધુ તરવા તારવા અસમર્થ. જહુ આસાવણીનાવિ જાઈ અંધો  
કુર્દિયા, ધર્મજઈ પારમાગન્તુ અંતરાય વિસીયદ ॥ ૧ ॥  
તુ સમણું એગે મિચ્છદિંહિ અષ્ટુંદીયા, સોયં કસણું  
માવજા, આગાંતારો અહુભયં ॥ ૨ ॥ તથા લગવતી અંગ  
મધ્યે લગવતે કહ્યું કે:-મૂળ ગુણ પાંચ મહાવત સુદ્ધાં પાળે નહિ,  
અને સાધુનો વેશ રાખે, માથે કોચ કરાવે, અણુવાણે પગે ચાલે તે  
અસંવુડ અણુગાર ધણાં કર્મ બાંધી સંસાર માંહિ પરિબ્રમણ કરે.  
॥ ૩: ॥ અસંવુદેણાં લાંતે અણુગારે કિં સિજુઝીં, બુજુઝિં  
સુચચ્છિં, પરિનિષ્વાદ સંવ દુક્ખાણુમંતં કરેઠ. ગોયમા નો  
ઇણુઠે સમઠે ॥

એમ સિદ્ધાંત માંહિ ધણા અધિકાર છે. હવે સિદ્ધાંતમાંહિ  
સાધુના જે ગુણ કલ્યા છે. તેણે ગુણે કરી જ્યાં સુધી સહિત છે,  
જ્યાં સુધી સાધુનો આચાર પાળે છે. જ્યાં સુધી વીતરાગની આજા  
આરાધે છે, લાં સુધી સાધુ સદ્ધબ્બવા. અને ગુણ રહિત થયા તે  
વારે તે સાધુ સદ્ધબ્બવા નહિ ॥ ૩ ॥ સાક્ષી દ્શ વૈકાલિક  
સૂત મધ્યે. લગવતે સાધુના ૧૮ ગુણ કલ્યા. પાંચ મહાવત, છહું  
રાત્રિલોજન વિરભણુપત, ૬ છકાયના જીવની જયણા ૧૨ તથા  
સદોષ આહાર ઉપાસરો વબ્દ પાત્ર વજો અને નિર્દોષ લોગવે ૧૬  
તથા દેસ રનાન-સર્વ સ્નાન વજો ૧૭ તથા શરીરની તથા  
ઉપગરણુની શોભા વજો ॥ ૧૮ ॥ એ અદાર ગુણે કરી સહિત  
હોય ત્યાં સુધી તે સાધુ કલ્યા. તથા એ અદાર ગુણ માંહિ સત્તર  
ગુણ પાળે છે અને અનેરો એક ગુણ પાળતો નથી તો તે નિર્બન્ધ  
પણા થકી બ્રષ્ટ કહ્યું. તીર્થકરહેવે ॥ ૪: ॥

વળી કોકમાંહિ સાધુ થકી અસાધુ ધણા છે. તેહને કોકસાધુ કહે

છે. પણ સિદ્ધાંતના જાણુ હોય તો અસાધુને સાધુ કહે નહિ. સાધુને જ સાધુ કહે. નિર્ગણુ સાધુને સાધુ ન કહિએ. તો પ્રતિમાને તીર્થકર શ્રી પાર્વતિનાથ, મહાવીર જાર્યા કેમ કહિએ? ઘરબે ધરે અસાહુ લોચે વુચ્ચંતિ સાહુણો, ન લવે અસાહુ સાહુતિ, સાહુ સાહુતિ આલવે ॥ ૧ ॥ નાણુ દંસણ સંપત્તિ, સંજમેય તવે રથં, એવં ગુણુ સમા ઉતં, સંજયં સાહુ માલવે ॥ ૨ ॥ દશ વૈકાલિકના ભાષા અધ્યયન ભધ્યે એહવા અધિકારને મેળે સાધુના ગુણુ રહિત થકા પોતાના વડેરાનાં નામ ધરાવી, શિષ્ય પ્રશિષ્યની પરંપરાને, પ્રતિ-બધ્યે પ્રવર્તે. તે સાધુ કેમ કહેવાય ? માટે સાધુને ગુણે કરી સાધુ કલ્યા. અને ગુણુ રહિત થયા તે વારે અસાધુ કલ્યા. તે માટે ગુણુવંતની પરંપરા પ્રમાણ જણાય છે, પણ પોતપોતાના વડેરાનું નામ ધરાવ્યાની પરંપરા પ્રમાણ દીસતી નથી મહાવીરદેવનો હાથ દીક્ષિત શિષ્ય જમાલી અણુગાર તથા જોસાદો ગુણુવંત, ગુણુ હતા તે વારે સાધુ કલ્યા તથા સંભોગી કલ્યા તથા વંદનીક હતા, અને ગુણુરહિત થયા તે વારે અવંદનીક થયા. તથા નેમનાથના શિષ્ય થાવચ્ચા પુત્ર અણુગાર તેહના શિષ્ય શુકૃદેવ સાધુ, તેહના શિષ્ય શેખક રાજઋષિ, ગુણુવંત હતા તે વારે સુસાધુ કલ્યા અને ગુણુ રહિત થયા તે વારે પાસથા કુરીલીયાદિ કલ્યા. વળી ગુણુવંત ઉચ્ચ વિષારી થયા તે વારે સાધુની પરંપરા માંહિ કલ્યા. જે શિષ્ય પ્રશિષ્યની પરંપરા પ્રમાણ હોય તો એહને પાસથાદિકપણું કેમ કહે. તથા ચતુર્વિધ સંધને અવંદનીક કેમ કહે તથા ગર્ગાચાર્યે પોતાના શિષ્ય અવનીત જાણી તન્યા. તથા જમાલીના ગુણુવંત શિષ્યે જમાલીને ગુણુરહિત ગુરુ જાણીને તન્યા. ॥ ૩ ॥ ॥ ૧૦ ॥ તથા કોઈ કહેશે જે એહવા ગુરુ છે તો તે ગુરવાદિક ભધ્યે ગુણુ નથી તો તેહને અવગુણુ થાશે, તમે તેની નિંદા શાની કરો છો ? ધતિ નિંદા પ્રશ્ન:-તેનો ઉત્તર:-સસમયે જિતમત

સ્થાપવાની આજા કહી. અને પરસમયે પરમત નિરાકરવાની આજા કહી. તથા સાચો માર્ગ પ્રરૂપતાં, સાચું સ્થાપતાં અને ઓદું ઉત્થાપી, નિરાકરતાં નિંદા ન કહીએ. હાણુંગમાંહિ લગવંતે ચાર પ્રકારે વિક્ષેપની કથા કહેવાની આજા કહી. પરસમય કહે. ॥ ૧ ॥ પર સમય કહે, સ સમય સ્થાપે. ॥ ૨ ॥ પર સમયનો કોઈક સાચો શબ્દ કહે, પછે તેહનો ભિથ્યાવાદ કહે. ॥ ૩ ॥ ભિથ્યાવાદ કહી સમ્યક્વાદ સ્થાપે. ॥ ૪ ॥ વિષેવણી કહુન્ને, ચઉવિહાએ, પન્તાએ તં જહા, સસમય કહેછ (૨) તા, પરસમય કહેછ ॥ ૧ ॥ પરસમય કહુા વિતા લવધ ॥ ૨ ॥ સમભાવાય કહેછ (૨) તા, ભિધાવાય કહેછ (૨) તા, ભિન્ધાવાય કહેછ ॥ ૩ ॥ ભિન્ધાવાય કહિતા, સમભાવાય હાવિતા લવધ ॥ ૪ ॥ ચોથા હાણા મધ્યે તથા વિતરાગ દેવનાં વચન સાચાં પ્રરૂપતાં કેટલાએકને નિંદા સ્વરૂપ થઈ લાસે છે. તે સિદ્ધાંત સામું જેતાં નથી. જે લણી લગવંતે જે સાધુ અસાધુનો માર્ગ કહ્યો છે. તે નિંદા કરીને તથા ગોશાલે આધાકર્માદિ ૪ વર્ષુ સ્થાપી તે વારે આર્ડ્કુમાર સાધુએ તેહના સેવણુંબારને ગૃહસ્થ કલ્યા, પણ સાધુ ન કલ્યા. એવો શુદ્ધ માર્ગ પ્રરૂપો. તે સાંભળી ગોશાલા પ્રમુખને ઇચ્છો નહી, તે વારે ગોશાલે કહ્યું તમે સૌની નિંદા કરો છો. તે વારે આર્ડ્કુમાર એલયા-હું નિંદા કરતો નથી. તીર્થીકર દેવે જેવો માર્ગ કહ્યો છે, તેવો માર્ગ પ્રરૂપું છું. સાચું કહેતાં નિંદા નથી. જેમ સહુ પોતપોતાના શાસને સ્વર્ગ કહે છે. પરશાસન નિરાકરે છે. તેમ હું પણ જિનશાસન સાચું પ્રરૂપું છું. એમ કહી, ગોશાલો, બૌધ્ધ, તથા સંખ, ધ્યાલણ, હસ્ત તાપસ પ્રમુખ ધણા વાદીએને નિરાકરી સાચો માર્ગ સ્થાપ્યો.

એ ન્યાયે બીજા અંગના આર્ડ્કુમારના અધ્યયન મધ્યે નામ લઈને આગલાની લુંડી એથ ઉધાઉ તે નિંદા, પણ સત્ય માર્ગનું પ્રરૂપવું.

તे નિંદા નહિં. ॥ ૩ ॥ તથા શ્રી સિદ્ધાંત ભાંડી ઢામ ઢામ તીર્થકર હવે તથા ગણુધરે તથા બૃહુ શ્રુત સાધુએ તથા આવકે તથા સમકિત દલિએ સાચો માર્ગ સ્થાપ્યો છે અને ખોટા માર્ગ નીરા કર્યો છે. તે નિંદા કરી નથી. આચારાંગના ૪ થા સમકિતના અધ્યયન મધ્યે તીર્થકર હવે હિંસાધર્મના સ્થાપકને અનાર્ય કલ્યા. તે નિંદા કરી નથી. તથા બોજ અંગમાંહિ અન્ય દર્શની અને અસાધુનો માર્ગ નિરાકરી (પ્રતિકારી) સંવર માર્ગ સ્થાપ્યો. ૩૬૩ પરવાહી અધર્મ પક્ષમાં કલ્યા, તથા જે સમણુમાહણ હિંસાધર્મ પ્રદે તે સંસારમાંહિ રખડે, ગાઢા દુખી થાય. વારંવાર જન્મ મરણ કરે, દારિદ્રી દુલ્ભાંગી થાય. હાથ પગાદિકનો છેદ પામે અને જે દયા ધર્મ પ્રદે, તે સંસાર કંતારમાંહિ રખડે નહિં. દુખી ન થાય. હાથ પગાદિકનો છેદ ન પામે. તે સીજે, યુઝે, સર્વ દુઃખનો અંત કરી મુક્તિ પામે. એવું કહ્યું. તે નિંદા કરી નથી. તથા પાંચમે અંગે ભહાવીરહેવે સોમિલ આલણુ આગળ આરંભયુક્ત યાત્રાદિક નિરાકરી, તપ નિયમ સંયમ સત્ત્રાય ધ્યાનદ્રષ્ટ જીવદ્યા યાત્રા સ્થાપી. તે નિંદા કરી નથી. તથા જમાલી નિનહુવનું કેવલીપણું ગૌતમ સ્વામીએ નિરાકર્યું તે નિંદા કરી નથી. તથા ઉત્તરાધ્યયન મધ્યે હરકેશી ચંડાલ અણુગારે આલણુ આગળ દ્રવ્ય સ્નાન, દ્રવ્ય યજ્ઞ નિરાકરી ભાવસ્નાન, ભાવ યજ્ઞ સ્થાપ્યો તે નિંદા કરી નથી. તથા પુરોહિતના પુત્રે પોતાના પિતા આલણુ આગળ વેદનું લણુવું, કુપાત્રને પોષવું ગ્રસુખ નિરાકરી સંયમ ધર્મ સ્થાપ્યો, તે નિંદા કરી નથી, તથા ક્ષત્રીય રાજક્રષણીએ સંયતરાજક્રષણી આગળ કિયાવાહી અકિયાવાહી અજ્ઞાનવાહી વિનયવાહી નિરાકર્યાં. તે નિંદા કરી નથી. તથા અનાથી નિર્યથે શૈખિકરાજ આગળ સંસારનું અનાથપણું અને અસાધુનો માર્ગ ભહાવત મૂળગુણુ સુદ્ધા પાળે નહિં. સુમતિ શુભિ શુન્ય અને અણુવાણે પગે ચાલે, લોચ કરાવે, ભૂમિ પર સૂવે, તો પણ તે પોલી મૂડીની પેરે તથા ખોટા નાણુની પેરે અસાર કલ્યા. તે મણી સરીખા, કાયની પેરે મૂલ્ય ન

પામે તથા આહાર ઉપગરણ ઉપાસરો આધાકર્મી પ્રમુખ સહોષ લોગવે. અગ્રોની પેરે મળે તે મૂકે નહીં. તે અસાધૂ શત્રુ સરીઓ. દ્યા રહિત કલ્યા; તે નિંદા કરી નથી. તથા રાજેમતી સાધીએ કહ્યું. જે રહનેમિ તુજને ઘિંજાર હો. જે ભણી વમી વરતુ વાંછે છે? તુજને ભરણ એય છે. પણ અણુચાર આચરવો એય નહિં. તે નિંદા કરી નથી. તથા જ્યથોષ મહામુનિએ વિજ્યથોષ અાલણુ આગળ વેદ્યજ્ઞ જ્યોતિષ પુરાણ અાલણુગુરુ સાવદ્ધ કરણી નિરાકરી, ભાવવેદ ભાવયજ્ઞ ભાવજ્યોતિષ ભાવપુરાણ ભાવઅાલણુ ગુરુતારણુતરણુ, એવા અધિકાર સ્થાપ્યા. તે નિંદા કરી કેમ કહીએ? વિચારી જોને. તથા છે અંગે થાવચ્ચાપુત્ર અણુગારે શુક પરિવ્રાજક આગળ સાવદ્ધ યાત્રા નિરાકરી. જીાન દર્શન ચારિત્ર ઇપ જીવદ્યા યાત્રા સ્થાપી, તે નિંદા કરી નથી. તથા સાતમે અંગે કુંડકોલિક શ્રાવકે નિયતવાદી ગોશાલામતિ દેવતાને નિરાકર્યો. તે ઉપર મહાવીરહેવે સાધુ સાધીને કહ્યું જે તુમ્હે વિશે અન્ય તીર્થીકને નિરુત્તાર કરવા તે તથા સદાલપુત્ર કુંભાર શ્રાવકે ગોશાલાને નિરાકર્યો તે તથા છે અંગે મહીકુમારીએ ચોખી સન્યાસણી આગળ ઇધિરે ખરડયું વસ્ત્ર ઇધિરે શુદ્ધ ન હોય. એવે દષ્ટાંતે કરી સાવદ્ધ દાન ધર્મ શૌચ ધર્મ તીર્થાલિપેક ધર્મ નિરાકરી દ્યાધર્મ સ્થાપ્યો. તે નિંદા કરી નથી. તથા આઠમે અંગે નેમનાથના ૬ અણુગારના ત્રીજા સંધારાને દેવકી રાણીએ કહ્યું જે દારિકા નગરીમાંહિ ઉચ્ચ નીચ મધ્યમ કુલે આહાર નથી ભળતો? જે ઇરી ઇરી એકજ ધરે આવો છો? તે નિંદા કરી નથી. તથા અનંતે કાળે પંચમ આરા માંહિ અદૃપતિ અસાધૂના રાજ અછેરાને પ્રલાવેંઅનેક અનાચાર પ્રદ્યા, ચૈતાલાં કરાવ્યા. દ્રવ્ય પૂજન પ્રદ્યપી, દ્યા ધર્મ દૂર કર્યો. તે અવસરે કમળપ્રલ આચાર્યે 'જે કે જિનાલયો છે; તો પણ તે સાવદ્ધ છે' એમ કહી સાવદ્ધ કરણી નિષેધી. તો તીર્થીકર નામકર્મ ઉપાન્યુ. ॥૩॥ ૧૧ ॥ એ નિંદા આશ્રી ઉત્તર કલ્યા ॥ ૪: ॥

હવે ભિથ્યાત સહિત ધર્મ કરણી કરે તે આશ્રી કહે છે. ભિથ્યાત મૂક્યા વિના જે ધર્મ કરણી કરે તે બાળ તથા અકામ નિર્જરા; પણ સ્કામ નિર્જરા નહિ. લગવતી અંગના ઉમા શતકના ૨૩ ઉદેશા મધ્યે લગવંતે લાખયું જે કાઈ જીવ અજીવ ત્રસ સ્થાવર એ નવ પદાર્થ જાણે નહિં, અને આરંભનાં પરચ્યાખાણું કરે તે હુઃપરચ્યાખાણી કલ્યો તથા મૃપાવાદી કલ્યો. તથા તે ત્રિવિધ ત્રિવિધ કરી અસંત અવિરતિ તથા એકાંત બાળ કલ્યો. એટલે કાઈ કરણી કષ્ટ કરે, તે આલ તપ અકામ નિર્જરામાંહિ બણે.

સેન્ન્યુણું ભંતે સંવ પાણેહિં, સંવ ભૂઅેહિં, સંવ-સતોહિં; પરચ્યાખાય ભિતિ વયમાણુસસ કિસુપરચ્યાખાય ભવધ, દુપરચ્યાખાય ભવધ, ગોયમા સિય સુપરચ્યાખાય ભવધ, સિય દુપરચ્યાખાય ભવધ, સંકેણુઠેણું ભંતે એવં વુચ્ચ્યાઈ ॥૨॥ ગોયમા, જરૂસણું સંવ પાણેહિં, જાવ સંવ સતોહિં પરચ્યાખાયભિતિ વયમાણુસસ, નો એવં અલિ સમત્તાગય ભવધ જે ધરે જીવા, ધરે અજીવા, ધરે તસા, ધરે થાવરા, તરસણું જીવ પરચ્યાખાય ભિતિ, વહમાણુસસ, નો સુપરચ્યાખાય ભવધ, દુપરચ્યાખાય ભવધ, એવં ખલુ સે, દુપરચ્યાધિ, સંવ પાણેહિં જાવ સંવ સતોહિં; તિવિહંતિવિહેણુ, અસંજ્ય અવિરય, અપદિહ્ય, પરચ્યાખાય પાવકમ્ભે સકિરિએ અસંધુડે, એકંતદંતે એકાંત બાલેયાવિ ભવધ ॥ ૪: ॥

તથા તામલી મોારી તાપસે ભિથ્યાત સહિત તપ કર્યો. તો બાલ તપસી કલ્યો. તથા જમાલી પ્રમુખ નિનહુવ ધોર તપના કરણું હાર પણ પરભવના આરાધિક નહિ. વિરાધિક તથા પાસત્થા કુર્શી-કીયાદિક તપ કરે તથા તે સમીપે અનેરા તપ કરે તે બાલ તપ. અકામ નિર્જરા કહી. જે લણી અસાધુની સંગતે સેવા તે ભિથ્યાત્વ. વિપરીત સદહણ્ણા માટે.

ભાવ સમગ્ર મોઈજો, ઘોર વીર તવંચરે, અચરંતો  
ઇમં પંચ. હું આસવ્ય નિરંઠય ॥૧॥ કુસીદો સત્ત પાસ-  
ન્થો, સણ્ઠે સખ્યે તહો, દિઠિએ વિ ઇમે પંચ ગોયમા ન  
નિરખએ ॥ છ: ॥ તથા સાક્ષી મહાનીશાયે જ્યે અધ્યયને તથા  
નાગિલ આવક પ્રત્યે સુમતિ ભાઈઓલ્યો. એ પાંચ સાધુ છઠ અડમ  
માસખમણ ઘોર તપ કરે છે. ઉષ્ણકાળે આતાપના લીએ છે. તો  
એક વળાવો લીધો માટે. એવા ગુણવંત તપસીને કુસીલ કેમ કહો ?  
તે વારે તે નાગિલ આવક એલ્યો. હે સુમતિલાઈ, તમે બાલતપ  
અનુમોદો મા. એ અકામ નિર્જરામાંડિ ભણ. અસાધુને સાધુ સહૃદૈ  
તે ભિથ્યાત્મ. અસાધકના દર્શન થકી, નંદમણિયાર શેડતી કરણી  
નિર્થક થઈ. ॥ ૩ ॥ એટલા માટે ભિથ્યાત્મીના તપાદિક દેખી  
અનુમોદવા નહી. ॥૧૨॥ છ: ॥

હવે ભિથ્યાત્મ તે કેને કહીએ તે કહે છે. વિપરીત માને સહૃદૈ  
તે ભિથ્યાત્મ. સાચાને ખોડું સહૃદૈ તથા ખોટાને સાચું સહૃદૈ તે  
ભિથ્યાત્મ. તેણા લેદ ૧૦ કહીએ છીએ. દશમે દાણે દશ પ્રકારે  
ભિથ્યાત્મ પ્રરથ્યું. અધ્યમે ધર્મ સત્તા કહેતાં ગોસાલા પ્રમુખના  
ગ્રંથને વિષે અનુતથર્મની યુદ્ધિ તે ભિથ્યાત્મ (૧) અધર્મને ધર્મ કરી  
જાણે તે અધર્મ કયા કયા તે કહે છે. કન્યાદાન દીયે, ધર્મને હેતુએ,  
આલણુને સેન્યાનાં દાન દીએ ધર્મને હેતુએ, આલણુને ક્ષેત્રના દાન  
દીએ, નદીએ નહાવા જાય, માધરસનાનાદિક પીપળે પાણી ધાલે  
ધર્મને હેતુએ, તુલસીએ પાણી ધાલે ધર્મને હેતુએ. તે કેવળ અધર્મ  
છે. તેણને ધર્મ કરી જાણે. તે અધ્યમે ધર્મસત્તા કહીએ ॥ ૧ ॥  
ધર્મે અધર્મં સત્તા કહેતાં-અરિહંતના ભાષ્યાં સિદ્ધાંત, તેણને વિષે  
અનુતથર્મની યુદ્ધિ તે ભિથ્યાત્મ. તથા એ પ્રકારનો ધર્મ છે. એક  
ધર્મ સાધુનો બીજો ધર્મ આવકનો તેણને અધર્મ કરીને જાણે ॥૧૨॥  
ઉમરંગે સત્તા કહેતાં-અન્ય દર્શની અને અસાધુના પ્રરથ્યા ઉન્માર્ગને

વિષે સન્માર્ગની બુદ્ધિ તે ભિથ્યાત્વ. ॥૩॥ વીતરાગનો પ્રરૂપો જ્ઞાન દર્શન ચારિત્ર મોક્ષમાર્ગ તેહને વિષે, ઉન્માર્ગની બુદ્ધિ તે ભિથ્યાત્વ. ॥૪॥ અજીવે જીવ સન્મા કહેતાં-પરમાણું પ્રમુખ અજીવને વિષે જીવની બુદ્ધિ તે ભિથ્યાત. તથા આકાશ અજીવ છે તેહને અન્ય તીર્થી ઈશ્વરની મૂર્તિં કરી સદ્ધારે તથા કેટલાએક અજાણુપણે પીતળની મૂર્તિને પ્રલુબ કરી માને, પરમેશ્વરી માને. તથા પ્રતિમાને વીતરાગ કરી માને. જેમ કોઈક બાળક સિંહનો આકાર આદેખ્યો દેખ્યો, સિંહ સદ્ધારે તેમ ભિથ્યાત્વમતી પ્રતિમાને વીતરાગ સદ્ધારે. તથા ગાયના પૂંછડાને વિષે તેત્રીસ ડેડી દેવતા રહે છે જે એવું માને. તે અજીવે જીવ સન્મા કહીએ. ॥૫॥ જીવ અજીવ સન્મા કહેતાં-પૃથ્વી પ્રમુખ સચિત જીવને વિષે અજીવની બુદ્ધિ તે ભિથ્યાત્વ ॥ ૬ ॥ અસાધુ સુસાધુસન્મા કહેતાં અસાધુને વિષે સાધુની બુદ્ધિ તે ભિથ્યાત્વ અસાધુ તે પાંચ મહાત્મત પાલે નહીં. કેવલ વેશ માત્ર ધરીને પોતાના ઉદ્દરને પૂર્ણ કરે તે. ॥ ૭ ॥ સુસાધુ અસાધુ સન્મા કહેતાં સાધુને\* વિષે અસાધુની બુદ્ધિ તે ભિથ્યાત્વ ॥૮॥ અમૂર્તેમૂર્ત સન્મા કહેતાં-રાગદ્રેપ થકી અણ મૂકાણાને વિષે મૂકાણાની બુદ્ધિ તે ભિથ્યાત્વ. ॥૯॥ મૂર્ત અમૂર્ત સન્મા કહેતાં-રાગદ્રેપ થકી મૂકાણાને વિષે અણ-મૂકાણાની બુદ્ધિ તે ભિથ્યાત્વ ॥ ૧૦ ॥ એ ભિથ્યાત્વના ૧૦ લેદ ઢાણાંગસ્ત્રે કહ્યા. હવે ભિથ્યાત્વને શું કહીએ. ભિથ્યાત્વ સહિત જીવને શો અવગુણ થાય તે કહીએ છીએ. આવશ્યક સૂત્ર પ્રમુખમાંહિ ભિથ્યાત્વને સલ્ય કહ્યું જેમ શરીમાંહી સલ્યસાલે, આદું પીદું ગુણું ન કરે. તેમ ભિથ્યાત્વ મૂક્યા વિના ધર્મ કરણી સફળ ન થાય. સૂત્ર:-તિવિહે સલ્લ પનતો, તં

\* સાઠો સાધુ તે સંસારને વિષે જરૂર જરૂર મરણુના દુઃખ થકી પોતાના પરના આત્માને મૂકાવવાને ઉજમાલ થયા અને મોક્ષ માર્ગ સાથે તેહને અસાધુ સદ્ધારે તે ભિથ્યાત્વ.

જહા, માયાસલ્વેણ, ૧ નિયાણ સલ્વે ર ભિન્ધાદંસણ સલ્વે ॥ ૩ ॥  
 મહાઅળ અણુગાર માયા સલ્વ આદોવ્યા વિના, સ્વીવેદ આંધી, મહ્લી  
 કુમારી થયા. તથા ૧૨ મા અલદાત ચક્રવર્તી રાજ તથા વાસુદેવ  
 રાજ નિયાણા સલ્વને પ્રતાપે ધર્મ કરણી કરી ન શક્યા. ॥ ૨ ॥  
 તથા ભિન્ધાત્વ શલ્યને પ્રતાપે જમાલી પ્રમુખ નિન્હેવે તથા સાવદ  
 આચાર્યે (સાક્ષી મહાનિશિથ ઉ. ૩) સંસાર વધાર્યો તથા સાતમે  
 દ્વારે કણું જે પંચમ આરામાંહિ અસાધુને પૂજે માને અને સાધુને  
 પૂજે નહિ, માને નહિ. એટલે હેઠે નિંદ એવું ભિન્ધાત્વ આત્માનું કણું.  
 સત્તાંહિ ઠણુંહિ ગાંદ, દુસમં જણુંજા, તંજ હા, અકાલે વરસે,  
 કાલે નોવરસે, અસાધુ પૂજાંતિ, સાધુ નો પૂજાંતિ. ગુરુ જણુંહિ,  
 ભિન્ધા પડિનજો ॥ મણુદુહ્યા, ઉણું અધિકું તથા નિપરોત માને.  
 તે ભિન્ધાત્વ ॥ ૧૩ ॥ હવે ભિન્ધાત્વ સેવ્યાના ઇળ તથા  
 ભિન્ધાત પ્રર્થયાના ઇળ સંસાર વધારે. એધ અન્ન દુર્બાં.  
 સાક્ષી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ મા અધ્યયન મધ્યે કણું,  
 જે કુદેવ કુગુર કુધર્મ ૩૫ ધર્મ, ભિન્ધા દર્શાનને વિષે જે રાતા  
 છે. તેણે રંગે કરી રંગાણા છે. એટલે ભિન્ધાત્વને વિષે માતા છે.  
 ભિન્ધાત્વ સહિત કરણી કરી જે જીવ મરે તેણે આગમીક ભવે  
 એધાનોજ નિનધર્મનું પામવું ધણું દુર્લભ. દોહિલું કણું. એવા  
 મરણ સંસારમાંહિ ઘણા કરે.

**સૂત્ર:-** ભિન્ધાદંસણરતા સનિયાણ કન્હુલેસમોગાંઠા, ઈય જે  
 મરાંતિ જીવા તેસિં પુણુ દુદ્દલહા એહી ॥ ૧ ॥ આલ મર-  
 જાણિ બહુસો, અકામ મરણાણિ ચેવ, અહુયાણિ મરહાંતિ  
 તહેવ રાયા, જિણુન્યણં જે ન યાણાંતિ ॥ રાણા છઃ ॥ તથા સંજ  
 ગઈ પખાંદ, કાણાંતિ અણાંતગે અકય પુણા, જિન સુણાંતિ  
 ધર્મમં, સઉશ્રૂય જેય પમાયાંતિ ॥ ૨ ॥ અણ સઠાંપિ અહુ-  
 વિહાં, ભિષ દ્વિન્દીયા, નરા અણુદ્વિયા, અદ્ધ નિકાય કરમા,  
 સુણાંતિ ધર્મમં નય કરાંતિ ॥ ૨ ॥

દશમા અંગના પ મા આત્રવદાર મધ્યે ॥ ૧૪ ॥ ૪: ॥ તથા  
અતીતકાલે, અનંતમી ચોવીસીએ ૨૪ મા ધર્મસિરી નામા તીર્થેકર  
મુગતિ ગયા પછી અસંજ્યાણું પૂયા એહવે નામે અછેરું થયું અને  
હમણું પણ પંચમ આરામાંહિ અસંજ્યાણું પૂયા નામે અછેરું વહે છે.  
તથા જિન વલ્લભ સૂરિનો લખેલો સંઘપણું અંથ છે. તેના કાવ્ય ૪૦ ફે  
તે મધ્યે પણ પંચમ આરામાંહિ અસંજ્યાણું પૂયા નામે દસમું અછેરું  
કલ્યાન. તે સંઘપણું કાવ્ય ૬ લખીએ છીએ ॥ ૪: ॥

ઇહ કિલડલિકાલ વ્યાલવ કત્રાંતરાલ સ્થિત જીવિગત તત્વ  
પ્રીતિ નીતિ પ્રચારે, પ્રસરણનવ બોધ પ્રસ્તુતકાપથૌધ-  
સ્થિગિત સુગનિ સર્જી, સંપ્રતિ પ્રાણિ વર્ગી ॥૩॥ ગ્રોત્સર્પે હસ-  
સમરાશિથાન સખ દશમાશ્વર્ય સાગ્રાન્ય પુષ્યત ભિથ્યાત્વદ્વાં  
તરુદેજગતિ વિરલતાંયાતિજૈનેન્દ્ર માર્ગો, સંકિલણી, મૂઢ  
પ્રખલ જરૂર જનાર્નાયરક્તે જીનેાક્તિ ॥ પ્રત્યર્થી સાધુવેવૈર્વિષયિ  
લિરલિત: સોયમ પ્રાણિ પંથા ॥૪॥ કિહિમેાહમિતા: કિમંધ  
ખધિરા: કિયોગ ચૂણી કૃતા: કિ દેવો પહૃતા: કિ મંગ ઠગિતા:  
કિંવા અહાવેશિતા: કૃત્વા મૂર્ખનપદં શ્રુતસ્યયહમી દણ્ટોસુ-  
દ્વાધા અપિ, વ્યાવૃત્તિં કુપથાજરા ન દ્યતે. સૂર્યાત્યિતકૃતે ૧૭  
જિનગૃહ જિન બિંબ જિન પૂજન જિનયાત્રાહિવિધિ કૃતાં;  
દાન તપોપ્રતાદિ ગુરુ ભક્તિ શ્રુત પડનાહિ ચાદત—સ્યાદિ  
હુ કુમત કુગુર કુશાહ કુષ્ણોઽ કુહેશનાં શતાઃ સ્કુટ મન લિમત  
કારી વર લોજન ભિવ વિપલવનિવેશના: ॥૫॥ આકૃષ્ટાં  
મુગ્ધમીનાન ખડિશાંપ શિત વદાયિંબમાદશર્ય જૈનાં, તત્ત્વાર્ના  
રમ્યરૂપાન પવરકમહાન સ્વેષ્ટ સિદ્ધ્યયૈ વિધાય, યાત્રા સનાત્રા  
દુપાયૈન્નમસિતક નિશા જગરાધૈશ્છલીશ્ચ ॥ શ્રદ્ધાદુન્નામ  
જૈનેશ્છલિત ધ્રવ શઠી વીંચ્યતે હા જનોડ્યમ ॥૨૨॥ સેપાહુંડા  
વસ સર્પિષ્યનું સમયાન સદ્ગુણ્ય ભાવાનુભાવા, ત્રિંશશ્રો-

અહોઽય અખનખમિતિ વર્ષ સ્થિત લંસમરાશિ: અંત્યંચા-  
શ્રીયમેત જિનમતહૃત યેતસમા હુંઘ માચે, ત્યેવં પુણેષુ દુષ્ટે-  
ષ્વતુકુદી મધુના હુલ્લાલો જૈનમાર્ગઃ ॥ ૩૦ ॥

**શખદાર્થ:**—ઈં આ કિ૦ સંભાવનાયાં, ક૦ પાંચમા આરા  
૩૫ી, બ્યા૦ સર્પ્ય૦ વ૦ મુખ તેનો વચ્ચેલો લાગ સ્થિતો ત્યાં રહ્યો. જ્ઞ.  
સેવતો જવસ્સમુહે ગ૦ ગઈ ત૦ તત્ત્વની પ્રીતિ ની૦ વળી ન્યાયનું  
પાગવું ગયું તેથી પ્ર૦ પ્રસરતું નો અણુપ્રીછ્યો. પ્ર૦ પ્રક્રીં સ્તુ૦  
સ્કુંતકાર કરતો. ૫૦ કુમાર્ગનો ઉ૦ સમોષ સ્થયો તેણે કરો ઇંધાણું સ્તુ૦  
મુગતિને વિષે સ૦ સ્વર્ગે ઉપજવું. હવે પ્રા૦ પ્રાણી જીવ એહવે,  
તેહને સમુહે વધ. પ્રો૦ વૃદ્ધિ પામતું લ૦ લંસમરાશી અહ તીજુમો.  
સં૦ મિત્ર છે. ૬૦ દશમું અછેડં જેહને સા૦ સમસ્ત દુકુરાધ પોષતો  
એહવું દશમું અછેડં મિત્ર છે જેહને મિ૦ મિથ્યાત્વર્દ્ય અંધકાર  
તેણે ૩૦ ઇંધાણે ૪૦ સંસારને વિષે. વિ૦ હુલ્લાલતાને પામ્યા છે. જિ૦  
તીર્થકરને માર્ગે સં૦ પરસ્પર વિસ્ક્ષના બોલણુહાર દ્વી૦ ગુણવંતના  
દ્વેષી મુ૦ અછતાદોપભાપક જ૦ મૂર્ખ્ય જન, તેહની પરંપરા ત્યાં  
રાતા. જિ૦ તીર્થકરના ઉ૦ વચન પ્ર૦ તેહના વૈરી એહવા લીંગે સા૦  
કેવલ સાધુવેશને ધરનાર વિ૦ શખદાદિ વિષયવંતા, ૨૦ સર્વે પ્રકારે  
સો૦ આગલ કહેશે વિસ્તાર્યુ તે માર્ગ. કિ. શુ. દ્વી૦ દિગ્મૂહદ્વારાને  
ઈ૦ પામ્યા છે. કિ૦ શું આંધળા થયા છે. બ્ય૦ શું બહેરા થયા છે.  
કિ૦ શું ચોગવંત લાવે ભૂરકી ધાલી છે કિ૦ શું દ્વી૦ કર્મ ઇદ્યાં  
છે. કિ૦ શું અં૦ ક્રોમલાભંતણે ૬૦ ક્રોણે કે ધૂતર્યાં છે. કિ૦ શુ.  
વા૦ અથવા. અ૦ પાડુયાગ્રહ આવ્યા છે. કૃ૦ કરીને મૂ૦ ભરતકને  
વિષે. ૫૦ આચાર્યાદિકનું પદ લઈને. શ્રુ૦ સિદ્ધાંતનું. ૫૦ એહવે કહે  
છે. ૬૦ દીકા છે અનાચારના મોટા દોષ જેણે અ૦ પણ. બ્યા૦  
નિવર્ત્યુ સર્વે કુ૦ લુંડા માર્ગ થકી, ૭૦ મૂર્ખ્ય લોક. ન૦ નથી  
કરતા, નથી ધરતા. સ્તુ૦ વલી તે મૂર્ખજન કેહવો છે. નિંદા કરે છે

એ ત૦ પૂન્યના કરનારની, જિંહો દેહરાં. જિંહો તીર્થકરની પ્રતિમા. જિંહો તીર્થકરની પૂજાદિક જિંહો તીર્થકરની યાત્રાદિક વિંઠો એ સર્વ વિધિ કીધું. દાં દાનનું દેવું. ત૦ તપનું કરવું. વ૦ પ્રતાદિકનું કરવું. ચું ચુંની ભક્તિ શું સિદ્ધાંતનું ભણવું સ્થાં એ સર્વથા એ છે. ધ૦ એણે સંસારે કું લુંડા મતના દેસથી પણ. કું લુંડા ચુંના ચોગયથી કું કદાચહના દેસથી કું ભિદ્યાત્વના દેશથી કું લુંડી દેશનાના દેસથી. રંકું પ્રગટ અ૦ અવાંછિતપણું થાય. વ૦ પ્રધાન. ભોં ભોજન, ધવ૦ જેમ અવાંછિતકારી થાય. ત્રિ૦ તેમ તે પ્રધાન ભોજન થયું છે. વિંઠો વિપને ઉલે કરી સહિત છે સંયુક્ત છે. આ૦ તાણુવાને અર્થે મું મૂર્ખ લોક રૂપો. મી૦ માછલાને. જિંખ૦ જેમ ધીવર લોહના કંટાને વિષે માંસની ડલી મૂકી મછને તાણે તેમ. શું કરીને બિંઠો તીર્થકરની પ્રતિમા દેખાડીને ત૦ વલી શું કરીને, તીર્થકરને નામે કરીને. ૨૦ સુંદરાકાર રૂપ છે. અ૦ એરાડા અને મહને. રૂવે૦ પોતાના વાંછિતના સિદ્ધને કાને, વિંઠો કરીને. થા૦ યાત્રા અને સ્નાનાદિક એહવે ઉપાયે કરીને. ન૦ નવાં ઇલાદિક ઢોકનું. નિ૦ રાત્રિ જગરણાદિક કરીને છીં એહવે છીં કરીને શ્રી શ્રદ્ધાવંત, ધર્મિષ ના૦ લિંગીએ કેવળ નામ જૈન એહવે. ૨૪૦ છલ્યાની પેરે છળ્યું. વળી કેહવે લિંગે, શા૦ ધૂતારે. વં૦ વંચ્યું, દુંચ્યું. હા૦ વેહે છે. ૩૦ આ પ્રત્યક્ષ દૃષ્ટીએ છીએ. ઉ૦ સમૂહને સે૦ તેહવે વર્તે છે. દુ૦ ઉત્તમ પુરુષની હાણિ ભાટે, ધાતીલા અચ્ય૦ ઉત્તરતો કાળ. અ૦ સમય સમયપ્રતિ દુ૦ હીનતાને પામે છે. ભ૦ સરાભાવવર્ણાદિ અ૦ સડાનો પ્રભાવ જેહને વિષે ત્રિ૦ વલી ત્રીસમે ઉ૦ ઉત્કૃષ્ટ અચ્યાં, એકગ્રહ ખ૦ ૨૦૦૦ વર્ષની સ્થિરો સ્થિતિનો ધણી છે. ભ૦ ભરમ-રાશિગ્રહ, અને વળી અત્યં૦ છેલ્લું દસમું અછેરં જિંહો તીર્થકરના મ૦ માર્ગના ૬૦ ધાતને અર્થે ત૦ તે સરીખું દુ૦ પાંચમો આરો

૪૦ એણે પ્રકારે ૫૦ વૃદ્ધિ પામતે છતે દું દુષ્યથું છતે ૫૦ નિરંતર  
૭૦ વર્તમાનકાળે દું પામતાં દેહિલું. નૈં તીર્થકર્ણો માર્ગ.

અહિં તો પ્રસ્તાવિક માટે કાંય ૬ લખ્યા છે પણ સંધપદુક  
મધ્યે કાંય ૪૦ છે તે મધ્યે એ વિસ્તાર છે તે લખીએ છીએ-ઉદ્-  
શિકનું ભોગવતું ૧ જિનધરને વિષે રહેવું ૨ ઉપાસરાદિકને વિષે  
કોધાદિ કરવું ૩ દ્વય ગૃહસ્થ, દેહનાને વિષે અંગીકાર  
કરવું ૪ જે આસન પ્રતિસેખ્યું ન જાય તેહને રાખવું.  
૭ એ ૭ બોલ લિંગી આદરે છે. ધર્ત્યાદિકનું નિરાકરણ કર્યું છે  
॥ ૭: ॥ તથા પાર્શ્વચંદે પણ દરશું અછેડં પંચમ આરે કર્યું છે. તથા  
દસમે ઢાણે દસ અછેરાં કલ્યાં ત્યાં દરશું અછેડં અસંજ્યાણં પૂયા  
અહેવે નામે કર્યું છે. તેહના પ્રવાહમાંહિ જે જીવ પડ્યા તે ધર્ણં  
સંસારમાંહી રખડ્યા. અને વલી અસંજ્યમી અસાધુની પૂજા પ્રલાવના  
થકી અછેરાને પ્રલાવે કરી મિથ્યાત માંહિ પડ્યા થકા, સંસાર કંતાર  
માંહિ પરિબ્રમણું કરશે. એ મિથ્યાત સેવ્યાનાં ઇળ જણુવા ॥ ૧૫ ॥

હવે શ્રી વિતરાગને વિનંતિ કરેએ છીએ. અહો સ્વામી! કુગુરની  
વાસના ૩૫ પાસમાં પડ્યા જે નર, તે હરણની પેરે ટલવલે છે.  
સ્વામી! તેહને સરણું તુમ્હારાં તથા તુમ્હારા પ્રરખ્યા સિદ્ધાંતનું. સ્વામી  
એ પાસથી કાઢો. વળી જીાન દર્શન ચારિત્રના ગુણ વિના જે કુલા-  
ચાર ૩પે કરાવે હિંસા, તે લુટે છે શુદ્ધ ધર્મને, તેહ ર૩૫ શુદ્ધ નેત્રે  
દેખાડો. અજણે પડે છે ઇંદમાં, તેહને સ્વામી માર્ગ દેખાડો. લોક  
વિના જેમ નગરની મેદની, જેમ જીવ વિના કાયા ફેંક, તેમ દ્યા  
વિષુ પૂજા જેહવી નાટક તણી માયા; એહેવો શુદ્ધ ઉપદેશ, વિતરાગ  
પાસે માંગો. વિતરાગ વિના ક્રોધ તારવા સમર્થ નથો માટે વિનતિ  
કીધી સિદ્ધં ॥ ૧૬ ॥

હવે સમકિત વિના દેશવિરતિ શાવકનો ધર્મ તથા સર્વવિરતિ  
સાધુનો ધર્મ અપ્રમાણું તે સત્ત્ર સાખે કહીએ છીએ. ઉત્તરાધ્યમન

મધ્યે લગવંતે ભાખ્યું. સમકિત વિના ચારિત્ર ધર્મ ન હોય. દુઃખિણ્યારિત ધર્મે પનંતે તં જહા, આગાર ચારિત ધર્મે ચૈવ, અણુગારચારિત ધર્મે ચૈવ. બીજ ઢાણા મધ્યે દેશવિરતિ આવકનો ધર્મ તે આગાર ચારિત ધર્મ. સર્વવિરતિ સાધુનો ધર્મ તે આણગાર ચારિત ધર્મ. એ એહુ ધર્મ સમકિત વિના હોય નહી. જેમ પાયા વિના ભીત નહી. આંક વિના ભીડાં અપ્રમાણ, મૂળ વિના વૃક્ષ નહી તેમ સમકિત વિના ધર્મ અપ્રમાણ. તે માટે પહેલું શુદ્ધ સમકિત અંગીકાર કરી, પછી ચારિત ધર્મ આદરવો. ॥૪૩॥

સૂત્ર:-નત્થો ચરિતં સમ્મત વિહુણું દંસણે ઉલ્લંઘયત્વં, સમ્મત ચરિતાદ્યં, જુગય્યં પુય્યં ચ સમ્મતાં ॥૧૧॥ ના દંસણીસ્સનાણં, નાણુણ વિણા નડતિચણું ગુણા, અગુણિસ્સન નત્થી મોકાયો અમોકાખસસ નત્થી નિયમાણં ॥ ૨ ॥ ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયન મધ્યે સમકિત વિના જ્ઞાન ન હોય, અને યદ્વાપિ કાંઈ સિદ્ધાંત સૂત્ર ભણે તથા સાંખ્યે તો તે અશ્રુત અજ્ઞાન થઈ પરિણામે, જેમ સર્વ વિપવંત નરને સાકર ખાતાં કડવી લાગે, જેમ લૂણ ગળ્યું લાગે, તેમ સિદ્ધાંત મધ્યે દ્વા કહી. તે ભિદ્ધાત્વી અંતરંગ આત્માશું આત્મ કલ્પે ન જાણે. દ્વય દ્વા કરી ઉથાપે. ધ્યાદિ અજ્ઞાન થઈ પરિણામે તથા જ્ઞાન વિના આવકના તથા સાધુના મૂળ ગુણ ઉત્તરગુણ ન હોય તથા ગુણ વિના કર્મ થકી મૂકાવું ન હોય. તથા કર્મક્ષય વિના મુગતિ ન હોય. એટલે ધર્મનું મૂળ સમકિત જાણવું ॥ ૧૭ ॥ ૪૪: ॥

સમદંસણીસ્સ અનિયાણા સુક્લેસ મો ગાઠા, ઈય જે મરંતિ જીવા, સુલહા તેસિં ભવે હોછી ॥ ૧ ॥ સમકિત સેવ્યાના ઇણ સંસાર પરિત કરે. તેહને બોધ બીજ સુલભ. ઉત્તરાધ્યયનના ૩૬ મા અધ્યયન મધ્યે લગવંતે ભાખ્યું. સાચા દેવગુરુ ધર્મરૂપ દર્શનને વિષે જે રાતા છે તેણે રંગે કરી રંગાણા છે તેહને બોધ બીજ સુલભ.

જિષુવયણે અનુરતા, જિષુવયણું જે કરંતિ ભાવેણું, અમલા અસંક્હિ લિખા; તે હુંતિ પરિત સંસારી ॥ ૨ ॥ જે જીવ મિથ્યાત્મ મૂળ મૂકી, રાગદેષ ઉપસમાવી, અને દેવતાત્મ ગુરુત્વ ધર્મતત્ત્વ ઇપ સમકિત દર્શાનને વિષે રાતા થઈ, વિતરાગનાં વચન સાચાં સદ્ગી, આજા આરાધે. તે જીવને બોધ બીજ સુલ્લંબતે જીવ અવસ્થમેવ પરિત સંસારી કણીએ, પણ અમધ્યની પેરે સંસારમાંહિ ખુંચી ન રહે, તથા ભગવતી અંગમધ્યે, ભગવંતે ભાખ્યાં. દર્શાન સમકિતની ઉતૃકૃષ્ટી આરાધના આરાધે તો તેણે ભવે મુક્તિ જાય. તથા વિમાનિક દેવ થાય. બીજે મનુષ્યને ભવે મુક્તિ જાય. તથા મધ્યમ આરાધના આરાધે તો બીજે ભવે મુગતિ જાય. ત્રીજે ભવ અતિકમે નહિ. તથા જધન્ય આરાધે તો ત્રીજે ભવે મુક્તિ જાય. સાત આડ ભવ અતિકમે નહિ તથા સમકિતદષ્ટિ મનુષ્ય તથા પંચેંદ્રિ તિર્યચ એક વિમાનીક દેવનું આઉઝું બાંધે. પણ બીજું ન બાંધે. તથા સમકિતદષ્ટિ દેવ તથા નારકી એક મનુષ્યનું આઉઝું બાંધે. બીજું નહિ. તથા પન્જવણું મધ્યે કહું જે સમકિતદષ્ટિ બારમા દેવલોક સુધી જાય. એ સમકિતના ઇણ જાળવા. એહવા સમકિતના ઇણ જાળી શુદ્ધ સમકિત આરાધે. ॥ ૧૮ ॥

હવે તે સમકિતદષ્ટિ જિન તીર્થકરની પ્રતિમા કરી પૂજે નહો. તે આશી ચર્ચાના ઘોલ લખોએ છોએ ॥ ૧ ॥

ચોવીસ તીર્થકરના ઘણા આવક આવિકા થયા છે. પણ કોઈએ પ્રતિમા ભરાવી, તથા પ્રતિષ્ઠાવી તથા પૂજ કરી નથી. દેહરાં કરાબ્યાં દીસતાં નથી. સૂત માંહિ હોય તો દેખાડો ॥ ૧ ॥ ૨ પ્રતિમાને ગૌતમાદિક કયા સાધુએ પ્રતિષ્ઠી ? જે તે સૂત માંહિ કણી હોય તો કાઢી દેખાડો. ॥ ૨ ॥ ૩ શ્રી ઉપાસક સૂત મધ્યે દશ આવકનો અધિકાર ચાલ્યો છે, તેમણે પોસા કર્યા છે, ૧૧ પડિમા વહી છે, પણ પ્રતિમા કોઈએ ઘડાવી ? ભરાવી, જારી દીસતી નથી, દેહરાં

કરાવ્યાં દીસતાં નથી ॥ ૩ ॥ ૪ શ્રી ભગવતી સૂત્ર ભધ્યે આવકના  
 અધિકાર ધણા ચાલ્યા છે. શ્રી તુંગીયા નગરીના તથા સાવથી  
 નગરીના તથા આલંભીયા નગરીના આવકમાંહિ મોટા, મહા ડાઢા  
 ચતુર વખાણ્યા દીસે છે. સાધુને ધણા પ્રશ્નો પૂછ્યા દીસે છે, પણ ત્યાં  
 કોઈ આવકે પ્રતિમા ધડાવી, પૂજ દીસતો નથી ॥૪॥ ૫ શ્રી ભગવતી  
 સૂત્ર શતક ઉદેશા ભધ્યે શ્રી મહાવીરને શ્રી ગૌતમ સ્વામીએ તીર્થ  
 પૂછ્યા છે. તે વારે શ્રી મહાવીરદેવે તીર્થ ૪ કલ્યાં. ૧ સાધુ ૨ સાધ્વી,  
 ૩ આવક ૪ આવિકા એ ચાર તીર્થ કલ્યા; પણ ક્યાંઈ પ્રતિમા  
 તીર્થ કહ્યું નથી ॥ ૫ ॥ ૬ શ્રી ભગવતી સૂત્ર ભધ્યે તથા શ્રી શાતા  
 ભધ્યે જત્તા પૂજી છે. તે વારે તપનિયમ સંયમ ત્રણ જત્તા કહી  
 છે, પણ પ્રતિમા પ્રમુખ ખીજુ કોઈ જત્તા કહી નથી ॥ ૬ ॥ ૭ શ્રી  
 હાણુંગ ત્રીજે ડાણે આવકને મનોરથ ૩ કરવા ચાલ્યા છે, પણ પ્રતિમા  
 કરવી, ધડાવવી વગેરેનો તો મનોરથ કાંઈ ચાલ્યો દીસતો નથી ॥૭॥  
 ૮ શ્રી હાણુંગ ચોથે ડાણે આવકને વીસામા ૪ ચાલ્યા છે, પણ પ્રતિમા  
 કર્યાનો, પૂજ્યાનો, ધડાવ્યાનો, વિસામો કાંઈ ચાલ્યો નથી. ॥૮॥૯  
 શ્રી હાણુંગ હાણે ૮ મે ચાલ્યા છે કે જેવી પરંપરા શ્રી મહાવોર  
 દેવે કહી, તેવી ૯ શ્રી મહાપદ તીર્થકર કહેશે. બોલ ધણા કલ્યા  
 છે ત્યાં પણ પ્રતિમા ધડાવવી પૂજવી કહી નથી. ॥ ૯ ॥ ૧૦ શ્રી  
 ઉવવાઈ સૂત્ર ભધ્યે સાધુને પંચ મહાવત પાળતાં આરાધક કલ્યા  
 તથા આવકને પ્રત ૧૨ પાળતાં આરાધક કલ્યા છે. પણ કાંઈ પ્રતિમા  
 ધડાવતો પૂજતો આરાધક કહ્યો નથી. ॥ ૧૦ ॥ ૧૧ શ્રી પ્રશ્ન  
 બ્યાકરણ ભધ્યે ૧ આશ્રવકાર ભધ્યે હિંસાના કરનારને મંદ્યુદ્ધિ  
 કલ્યા છે. એટલાને અર્થે આરંભ કરે છે તે મંદ્યુદ્ધિયા. દેહરાં હાટ  
 ધર મઠ મંદિર કોટ, ખાઈ, પીઠણી, ચેદપ્રતિમા, થૂલ, તલાવ,  
 કુવા ધત્યાદિ બોલ ધણા ચાલ્યા છે. પૃથ્વીને અધિકારે છે,  
 અત્ર એમ કહ્યું ને પ્રતિમાને અર્થે પૃથ્વીને હણે તે મંદ્યુદ્ધિ. અત્ર  
 કુટલાક કહે છે ને એ તો અન્ય તીર્થીની પ્રતિમા છે, પણ અત્ર

પાઠ ભધ્યે વિવરણ કર્યું નથી. અને જે કદાચહને લીધે એમ સ્થાપે છે, જે સ્વતીર્થીની પ્રતિમાને અર્થે જીવ હણે તે હિંસા નહીં. એવું જે કહે છે તેને બીજું ખાલપણું જાણું. એક ખાલપણું તે જે જીવની હિંસા કરે છે, પદ્કાયને હણે છે તે અને બીજું ખાળપણું તે કે જે મૃષા ઓલે છે જે હિંસાનું પાપ નહીં. એ મહામંદ યુદ્ધિયા જાણવા. અજાણપણા માટે તથા સુધગડાંગને બાવીસમે અધ્યયને આર્દ્રમુનિ પ્રત્યે ઘૌષણતિ બોલ્યા. હે આર્દ્ર ! પિણ્ણાગ પિંડી અવિવિધ સુલે, કેદ્યપચેજળ પુરિસેઈ મેત્તિ. અલાઉયં વાવિ કુમાર છાતે, સલિયઈ પાણિયદ્ધ પાણિ વહેણ અમહું ॥૧॥ અહુવા-વિ વિધેણુ મિલાખૂસૂલે, પિણ્ણાગ યુદ્ધિએ નરં પદ્જળા, કુમા-રગં વાવિ અલા ઉયંતિ, ન લિખ્યે પાણિવહેણ અમહું ॥૨॥

ઇલાદિક ૪ કાવ્યે બૌધ્ધાદિકમતીએ પોતાનો ભત સ્થાપ્યો, તે ઉપર ઉત્તર ૨ કાવ્યે આર્દ્રમુનિએ કલ્યો છે તે જાણુનો. ॥૧૧॥ ૧૨ શ્રી સુધગડાંગ ૧૧ મા અધ્યયને મોક્ષમાર્ગ તથા શ્રી ઉત્તરાધ્યયન ૨૮ મા અધ્યયને મોક્ષ જવાનો માર્ગ કલ્યો છે, પણ પ્રતિમા પૂજતાં જારતાં જાણ્યા, એમ કાંઈ કહ્યું નથી ॥ ૧૨ ॥ ૧૩ શ્રી આશાતના રૂપ શ્રી સમાવાયાંગ તથા દશાશ્રુતસ્કંધ ભધ્યે ટાળવી કહી, પણ પ્રતિમાની આશાતના કહીજ નથી. આચાર્યાદિક છે તો તેહની આશાતના ટાળવી કહી છે. ॥ ૧૩ ॥ ૧૪ શ્રી ઉત્તરાધ્યયન ભધ્યે તથા દશ વૈકાલિક ભધ્યે કહ્યું છે જે પૂર્વલવના સંચયા કર્મ તપ સંયમે ઘપે, પણ કાંઈ પ્રતિમા ઘડાવતો, પૂજતો જારતો કર્મ ખપાવે એમ કહ્યું નથી ॥ ૧૪ ॥ ૧૫ શ્રી હાણુંગ ૬ મે હાણે જીવ પુન્ય પ્રકૃતિ ૬ પ્રકારે બાંધતો કલ્યો છે, પણ કાંઈ પ્રતિમા જારતો, પૂજતો પુન્ય બાંધતો કલ્યો નથી ॥ ૧૫ ॥ ૧૬ શ્રી હાણુંગને ત્રીજે હાણે સાધુને અને શાવકને આરાધના રૂપ કહી છે. ૧ રૂનની ૨ દંસણુની રૂપ ચારિત્રની. પણ પ્રતિમાની આરાધના કહી

નથી ॥ ૧૬ ॥ ૧૭ શ્રી શાત્રા મધ્યે થાવચ્ચા પુત્ર અણુગારને શ્રી શુક પરિવાજકે યાત્રા પૂછી છે તે વારે થાવચ્ચા અણુગારે શાન ૧ દર્શાન ૨ ચારિત્ર ૩ તપ ૪ જત્રા કહો, પણ પ્રતિમાની જત્રા તો કહી નહીં ॥ ૧૭ ॥ ૧૮ શ્રી ભગવતી શતક ૧૮ મે ઉદ્દેશે ૧ શ્રી ભહાવીરહેવને શ્રી સોમલિં આલ્ફાણે યાત્રા પૂછી છે, તે તે વારે તપ નિયમ સંયમ સજ્યાય ધ્યાન, ઇપ યાત્રા કહી છે પણ પ્રતિમા યાત્રા કહી નથી ॥ ૧૮ ॥ ૧૯ શ્રી ઉત્તરાધ્યયન ૨૮ મા અ૦ મધ્યે બાલ ૭૩ ઇલાઇલના કહ્યા છે. ત્યાં પ્રતિમા પૂજયાનું ઇળ તથા ધડાવ્યા ભરાવ્યાનું તથા નમસ્કાર કર્યાનું કાંઈ ઇળ કહ્યું નથી. તે શા માટે ? ॥ ૧૯ ॥ ૨૦ પ્રતિમાને સચેત પાણીથી નવડાવે કિંવા અચિત પાણીથી નવડાવે ? તથા પ્રતિમાનો પૂજનારો કેવા પાણીથી અંધોળાવે તે સૂત્રમાંહિં કયાંય કહ્યું છે ? જો કાંઈ કહ્યું હોય તો કાઢી દેખાડો ॥ ૨૦ ॥ ૨૧ પ્રતિમાની પ્રતિષ્ઠા સાધુ ચારિત્રીયા કરે કિંવા આવક કરે ? આંચલીયા ગર્ભના કહે છે જે પ્રતિષ્ઠા આવક કરે અને બીજા ગર્ભના કહે છે જે સાધુ કરે. તે સૂત્ર મધ્યે કયાંય કહ્યું હોય તો કાઢી દેખાડો ॥ ૨૧ ॥ ૨૨ પ્રતિમાનો પૂજનારો પહેલું પોતાનું શરીર પૂજો. કિંવા પહેલી પ્રતિમા પૂજો ? કેમ કહ્યું છે તે સૂત્રમધ્યે દેખાડો ॥ ૨૨ ॥ ૨૩ દિગંબર કહે છે કે પ્રતિમા નમ રાખવી. આલરણ અલંકાર જોઈએ નહિ અને નામ રવેતાંખર કહે છે જે પ્રતિમા નમન રખાય નહિ, તો સૂત્ર મધ્યે કેમ કહ્યું છે તે દેખાડો ॥ ૨૩ ॥ ૨૪ તીર્થીકરની પ્રતિમા કરાવો છો તથા પૂજો છો તે કઈ અવસ્થાની જાણીને ? બાલ અવસ્થાની ૧ રાન્ય અવસ્થાની, ૨ ચારિત્ર અવસ્થાની, ૩ કેવળ શાનની અવસ્થાની ૪ એ ચાર અવસ્થામાંહી કઈ અવસ્થાની પ્રતિમા ધડાવવી પૂજવી કહી છે ? સૂત્ર મધ્યે હોય તો દેખાડો ॥ ૨૪ ॥ ૨૫ તીર્થીકરની પ્રતિમા માંહી વેરો કરો છો તે શા માટે ? તીર્થીકર તો ૨૪ માન્ય છે, પૂજનિક છે, અને જે મહિનાથની પ્રતિમા ૧

અરિઠનેમિની પ્રતિમા ર ભહાવીરની પ્રતિમા ઉ એ ત્રણુ તીર્થકરની પ્રતિમા એસારતા નથી તે શા માટે ? એ તો મિથ્યામતિ જાણવી. સૂત્રમાં કેમ કહ્યું છે તે દેખાડો ॥ ૨૫ ॥ ૨૬ પ્રતિમાની પ્રતિષ્ઠા કરો છો, તે કયા સ્થળે કહી છે, વગર પ્રતિષ્ઠા પ્રતિમા નથી પૂજતા. અને પ્રતિષ્ઠા કર્યા પછી પૂજે છો તે શું ? પ્રતિષ્ઠા આધે શા ગુણ આવે છે તે કહો. ॥ ૨૬ ॥ ૨૭ તીર્થકર ૨૪ તો આરાધવા છે, અને ને એક તીર્થકરની પ્રતિમા મૂળ નાયક કરી માંડે છે અને ખીજ તીર્થકરની પ્રતિમા નીચી એસાડો છો તે શું ? કયા તીર્થકરની પ્રતિમા વડેરી એસારવી અને કયા તીર્થકરની પ્રતિમા નીચી એસારવી તે સૂત્રમાંહિ કેમ કહ્યું છે તે ને કાંઈ કહ્યું હોય તો કાઢી દેખાડો ॥ ૨૭ ॥ ૨૮ શ્રી વીતરાગહેવે એમ કહ્યું નથી, ને પ્રતિમા પુજ્યતો, ઝારતો જીવ સમકિત પામે તથા સુલભ ઓધી પણું પામે તથા પરિત્ય સંસાર કરે. ને કાઈ પ્રતિમા પૂજતાં ઝારતાં સમકિત પામ્યા હોય તો તથા સંસાર પરિત્ય કર્યો હોય તો તથા સુલભ ઓધી થયા હોય તો કાઢી દેખાડો. શ્રી સિદ્ધાંતમાંહિ સાધુ દેખ્યી ધર્મા જીવ સમકિત પામ્યા છે તથા જાતિસ્મરણ ઉપજ્યું છે. તથા સંસાર પરિત્ય કર્યો છે. તથા જીવની અનુકંપા થકી સંસાર પરિત્ય કર્યો દીસે છે, પણ પ્રતિમા પૂજતાં, ઝારતાં કાઈ જીવે પરિત્ય સંસાર કર્યો દીસતો નથી ॥ ૨૮ ॥ ૨૯ અહોતરી સનાથ કર્યાની વિધિ કર્યાંથી કહો છો, શ્રી સિદ્ધાંતમાંહિ કાઈ કહ્યું નથી. સાધુ ચારિત્રીયા એવો આદેશ કેમ આપે ? ને ૧૦૮ કુવાના પાણી લાવીએ, લદો શ્રાવક હોય છે તે ખારં પાણી તથા માહું એકહું કરતો નથી. તો સાધુ ચારિત્રીયા એમ કેમ કહે ? ॥૨૯॥ ૩૦ શ્રી સિદ્ધાંતે તીર્થ ઉ નામ તીર્થ કહ્યા છે. માગધ ૧ વરદામ ૨ પ્રભાસ ઉ કહ્યા છે, પણ કાઈ ગિરનાર આયુ શેવુંને ધર્માદિક નામે તીર્થ કહ્યા નથી. તો ભાવતીર્થ કર્યાંથી ? ભાવતીર્થ ૪ કહ્યા છે. ॥ ૩૦ ॥ ૧૮ ॥ એ ૩૦ ઓલ ચર્ચાના સાંભળી તે પ્રતિમા ભતિ ઓલ્યા ને શાસ્ત્રમાં

પ્રતિમા ધણે ધણે ડેકાણે કહી છે. તથા કર્મગ્રંથે કહું છે જે-ચેદૃ સંધાઈ પડિયોએ, તે કર્મગ્રંથ મધ્યે કહું. ને પ્રતિમાના પ્રત્યનીક (વિરોધી) કર્મ આંધે તે માટે પૂર્વાચાર્યે પ્રતિમા માની દીસે છે. તો દૈવંદ્રસુરિએ કર્મગ્રંથ મધ્યે કહું છે કે ને પ્રતિમાને ઉત્થાપે, ન માને તેને ભિથ્યાત્વ લાગે. એ પ્રતિમાભતિ કર્મગ્રંથ અને સિદ્ધાંત સમ-તુલ્ય કરી માને છે તેણે તે પ્રતિમા માની, પણ સિદ્ધાંત અને પ્રકરણ મધ્યે ધણેા ફેર દીસે છે. તે તેને ઉપગાર માટે કર્મગ્રંથ અને સિદ્ધાંત મધ્યે ફેર છે, તે લખીએ છીએ—

એક મોહની કર્મ આશી ૬ જીવાણું સુધી વિરુદ્ધ કર્મ-ગ્રંથને ભતે તે લખીએ છીએ. પહેલે જીવાણું સમકિત વેદની ૧ સમભિષ્ઠત ૨ એ એનો ઉદ્દય નહીં. શેષ ૨૬ નો ઉદ્દય ॥ ૧ ॥ બીજે ત્રણ દર્શન મોહની વર્જ શેષ ૨૫ નો ઉદ્દય ॥ ૨ ॥ ત્રીજે સમકિત મોહની ૧ ભિથ્યાત મોહની ૨ અનંતાનુ બંધી ૪ એવં ૬ વર્જને શેષ ૨૨ નો ઉદ્દય ॥ ૩॥ ચોથે ભિથ્યાત મોહની ૧ સમભિષ્ઠત ૨ અનંતાનુબંધી ૪ એવં ૬ વર્જ શેષ ૨૨ નો ઉદ્દય. ૪ પાંચમે ચોથાની ૬ અપચ્યાખાળી ૪ એવં ૧૦ વર્જ શેષ ૧૮ નો ઉદ્દય ॥ ૫ ॥ છેડે એ ૧૦, અપચ્યાખાળાવરણી ૪, એવં ૧૪ વર્જ શેષ ૧૪ નો ઉદ્દય ॥ ૬ ॥ સાતમે પણ છઢાની પેરે ૧૪ નો ઉદ્દય ॥ ૭ ॥ આદમે પ્રથમના ૧૫ વર્જને શેષ ૧૩ નો ઉદ્દય ॥ ૮ ॥ નવમે સંજ્વલના ૪ વેદ ૩ એવં ૭ નો ઉદ્દય શેષ ૨૧ નો ઉદ્દય નહિં. ॥ ૧૦ ॥ ૧૧ ॥ ૧૨ ॥ ૧૩ ॥ ૧૪ ॥ મે સૂત્રવત્ એ લખ્યું તેમ કર્મગ્રંથ બીજે છે.

હવે સિદ્ધાંતે કેમ છે. તે લખીએ છીએ. પહેલે એનો ઉદ્દય નહીં કહું તે વિરુદ્ધ. ૧ બીજે તે દર્શન મોહનીનો ઉદ્દય નહિં એ પણ વિરુદ્ધ. ॥ ૨ ॥ ત્રીજે ૨ નો ઉદ્દય નહીં કહું તે વિરુદ્ધ ॥ ૩ ॥ ૪ ॥ ૫ ॥ ૬ ॥ ૭ ॥ ૮ મે સમકિત વેદનીનો ઉદ્દય કહ્યો

તे વિરુદ્ધ ॥ ૮ ॥ નવમે ૪ સંજવલના, વેદ ઉ એવં ઉ પ્રકૃતિનો ઉદ્દ્ય કહ્યો એ વિરુદ્ધ. ધર્ત્યાદિક એ જીવદાણે પ્રકૃતિ વિરુદ્ધ છે તેહની સાક્ષી સૂત્ર ભધ્યે છે તે જીવદાણા ૧૪ નો વિસ્તાર ઋષિશ્રી ધર્મભસિંહજીએ રચ્યો છે તેહથી જાણુવો. એટલે સૂત્ર અને પ્રકરણું સમતુલ્ય કેમ કહેવાય? પ્રત્યક્ષ વિરુદ્ધ હેખીએ છીએ તો સમતુલ્ય કેમ? પોતાની ભાતા અને વાંજણી એમ જે સાચું માને તે પ્રકરણું અને સિદ્ધાંત સમતુલ્ય માને. પણ સમતુલ્ય નહિ. વૃત્તિ ચૂણ્ણી ભાષ્ય નિર્યુક્તિ પ્રકરણના ગ્રંથ એ ૫ સિદ્ધાંત સર્વાગે સરખા ભળતાં દીસતાં નથી. જેમ કોઈ અદ્વિષીએ પુરુષ ધડીએકમાં ખરું ઓલે, વળી ધડી એકમાં અસત્ય પણ ઓલે. અદ્વિષુના કેદનું જોર તેથી, તેમ એ ૫ ના કરનારા કેટલુંક ખરું પણ જોડે વળી મિથ્યાત્ત્વ મોહની અથવા જ્ઞાનાવરણીના જોર ઇપ અદ્વિષુનું જોર વાય તે વારે અસત્ય પણ જોડે. તે અસત્ય જોડું છે તે થોડું માત્ર જાણુવીએ છીએ. વૃત્તિકારે તે ભેદ લખીએ છીએ. શ્રી આચારાંગની વૃત્તિ ભધ્યે કહ્યું છે જે સાતમું મહા પરિજ્ઞાધ્યયન અને સમવાયંગ સૂત્રે મહા પરિજ્ઞાધ્યયન નવમું કહ્યું તે માટે એ આચારાંગની વૃત્તિ ભધ્યે છે તે વિરુદ્ધ ॥૧॥ તથા ઉત્તરાધ્યયનના ૬ ટા અધ્યયનની વૃત્તિ ભધ્યે કહ્યું જે સંધને કારણે ચક્રવર્તીના કટક ચૂરણ કરવાં. અને ન કરે તો અનંત સંસારી કહ્યો. લભરા લભરીનાં ધર ભાંગવા કહ્યા. બૃહત્કલ્પ વૃત્તિ ભધ્યે જાણી પ્રીઠી એ ઈદ્રી જીવ આદિ પંચેદ્રી હણવા, વાયરો હિલે ધાલવો. શ્રી દશાશ્વતરસ્કંધ વૃત્તિ ભધ્યે. તથા નળદમયંતી કથા ભગવતી વૃત્તિ ભધ્યે. ધર્ત્યાદિક વૃત્તિ ભધ્યે વિરુદ્ધ. ૧॥

હવે ચૂણ્ણી ભધ્યે જે વિરુદ્ધ છે તે થોડામાં લખીએ છીએ. કણુયરની કાંબ ઝેરવી ॥ ૧ ॥ આચારાંગ ચૂણ્ણી ચોથા અધ્યયનની ભધ્યે તથા નીશીથ ચૂણ્ણી ભધ્યે સાધુએ ખુજલી ખણુવો કહી ॥ ૨ ॥ મૈથુન સેવવું ॥ ૩ ॥ રાત્રિ આહાર લેવો કહ્યો ॥૪॥

અનંત કાયનો ડાંડા લેવો ॥ ૫ ॥ મંત્ર ભણુવા ॥ ૬ ॥ કેળાં  
આહિ કુળ ખાવાં કલ્યાં ॥ ૭ ॥ કાચા પાણી પીવા કલ્યાં ॥ ૮ ॥  
અદ્દત લેવાં ॥ ૯ ॥ આસડાં પહેરવા ॥ ૧૦ ॥ પાન ખાવા કલ્યાં  
છે ॥ ૧૧ ॥ લુહારની ધમણ ધમવો ॥ ૧૨ ॥ પુલ સુંધવાં કલ્યાં  
॥ ૧૩ ॥ રનાન કરવાં કલ્યાં ॥ અનંતકાયને જાડે ચલ્યું ॥ ૧૪ ॥  
આહાર આખાકર્મી લેવો ॥ ૧૫ ॥ ધૃતાદિક રાખવા કલ્યા ॥ ૧૭ ॥  
ધાત પાડવી કહી ॥ ૧૮ ॥ નિધન ઉચાડવાં કલ્યા ॥ ૧૯ ॥  
અનલિંગ કરવાં ॥ ૨૦ ॥ થંલણી નિધા પ્રણુજવી ॥ ૨૧ ॥  
મૃષાવાદ એલવા કલ્યાં ॥ ૨૨ ॥ ધત્યાદિક ચૂર્ણિ મધ્યે વિરસ્થ છે.

હવે ભાઈ મધ્યે જે વિરસ્થ છે તે થોડું શું લખીએ છીએ.  
શ્રી આવશ્યકનો ભાઈ ૨૮૦૦૦ સહિતી મધ્યે ગણુધરવાદ ચાલ્યો છે,  
ત્યાં ગૌતમ સ્વામીને આલણે કર્યું છે અને સૂત્ર સમવાયાંગે શ્રી  
ઉદ્દ્ય કુલવંસા કલ્યાં છે. ધત્યાદિક વિરસ્થ ૩.

તથા નિર્યુક્તિમાંહિ જે વિરસ્થ છે તે કિંચિત્ લખીએ છીએ.  
॥ શ્રી સણુંત કુમાર ચક્રવર્તી ત્રીજ દેવકોએ ગયા કલ્યા છે.  
જે ધનુષ્ય ૫૦૦ થકો ઉંચા હોય તે મુક્તિ જય નહી. અને  
ઢાણુંગ મધ્યે મરુ દેખ્યા સ્વામી મોક્ષ પહેંચ્યા કલ્યાં ॥ ૨ ॥ શ્રી  
મહાવીર દેવના ૨૭ પૂર્વ અવ કલ્યા છે ત્યાં એમ કર્યું છે જે  
મનુષ્યપણુથી મરીને ચક્રવર્તી થયા તે એલ વિરસ્થ, એટલા મારે  
જે પનવણા ૫૬ ૨૦ મા મધ્યે કર્યું છે જે મનુષ્ય મરીને તથા  
તર્યિય મરીને ચક્રવર્તી થાય નહિ. ગતિ ૨ ના જીવ આવીને ચક્રવર્તી  
થાય. પહેંદી નરકનો આવ્યો થાય, સર્વ દેવતા માંહિથી થાય ॥ ૩ ॥  
શ્રી ભરત ચક્રવર્તીએ થૂલ દદ ભાઈનાં કરાવ્યાં. તથા એક થૂલ  
શ્રી આદિનાથનો કરાવ્યો. જુમલે ૧૦૦ થૂલ સુક્તિ ગયા પૂંઠે કરાવ્યાં  
અને સમવાયાંગ સૂત્ર મધ્યે કર્યું છે જે શ્રી આદિનાથ ૧ તથા ભરત  
ચક્રવર્તી ૨ તથા બાહુઅલ ૩ તથા આલો ૪ તથા સુંદરી ૫ એ ૫ નું  
આવખું ૪૪ લાખ પૂર્વનું કર્યું છે. તો શ્રી ઋષભદેવ ને બાહુઅલ સાથે

મુક્તિ કેમ ગયા? એ વિરુદ્ધ ॥૪॥ શ્રી અરિદ્ધનેમિના ગણુધર ૧૧ નિર્યુક્તિ મધ્યે કલ્યા છે. અને શ્રી સિદ્ધાંતે ૧૮ ગણુધર કલ્યા છે. ॥ ૫ ॥ શ્રી પાર્વતીનાથના ગણુધર ૧૦ નિર્યુક્તિ મધ્યે કલ્યા છે અને ગણુધરસ્ત્રે ૮ કલ્યા છે. ॥૬॥ શ્રી ભક્તિનાથનું ચારિત્ર તથા કેવળજ્ઞાન માગશર શુદ્ધ ૧૨ તું નિર્યુક્તિ મધ્યે કહ્યું છે. અને જ્ઞાતાસ્ત્રે પોશ શુદ્ધ ૧૧ તું કહ્યું છે ॥૭ ॥ તથા ડાસનાં પૂત્રનાં કરવા કલ્યાં તે વિરુદ્ધ ॥૮॥ પીપળા છેદવા ॥૯॥ તથા તીર્થીકર ગૃહસ્થને વાંદે તે વિરુદ્ધ ॥૧૦॥

હવે ચૂણ્યું તથા વૃત્તિ મધ્યે એમ કહ્યું છે. દેહરામાંહિ વૃક્ષ હોય છે. ચારિત્રોએ દેહરે આન્યો હોય, વૃક્ષ દેખીને ગામભાંહિ શ્રાવક હોય તેને કહી કઢાવે. તે ન હોયતો ક્રોટવાલ, શેઠ, મેહતો, રાજ, દાકુર હોય તેને કહીને કઢાવે. તે ન કાઢે તો પછી પછવાડે રજે-હરણ ખાસે, કાછડું બાંधે, બાંધીને તે વૃક્ષ પુંજુને પછી પોતાના હાથથી જયણ્ણા કરે. એ જયણ્ણા કયે સૂતેથી નીકળી છે? જયણ્ણા નામ તો ગુણું નિષ્પત્ત છે. સર્વ જીવનું જતન કરે તે જયણ્ણા કહી. સંઘ્યાતા અસંઘ્યાતા અનંતા જીવના પ્રાણું લઈને, જયણ્ણા દંડે કહી તે ભળે નહિ. શ્રી સુયગડાંગ અધ્યયન ૭ માં—

જયં ચ તુંદીં ચ વિષણુ સયં તે, ધીયાઈ અસંજયં  
આય દંડે, આહાસેલોએ અણુવનજ્ઞ ધરમે, ધીયાઈ જે હિંસદ્ર  
આયસાએ ॥૧॥ ગળભાઈ મિજજાંતિ બુયા ખૂબાણ્ણા, નરા પરે  
પંચ સિહા કુમારા, જુવાણુંગા મજિમ વેર ગાય, ચયાંતિ તે  
આજીખચે પલીણ્ણા ॥૨॥

એ ઉપર વાધ ને વાનરની કથા છે.

એક વાધ ભુખ્યો ક્ષુધાતુર દિન ૫ તથા ૭ નો. હોડી ન શકે.  
થોડું થોડું ચાલતો એક વાનરે દીકો. તેણે પૂછચું-મુંડે મુંડે કાંય કાંય  
હિંડે. વાધ બોલ્યો—ઈર્યા શોધું છું. જણો છો રખે જવ દુહવાય.  
વહી વાનર બોલ્યો—તમે દુઅળા કેમ? વાધ કહે—પચચખાણુ ધણ્ણા  
૫

કર્યા, તેથી દુખણો. આજ છંઠનું પારણું છે. તે વારે વાનરે કહ્યું: દ્વાયા આણી કહે તો ઇણ છે તે આપું, પારણું કરો. તેવારે વાધ બોલ્યો-આહાર આણી આપશો તો પારણું કરશું. તે વારે વાનરે વૃક્ષ ઉપરથી ઇણ નાખ્યા. વાધે એકઢાં કીધાં. કરીને દગ્ધો કરી બેસી રહ્યો. ખાય નહીં. તે વારે વાનર બોલ્યો-કેમ તમે બેસી રહ્યા, પારણું ન કરો? તે વારે વાધ બોલ્યો. આજ પારણું તો છે, પણ કોઈ અતિથિ આવે તો તેને આપીને પછી પારણું કરં. તેવારે વાનર બોલ્યો-વનમાંછિ અતિથિ કોણ આવશે? કહે તો હું અતિથિ થાડિ. વાધ કહેઃ ગ્રમાણું, તમે આવીને લ્યો. વાનર ત્યાં કેવા આવ્યો. તેવારે વાધે વાનરને હુથેલી મેલી. વાનર ચ્યપલ હોવાથી નાસી ગળ્યો. હુથેલી ન ઝાવી, વૃક્ષપર ચઢ્યો. કહેવા લાગ્યો. તમારે અતિથિને એમ માન જોઈએ છીએ. વાધ બોલ્યો-અમે હાર્ય કરતા હતા. તમે આવી લ્યો. તે વારે વાનર કહેઃ—તમારો હાર્ય જાણ્યો. તમે માર્ગ જાણ્યો. વાધ નિવૃત્તિને ચૂર્ણિનો કરનાર. એ મોઢે જેતો. વાધની ઈર્યા અઠ તપ અતિથિ અને જતિની જયણા સરીઝી દીસે છે. ડાઢા હોય તો વિચારી જોને. વાધ મુખ્યી અતિથિ કહીને તેહનું ભાંસ ખાવાને તાકે, તેમ મૂર્ખ જયણા કહીને વૃક્ષના મૂળ કાઢે. ઈતિ ॥૪॥.

હવે ગ્રકરણ મધ્યે વિરુદ્ધ ઉપર લખ્યું છે. કર્મચંથાદિક મધ્યે છે. ઈસાદિક પરંકૃત અંથ મધ્યે ઘણાજ વિરુદ્ધ છે. કેટલા લખ્યોએ? લખતા પત્ર ઘણાં થાય તે માટે અનેરાં પત્રથી જાણુન્ને ॥૫॥ ૨૪ ॥

હવે પૂજના ગ્રહપક કહે છે-પૂજા કરતાં આરંભ પણ હોય, ધર્મ પણ હોય, તે ઉપર દાઢાંત છે. એક પુરુષ સુતો હતો ને સોય-ણાંસ (સ્વમાભાં) સૌનેયાની કડાણ (ચર) દીડી. તે કાઢવા લાગ્યો. તેણે તેમાંનું ધન હાંસીને લુગડા સાથે બાંધીને લર્યું. પ્રલાત થયું. ત્યાં તો ન ભલે ચર કે ન ભળે ધન, પણ તુષણાનું પાપ તો બાંધ્યું તેમ

આરંભ ખરો. તથા સ્વી ગર્ભ ધરે તે વારે મહા હર્ષ હોય. આણંદ-  
હર્ષ માનતી ગર્ભ ધરે. અને તે ગર્ભ વદ્ધિ થાતો હોય તેવારે ત્રાસ  
છુટે. જણે ને એ અકામ કેમ કર્યું? તેમ હિંસા ધર્મ કરતાં હર્ષ,  
આણંદ સુખ હોય, શાતા હોય, પણ તે હિંસાના કર્મ ઉદ્દ્ય આવે  
તે વારે રોતાં પણ જીવ છુટે નહિ. હિંસાના ઇણ લોગવતાં ગાઢાં  
દોહિલાં થાય જીવને ॥૨૫॥ હવે તે મિથ્યાત્વી પ્રાકર્મ ફોરવી ઓળા  
આંબિલ તપ કષ્ટ ઇપ પરાકર્મ કરે છે. તેથી શું ઇણ છે તે કહે છે.

જૈય બુદ્ધા મહાલાગા, વીરા અસમત દંસિણો, અશુદ્ધ  
તેસિં પરક્કંતં, સક્કલં હૃવિ સંવત્સો ॥૧॥ જૈય બુદ્ધા મહા-  
લાગા, વીરાસમત દંસિણો, શુદ્ધં તેસિં પરક્કંતં, અસ્કલં  
હૃવિ સંવત્સો ॥૨॥

સુયગડાંગે મિથ્યાત્વી પ્રાકર્મ ફોરવે તેણે સંસાર ઇણ વાયે. તે  
ઉપર દષ્ટાંતે કરી કહે છે-નેમ એક ઉંદરે પ્રાકર્મ માંડયો. ને એક  
કરંડીએ હતો. તે કરડે. તે કરંડીએ કરડતે કાળું પડયું. તેમાંહિ  
ઉંદર પડયો. તે કરંડિયા માંહિ સર્પ હતો. તેણે ઉંદરને માર્યો.  
ઉંદર મૃત્યુ પામ્યો. ને એ ઉંદરે કરંડીએ કરંડાનો પરાકર્મ ન  
માંયો હોત તો મૃત્યુ ન પામત, તેમ હિંસા ધર્મને વિષે પ્રાકર્મ ને  
કરે, તે સંસારને વિષે ઘણા જન્મ ભરણું વધારે. દુઃખ પામે. ઉંદરને  
દષ્ટાંતે. ઉંદરે પ્રાકર્મ માંડયું. કરંડિએ કરડી જાય. માંહિ લોરિંગ  
નીકલ્યો. તેમ કલેવર થાય ॥ ૧ ॥ ૬ ॥

હવે પ્રતિમા તીર્થકરની શાવક પહેલાં ન પૂજતા એમ ડોઈ  
પુછે ને, તો ક્યાંથી કયા દિનથી પૂજ દેહરાં રાત્રિ જગરણ  
ઉજમણું ધર્માદિક કયા દિનથી થયા તે લખીએ છીએ.  
પહેલાં શુદ્ધ શાવક પ્રતિમાની પૂજ કરતા નહી તે માટે તે પરંપરા  
સ્તોક માત્ર લખીએ છીએ. શ્રી મહાવીર નિર્વાણુત, શ્રી સુધર્માસ્તવાભી,

પાંચમા ગણધર પાટે એહા. શ્રી સુધર્માસ્વામી પછી જંખૂસ્વામી, જંખૂ પછી કેવલજાન વિછેદ ગયું. તેથી કોકને વિષે એક અંધારું થયું. તે વાર પછી શ્રી પ્રભુસ્વામી, શ્રી સિજંભવ આહિ દેર્ઘ બાવીસ પાટ લગી તરતો માર્ગ ચાલ્યો. ત્રેવીસમી પાટે શ્રી આર્ય સાધુ થયા, જેમણે પનજવણું ઉદ્ધર્યો. પૂર્વમાંહિથી તે વાર પછી છપાટ લગે ચૌદ પૂર્વ રહ્યા અને વેર સ્વામી લગે દશ પૂર્વ રહ્યાં. તે વાર પછી પૂર્વ વિછેદ ગયાં. વરસ ૧૦૦૦ જગમાંહિ ભીજું અંધારું થયું. પછી કેટલેક કાળે દેવર્ધિક્ષમા અમણ ચારિત્રિયાએ અલ્પધારણા જાણી સિદ્ધાંત પુરતકે લઈયું. તેણે કાળને અવસરે બાર વરસી એક દુકાળ પડ્યો. અન્ન દુર્લભ થયું. પછી ઉત્તમ ઋષિ હતા તેણે સંથારા કીધા અને બ્રષ્ટાચારી રહ્યા તેણે કંદમૂળ પત્રાદિક બક્ષી રહ્યા. તે કાલે ચંદ્રગરંછ વ્યવહારીયા ધનાદ્ય હતા. તેણે ધાન અને ધનનો અંત આવ્યો. પછી વિષ બક્ષવા લાગ્યો. તે વારે ગુરુએ જાણ્યું. પછી કંદ્યું અમે તમને જીવવાનો ઉપાય કહીએ. જે તમે ચાર પુત્ર મુજને આપો, શેડે કંદ્યું: આપીશું. પછી કંદ્યું. આજથકી સાતમે દિને ધાનનું વહાણું આવશે, તેમજ થયું. ચાર પુત્ર કેર્ધ વેશ પહેરાવ્યો. તેથી ચિત્રવાલાદિ ચાર ગરુછની સ્થાપના થઈ. ગુરુએ નિભિત ભાખ્યું હતું તે દક્ષિણ સમુદ્ર હુકડા ભણી વાહણે જીવાર આવી. જીવારે જીગ ઉદ્ધર્યો. તે જીવારીનું નામ ત્યાંથી દેવાણું જીવારી. પહેલું આચારાંગે, ભીજું નામ દીધું છે, પછે સાધુ બ્રષ્ટાચારી રહ્યા હતા તે દક્ષિણ દિશાએ આવ્યા. ચંદ્રગુમ રાજના સ્વર્ણાં, વ્યવહાર સૂત્રની ચૂલિકા મધ્યે કલ્યા છે. તે લખીએ છીએ. દક્ષિણ દિશામાં ધર્મ રહેશે તથા કુમતિ કરી ડાંડા સાહી નાચશે. ચેર્ધની સ્થાપના કરશે. તેણા દ્રવ્યના આહાર કરશે. માલારોપણ કરશે. ઉનમણું કરશે. રાતિજગાદિક કરશે. ચારવર્ણ માંહિ વાણીયાને કુળ ધર્મ હશે. સૂત્રની ઇચ્છિ અલ્પ મનુષ્યને હશે. ધર્ત્યાદિ ૧૬ સુપન વિચાર લખીએ છીએ.

તેણું કાલે તેણું સમએણું, પાડલી પુરે નામં નયરે હોત્થા, વનજો, જહા ચંપા તહા લાણિયવા, તત્થણું પાડલિ પુરે નયરે, પાડલે નામં વણુ સંટે હોત્થા. વજાઓ તત્થણું પાડલી-પુરે નયરે, ચંદગુરુતે નામં રાયા હોત્થા. મહયા ડિમવંત, તસ્સણું ચંદગુરુતસ્સ રજો, પિય હંસણુાનામં લારિયા હોત્થા. સુકુમાલ પાણી પાચા, જાવ, સુરવા, તસ્સણું ચંદગુરુતસ્સ રજો, પિય હંસણુાએ ઢેવીએ અત્તાણુ પિયહંસણુ નામં કુમારે હોત્થા. સુકુમાલ પાણી પાચા, જાવ સુરવા, જહા સંવ લહે તહેવા પચ્છુ વેવ માણે વિહુરધી, ચંદગુરુતે રજો સમણો વાસણુ અઠે હિંતો; વિછણે વિપુલ લવણુા સયણાસણુ, જાણુ વાહણુ ધણુા, બહુ ધણુ ધણુ, બહુ જય ઢવરયા આઉગપઉગ સંપઉત્તા, વિછડીય વિપુલા લત્ત પાણુ પલૂયા, અલિગય જીવા જીવે, ઉવલદ્ધ પુણુપાવે, આસવ સંવર નિજભર ડિરિયાહિગરણુ બંધ મોખ કુસલા અસહેજજ દેવસુર નાગ સુવણું. જક્ખ રક્ખસ, કિનર કિંપુરીસ, ગંધવ મોહરગ દેવગણુહિ નિગંથાઓ, પાવચણુાએ, આણુધિકમણુજ્જનનિગંથે પાવચણુ, નિસક્કિએ નિકંખિએ, નિવિતીગિંછા, લધડા, ગહિયડા, પુછિયડા, અલિગયડા, વિણી છીયડા, અડિમિજ્જ પેમાણું રાગ રત્તા. અય માઓસો, નિગંથે પાવચણુ અઠે અયં પરમહે. સેસે અણુહે. ઉસીય ઝલીહ, અવંગ હુવારા, ચીયંતતે અંતે ઉર પર ધર પવેસા. બહુહિ સીલવય ગુણુ, વેરમણુ, પચ્ચાણુ, પોસહો-વવાસેહિ, ચાઉદસઠ મુદિઠા, પુણુમાસીણું, પડિપુણુ પોસહુ સમં, આણુપાલેમાણુ, સમણુ નિગંથે ઝાસુએ એસણુજ્જનો, અસણું પાણું ખાઈમં સાઈમં. વત્થ પડિગાહુ કંખલ પાય

પુણ્યાં વા, પીઠ ક્રીલગ, સેજળ સંથારચોણું ઉસહ લેસજન્ઝેણું  
 પડિલાબે માણે વિહરઈ. તચોણું સે ચંદગુતોરાયા, અન્નયાક  
 ચાઈ જોણેવ પોસહ સાલા, તેણેવ ઉવાગછઈ (૨)તા, પોસહસાલા  
 પમજજઈ (૨)તા. પરકાય પોસહ પડિજાગરમાણુસ્સ, તઈયાએ  
 પોરસીએ સુહ પસુએ, ઉહીરમાણો, ઉહીર માણુસ્સ, સોલસ્સ સુમિ-  
 ણા પાસઈ(૨)તા. ચિંતાસોગ સાગર પવિઠા, જવ પડિખુદ્ધા, ચિંતા  
 સમુઘપણા અહુકમ્ભેણું, ઉદએ હિવાયરે, પોસહ પારેઈ પારિતા  
 તેણું કાલોણું, તેણું સમચોણું, સંભૂય વિજયસ્સસીસે, જુગ  
 પહાણે ભદ્રખાહુ નામં અણુગારે, જાઈસંપન્ને જવ ખડુસુએ  
 ભદ્રખાહુ નામં અણુગારે, પંચહિં અણુગારસ એહિ સંદ્ધિ.  
 સંપરિવુડે. પુઠવાણુ પુણિં ચરમાણે, ગામાણુગામં હુઠજજમાણે,  
 સુહં સુહેણું વિહરમાણે, જોણેવ પાડલિપુરે નયરે જોણેવ પાડલ  
 વણુસંડે, તેણેવ ઉવાગછઈ (૨)તા. પાડલિપુરે નયરે, ખહિયા,  
 પાડલ વણુસંડે, આહાપડિઝે ઉગહા ગિનહુઈ ગિનહુતા,  
 સંજમેણું તપસા અપાણું લાવે માણે વિહરઈ. તચોણું સે  
 પાડલિપુરે નયરે, સિંધાડગ તિક ચઉક ચચ્ચયર પહેસુ મહા  
 પહેસુ જવ પરિસા પળુવાસઈ, તચોણું સે ચંદગુતો રાયા,  
 ઈભીસે કહાએ લદ્ધે સમાણે, હઠતુઠા કોડુંખીય પુરિસે, સહા-  
 વેઈ(૨)તા એવં વયાસી, ખિપામેવ લો દેવાણુપિયા, પાડલી-  
 પુરં નયરે, સલિંતર ખાહિરંચ, આસીય સમ જ્ય. જહા  
 કુણિઓ દોચ્ચં પિ. કોડુંખીય પુરિસે સહાવેઈ(૨)તા. એવં  
 વયાસી, ખિપામેવ લો દેવાણુપિયા, આભીસે કહાછી, ચઉ-  
 રંગીણી સેણું સમજળ્ય, પચ્ચપીણુ હ, એવં વુતા સમાણુ,  
 કોડુંખીય પુરિસે હઠતુઠા, જવ પચ્ચ પીણુંતિ, ચંદગુતો રાયા,

નહાએ કયથલી કમ્મે, કય કોઉ મંગલ પાય છિતો. જવ સરીરે  
વિભૂસીય આલિસેક હત્થી. હુરુહુર (૨) તા, ખડુ પરિવારા  
સંપરી વુડા. પાડલી પુરં નયરે મજાં મજાંણેણું, નિગાછિદ  
(૨) તા. જેણેવ પાડલ વળુ ખંડે, જેણેવ અદ્ભાડુ નામં  
અણુગારે, તેણેવ ઉવાગાછિદ (૨) તા. પંચ વિણેણું અલિ  
ગમેણું, કરેદ (૨) તા. સચિતાણું દૃવાણું વોસરિયાએ ॥૧॥  
અચિતાણું દૃવાણું અ વોસરિયાએ ॥૨॥ એગ સાડી  
ઉત્તરાસણું કરેદ (૨) તા. ॥૩॥ અંજલિ કદુ મત્થયં  
કરેદ ॥૪॥ ચણુ ઝાસે એગાદિઠીએ ॥૫॥ વંદર્દી નમં  
સદ (૨) તા. તિવિહાએ, પણુવાસણુએ, પણુ વાસેદતા;  
ધમં સ્ફોરુદ (૨) તા. ધમમ કહા ભાણુયબ્વા, તએપણા-  
સોલસ્સ સુમિણુસ્સ, અથો પુછિ લયવં અજજરયણી. મમં  
ધમં ચિતાએ, વંદુમાણુસ્સ, સોલસ્સ સુમિણા દિઠા. તત્થ  
પદમં સુમિણે, કંપ્ય રખ સાહા ભગા (૧) બીએ સુમિણે  
અકાલે સુરિએ અથમોએ દીઠો (૨) તદ્યે સુમિણે ચંદ  
સય છદલો દીઠો (૩) ચઉત્થે સુમિણે ભૂયા ભૂય નિચ્યાંતિ  
દિઠો. (૪) પંચમએ સુમિણે દુવાલસ્સ ઝણો કન્હ સર્પો  
દિઠો. (૫) છો સુમિણે આગયં વિમાણું વિલયં દિઠો. (૬)  
સત્તમીએ સુમિણે ઉક્કરડીયાએ કમલં સંજાયં દીઠો. (૭)  
અઠમએ સુમિણે ખજૂયં ઉજાયં કરેદ દિઠો. (૮) ણુવમે  
સુમિણે મહા સરોવર સુકો દાહિણે દિસાએ અપજલં લવિ  
સેદ દિઠો. (૯) દસમે સુમિણે સુણુહો સોવન્ન થાલે પાયસ  
લગેદ દિઠો. (૧૦) ઈગારસમે સુમિણે હત્થીય રઠો વાનરો  
દિઠો. (૧૧) દુવાલસ મચે સુમિણે સાચરો મજાયા મુચ

સાઈ દિઠો (૧૨) તેરસમચે સુમણે મહારત્થા વછા જીતા દિઠો (૧૩) ચડિદસ મચે સુમણે મહગ્ધરથણું તેથાં હીણું દીઠં (૧૪) પજીરસમચે સુમણે રાય કુમારો વસહ આર્દો દિઠો (૧૫) સોલસમચે સુમણે ગય કન્ઠા જ્યોયલા જુઅતા દિઠો (૧૬) એઓણું સુમેણુાણુસારેણું લયવ્ય જગણુ સાસણે કિં લવિસસાઈ. ઈય ચંદ ગુતસસ રાયસસ વયણું સોચ્યા, લાદ-ખાડુ અણુગારો, જુગ પહાણો, ચડ વિહું સંઘ સુખં લખિયં. ચંદગુતે રાયા સુણે હ અત્થો. તાં પઠમં સુમણે કર્પ રૂપે સાહા લગા, તસ્સક્રલં અજજ પલર્દીએ, ડોવિરાયા સંજમં ન ગિનહુર્દી (૧) ખીય સુમણે અકાલે સૂરિએ અથમેણું, તસ્સ ક્રલં કેવલ નાણું વો છ અજં જયસસ (૨) તીએસુમણે ચંદ સય છદ્ભૂએ, તસ્સ ક્રલં એગે ધર્મે અણુગમગ્નો લવિસસાઈ (૩) ચડથે સુમણે ભૂયાભૂયં નચ્યાંતિ, તસ્સ ક્રલં અસંજ્યાણું પૂયા લવિસસાઈ (૪) પંચમે સુમણે હુવાલસસ ક્રણો, સંજુતો અહી દીઠો, તસ્સ ક્રલં હુવાલસસ વાસાઈ હુકાલો લવિસસાઈ. તેણું કાલીય સુય પમુહા, સુયારો લવિસસાઈ. ચેઈ દવ્ય આહારણો મુણ્ણ લવિસસાઈ, લોલેણુ માલારોવેણું ઉજજમણુ માઈ બહુવે તવ પલાવા પૂયાઈ સંતિ, તત્થ ને સાહુ ધર્મમકંભિણો, તે ખહુએ વેમગા ઉવદ્દસેતિ (૫) છે સુમણે આગાયં વિમાણું વિલલયં, તસ્સ ક્રલં ચારણા સમણે દેવે, ભરહે, ધરિવચેસુ ન આગ-મિસેઈ (૬) સત્તમે સુમણે કમલં ઉકરડીયાએ ઉદ્યં દિઠં, તસ્સ ક્રલં ચત્તારિ વનાપજતા; તાં જહા, પ્રાણણ વંસસય ક્ષત્રી શૂર, ચત્તારિ વણુમજજે, વસ્સહૃત્થે ધર્મે પન્નતે, તેણું

વાણિયગા અણેગમગાં ગિન્હસંતિ, સુતર્દર્ઢ અપ્પ જજીણું  
લવિસ્સાઈ (૭) અડમે સુમળે હંજૂએ ઉનેયં કરેઈ, તસ્સક્કલં  
સમણું રાયમગાં મોત્તાણું, હંજેય ઈલ ઉનેયં કરિસંતિ. તેણું  
સમણું નિગાંથાણું પૂયાસકારેસમાણે, ત્યોવાલવિસંતિ (૮)  
નવમે સુમળે મહાસરોવર સુઝું, તસ્સ ઇલં લરહેવાસેતિહિસં  
ધમ્મં વિછેદં, એગંદા હિણુ દિસં થ્રાવ ધમ્મં લવિસ્સાઈ (૯)  
દસમે સુમળે સુણુ હે સુવણુ થાલે પાયસ કરેઈ, તસ્સ ઇલં  
ઉત્તમ લક્ષી મજિઝમ ધરે ગમિસ્સંતિ, કુલ ઝેમમગાંમોત્તાણું,  
ઉત્તમા નીય મગગાં પવિસ્સાઈ (૧૦) ઈગારસસમે સુમળે ગય આડું  
વાનરેા દીઠો; તસ્સ ઇલં સુહીયારિહિસમા, હજીણું હુહીયા અવ  
માણુાપય ઠાયા. સજીણું હુખાગ, હરિવંસ જાયવ, પમુહાણુકુલે  
રજજહીણું લવિસ્સાઈ (૧૧) બારસમે સુમળે, સાયરે મજાયા  
મુચસેઈ, તસ્સ ઇલં રાય અમુગ્ણ ચારિણો; ખતીયા વિસંલ-  
ખાયં કરે ઈ લવિસ્સાઈ (૧૨) તેરસમે સુમળે મહા રહેવણા  
નુતા દીઠો, તસ્સ ઇલં વેરાગલાવે ચારિતં ન ગિન્હસેઈ.  
જે વર્દ્દલાવે ગિન્હસાઈ (૧૩) બહુ મગ્ધ રયણું તેયણું દિંદું;  
તસ્સ ઇલં લરહે ઈરવહે સમણું કલહ કરા, ડમરા કરા;  
અસમાહિ કરા, અનિખુય કરા, થ્રાવસ નેહા લવિસ્સાઈ (૧૪)  
પશ્ચરસસમે સુમળે રાય કુમારો વસહાડુંદો દીઠો, તસ્સ  
ઇલં ખતીયકુમારા રાયલહી લવિસ્સાઈ, જુવણું સ૦વં ગિન્હસાઈ (૧૫)  
સોલસમે સુમળે ગય કનહા જુયલા, ઝુજ કરંતા  
દીઠો, તસ્સ ઇલં અપ્પ મેહા, અપ્પકાલં, વાસિણો મેહા,  
પુતાયસી સાય અકાલ લાસિણો. દેવગુરુ અમ્મા પીયરો, સુસુ  
સગા ન લવિસ્સાઈ (૧૬) હુસમ આરો મહા હુહ દાયગો.  
દોયણું જેસિહ પરક્કમા તે લવસમુદ્ તરી જીણુ, કેઈ

હેવલોગંભિ સેઈ, તાં સોચ્યા ચંદ્રગુતે રાયા કામ લોગાં તિંવ્ટ-  
તચે, વેરાગ ભાવે પૂહુંતે. જીવ પ્રોવાઈએ હેવલોગગાંઓ, એચાણિ  
સુમણુણિ સોચ્યા, શુદ્ધ મળ્યા વસર્ધી, સોસીહુય લવિસસર્ધી.  
ઈતિ સોલ સુપન વિચાર, શ્રી બ્યવહારની ચૂલ્લિકામાંહિ છે. એ  
મધ્યે એમ કહ્યું જે, ચૈત્યની સ્થાપના કરશે એવા કુમતે કરી.  
ડાંડાસાહી નાચશે. એમ કહ્યું તે ક્યારે થયું તે સંવતની વાત લખીએ  
છીએ. તે ખંલાત પાટણું છે તે મધ્યે નીકળી છે. તેહના કેટલાએક  
ઓલ લખીએ છીએ—શ્રી મહાવીર મોક્ષ પહેંચ્યા પછી ૪૭૦ વર્ષે  
વિકિમ રાજ થયો. તેનો શાકો (શક-સંવત) ચાલ્યો. શ્રી વિકિમાતૃ  
૩૩૫ વર્ષે નિગોદ વ્યાખ્યા કાલિકાચાર્ય ૪૫૩ વર્ષે કાલિકાચાર્યેણું  
ગર્દાલી જિત્યા. ૫૨૩ વર્ષે કાલિકાસુરિએ પાંચમથી ચોથે પળુસણું  
આણ્યા. ૬૦૮ વર્ષે દિગંબર મતોત્પત્તિ. ૭૮૦ વર્ષે સ્વાતિ સુરિલિઃ  
પંચકાર્ય પૂર્ણિમાથી ચૌદશે પક્ખ સ્થાખ્યો. ૮૮૦ વર્ષે દેહરાં પ્રતિમા  
ધર્મ મંડાણું, એક પાઠ ૧ સંવત ૪૧૨ ચૈત્ય સ્થિતિ ૧૦૦૮  
પોસાલ મંડાણી. ૧૦૫૫ હરિબદ્રસુરિ ૧૪૪૪ બૌદ્ધ હેમ તેણે ૧૪૪૪  
અંથ રચ્યા. સંવત ૧૧૫૬ પૂર્ણિમા પક્ષ, સંવત ૧૨૦૧ ગુરુથી ચેલો  
પુસ્તક દર્શા વૈકાલિક દેખી અલગો થયો. ચાઉડને દેહરે વાદ કીધો  
તેણે ચાઉડગાં કહેવાણો. ચામુંડા સ્થિતિ. સંવત ૧૨૦૪ જિન  
વલ્લભ વાદ કીધો. સંવત ૧૨૦૧ બારણે નીકળ્યો. સંવત  
૧૨૦૪ વાદ કીધો. પછે જિત્યા. પછે જિનવલ્લભ ખરતર કહે-  
વાણ્યા, ખીજ કુળા કહેવાણ્યા. પછે જિન વલ્લભે ૨ સંધ-  
પટા કીધા. પછે ભરાવી નાખ્યો. ખરતર, સંવત ૧૨૧૪ આંચલીક,  
સંવત ૧૨૩૬ પૂર્ણિમા પક્ષ, ૧૨૫૦ આગમિક, સંવત ૧૨૮૪  
વસ્તુપાલ તેજપાલ, સંવત ૧૨૮૫ તપગાં કિયા. એ લખ્યા જોતાં  
૪૭૦, ૮૮૦, ૧૩૫૦ વર્ષે આજ સંવત ૧૫૩૨ સુધી ગણુતાં ૨૦૦૨  
થયાં. મહાનીરને મોક્ષ પહેંચ્યા, તે વારે ભરમગંહ હતો તે ઉત્તર્યો.  
તે વારે હુંકાનું પ્રવર્તન દીપતું થયું. એટલે ભરમગંહ બેઠો, ૫૩૦

૧૦૦૦ વર્ષ સુધી પૂર્વ રહ્યા હતાં, તેણે અસમયહનું બળ ન ચાલ્યું.  
પછે પૂર્વ વિછેદ ગયા પછી, ૩૫૦ વર્ષે બાર વરસી દુકાળ પડ્યો.  
પછી ચૈત્ય સ્થાપના, એટ લરાઈ માંડી કીધી છે. (૨૭)

હવે લુંકા થયાની વાત લખીએ છીએ:—

સંવત પનર ખત્રીસો ગયોં, એક સુમતિ મત તિહાંથી થયો,  
અહુમહાવાદ નયર મજાર, લુંકો મહિતોં વસર્ધ વિચાર, ૧  
તરું દેખોનિં રષી આચાર, તે ગાથાનોં કરદ ઉદ્ઘાર. ૨  
અંથ અર્થ મેલી અતિ ધણોા, સંગત જે તે લીખવા તણોા, ૩  
તીસ્યેં તેહનેં મીલ્યો લખમશી, તેણે એ હુંદ વાત વિમાસી અસી  
સૂત્રે ઓલ્યો જે આચાર, એ પાસે તે નહિ લગાર ૪  
ભણો અંથને રાખે વેસ, થાપે નિત્ય કુડો ઉપહેશ,  
લોએ પ્રવાહી જાણી નહી, શુરૂ જાણી વંદે છે સહી. ૫  
સૂત્રે તો શુરૂ તે લાષીયા, સાચી જે પાલે રિષિ કિયા,  
સાધુ તણોા તો નામ નિથંથ, એ તો દેખી તાસ અંથ ૬  
સાધુપંથી ભાષા નિરવધ, એ તો બાલે છે સાવધ,  
જ્યોતિક નિમિત્ત પ્રકારો ધણોા, વૈદક કરે પાપ કર્મ તણોા. ૭  
નવિ કર્દે નવિ કરે વિહાર, ખમાસમણે વિહરે અવિચાર;  
આધા કર્મી લે આહાર, પાપ થકી ન કુટલે લગાર. ૮  
લોક લોળવી એ લોલે પડ્યા, મછરોગેં અલિમાને ચડયા,  
એહને વાંદે લાગે પાપ, એહવે સુમતિએ કદ્યો જવાબ. ૯  
થતઃ—અસંજ્યં ન વંદિના, માયરં પિયરં શુરૂ,  
સેણો વય પસત્થારં, રાયાણું દેવ યાણિય ॥૧॥ ૧૦  
પાસત્થાઈ વંદ માણુસ્સ, નેવ કિત્તિ ન નિજરાહોઈ,  
જાયાઈ કાય કિલેસો, બધો કર્મસ્સ આણુાઈ ॥૨॥  
કિર્દી કર્મંચ પસંસા, સુસાલ જણું સિકર્મ અદ્ધાય,

જે જે પમાયડાણું, તેતે ઉવ ખૂંહિયા હુંતિ ॥૩॥      ૧૧  
 એ સુમતિ દેખાડી લોકને, લોક ધણો સંકાણો મને,  
 કુગુરસંગથી બીહુનો ધણો, છંડે સંગ મઠપતિ તણો; ૧૨  
 પુછે તેહને મહાત્મારે વાણિયા, કંઈ કર્યો દોહિલ પ્રાણીયા,  
 કુળશુર કાં વાંધો નહીં, અમૃહે લાણુંબ્યા તુમહુને સહી. ૧૩  
 પ્રતિષ્ણાધિને શ્રાવક કર્યા, વડે તુમહારે અમહુને આદર્યા,  
 આજ તુમહે શું સમજાયો ધર્મ, તેહનો અમહુને લાયો મર્મ. ૧૪  
 વળતો ઉત્તર લુંકા કહે, તુમહ હિંદે અમ મન નવિ રહે,  
 તુમહે કહાવો સફુર સાધ, ધણુા લગાડો છો અપરાધ. ૧૫  
 ગુરુ છત્રીસ ગુણુ પરવર્યા, તે તો તો તુમહેં ન હીસે જરા,  
 તો કિમ ગુરુ જાણી વાંદીએ, તવ ઉત્તર હીએ લિંગીએ. ૧૬  
 ગુણ અવગુણની વાત મત કરો, વેસ જોઈ મન નિશ્ચિલ કરો.  
 જિનશાસને વંદવો વેસ, એહુવો તે દેખાવે ઉપહેશ. ૧૭  
 એ વાત લુંકે સાંભળી, તેહને ઉત્તર આપે વળી,  
 વેસ તણો છે કવણુ વિસેસ, જન કરે શુદ્ધો ઉપહેશ. ૧૮

ગાહુ—

વેસો વિ અપમાણું, અસંજમ પએ સુવદુ માણુસસ,  
 કિં પરિત્તિ અવસેસં, વિસં ન મારઈખજજતં ॥૧॥      ૧૬  
 તવ લુંકાને કહે મહાત્મા, કંઈ કરો દોહિલ આત્મા,  
 વેસ તણો છે મહિમા ભવો, સાક્ષી તે ઉપર સાંભળો ૨૦

ચતુઃ—

ધર્મં રખુઈ વેસો, સંકદ વેસેણુ દ્વિખાયો અહ;  
 ઉમર્યોણુ પડંતં, રખુઈ રાય જણુ ઉચ્ચ ॥૧॥      ૨૧

લુંકો કહે\* ન મનાય એમ, કેવળ વેસ મનાય કેમ,  
સાધુ ગુણે વંદીએ વેસ, અવસર નથી જાણો ઉપદેશ. ૨૨  
લુંકો કહે અમહે પરિખ્યો ધર્મ, તુમહે ન જાણો તેહનો મર્મ,  
ગુરુ આચારી ગુણવંત હેવ, અમહે તેહની સારં સેવ. ૨૩  
પુનઃ જે તુમહે મને વિમાસ, કુગુર તણી નવિ રહીએ પાસ,  
વરે સવિ ને વિષધર સાપ, કુગુર સેવતાં છે બહુ પાપ. ૨૪  
વળી જે હીણુચારી હોય, ગુણવંત પાસે વંદાવે સોય,  
તે પુનઃ હોય દુટો પાંગલો, હુર્લાલ એધિ ધર્સણે! મેં સ્ફૂર્યો ॥૨૫॥  
શ્રી આવશ્યક નિર્યુક્તે, જે ખંલચેરલઠા,  
પાયે પડંતિ ખંલ ધારી, તે હુંતિ દુંટ મુંડા, એહિય સુહુલ્વહા તેચિ ૨૬  
ભણ્યા ગુણ્યા ગુણ્ય તસુ માંહિ, લોચ કરે, આણુચાણુ પાઈ,  
તો પુન : પાસત્થા દિક પંચ, મ કર્યો તસુ સંગતિનો સંચ. ૨૭  
ચંપકમાલા અશુદ્ધિમાંહિ પડી; ઉત્તમ ભસ્તક તે નવિ ચડી,  
તિમ કરણી પાસત્થા કરે, તસુ વંદના ખરે ૨૮

યતઃ—

અસ્ફૂર્દ ઢાણે પડિયા, ચંપકમાલા ન કીરદ ચિરોં,  
પાસત્થાર્દ ઢણિસુ, વદુમાણુ તહુ અપુજા. ૨૯  
ખ્રાદ્ધાણુ ચૌદ્વિધાનો જાણુ, ચંડાલી સંગતિ રહિંએ અનાણ.  
જિમ પામે નંદા અતિ ધાણી, કુસીલ સંગતિ એહુવી ગણી ૩૦

\* લુંંકો કહે વેશ ઉપર દદ્ધાંત સાંભલો, જિમ બાંધણે  
સાકર બાંધી, બાંધણુ ઉપર સાકરતું નામ લખણું હોય અને તે સાકર  
કાઢીને કરૂ લર્યો, બાંધણુ ઉપર નામ તો સાકરતું છે. પછી ક્રેચ  
બાંધણુ છોડી ખાય તો સાકરનો સ્વાદ આવે, તો બાંધણુના ગુણે  
જે વસ્તુ હોય તો રાખે તેમ ધર્મ હોય. તો વેસ રાખે, પણ ધર્મ  
નહિં તો વેસ શું કરે? બાંધણુને દદ્ધાંતે.

યત:—

પદ્ગણુ કુલે વસતો, સ ઉણીદારન્યો વિગ રહિઓ હોએ,  
ધ્ય ગર હિયા સુવહિયા, મંજિમ સંતા સંતા કુસીલાણું. ૩૧  
એ પરમતિં વિમાસી કરી, કુશુર તણી સંગતિ પરિહરી,  
શુદ્ધ ધર્મ અમહે આચરેં, કુગુર કુદેવ સંગતિ પરહરેં. ૩૨  
તુમહે તો નિર્ગુણુ ગુર આદર્યા, દેવ અજ્ઞવ નિહાળી ઠર્યા,  
અજ્ઞવ કાજે કાય છ હણો, એ ઉપહેસ કહો કેહ તણો. ૩૩  
જ આરંસના ઠામ નવિ લને, તાં સમકિતનો ગુણ ઉપજે,  
દ્વા કહી છે શ્રી વીતરાગ, અમહે રહ્યા એણો વચને લાગ. ૩૪  
પ્રતિમા પૂજ હોએ આરંસ, દ્વા વિના બીજે ધર્મ દંસ,  
આચારંગ અધ્યયન ચીથે કહ્યો, સમકિત તણો પ્રસંગ લધ્યો. ૩૫  
પ્રાણીભૂત સર્વ જીવ, એમ વિહુણવા નહી સહીવ,  
ગૃહસ્થને એ ઉપહેશ, એમ કરંતાં સવિ ટણે કિલેશ. ૩૬

ઈતિ પાસ્તથાના દોષ નિર્ગુણને વાંદાના દોષ કલ્યા. હવે  
ક્રાઈ કહેશે જે શું તે વેષધારી સૂત લણુતા નહી હોય? તેહનો ઉત્તર  
લખીએ છીએ. ૨૮

સિદ્ધાંત ભણે ધણુંયે, પણુ સમજણે નહી. તેહનું ભણું કામ  
ન આવે, તે ઉપર દ્વારાંત કહે છે. જેમ ગધેડા ઉપર ચંદ્ન ભર્યુ,  
પણ વાસના ન જણે તેમ ભણે પણ સિદ્ધાંતના ભાવભેદ ન જણે.  
સિદ્ધાંત ભાવભેદ શા માટે ન જણે તે કહે છે. જ્ઞાનાવરણીનો  
કદાચિત જીવને ક્ષયોપશમ ભણુવા આશ્રી થયો હોય તો, ભણુતાં  
આવડે પણ મિથ્યાત્વ મોહનીનો ઉદ્ય હોય તેણે કરી શુદ્ધ ન સહ્યે.  
યથા દ્વારાંત-જેમ સર્વ વિષનો ધણી કરૂય વસ્તુ ખાદે થકે ગળા  
લાગે (૧) તથા ધંતુરો ભક્ષીત પુરુષ જેમ પીત સર્વ વસ્તુ પીળા  
દેખે, (૨) તથા મદિરા પીધાની પેરે ગહિલ્યો (ધેલો) થાય. (૩)

તथा ભૂત વળગે. નેમ તેમ બોલે, શુદ્ધિ ન રહે, નેમ ભિથ્યાત્વ  
મેણનીને ઉદ્ઘે, નેમ તેમ સહૃદે, (૫) એહિં જાણી શુદ્ધ સહૃદીએ.  
નેમ ધણી નિર્જરા થાય. રાગ આશા ઉરી:—

ખાવા તેં સૂત્ર લાણી કહા કીનો, આધાકમી' વ્યાપાર  
ન છાંડયા, કુપરંપરા મેલી ના—ખાવા૦

નિત્ય પિંડ તેડ્યા આહાર ન તળ્યા, સેવક સમ આધોનો,  
નિશદ્ધિન સાથ સંધાતે ચાલે, ભિથ્યામતિ લીનો—ખાવા૦ ૨  
આધાં પાછાં સૂત્ર પ્રરૂપે, હુર્ગતિથી નવિ બીહીનો,  
ખખર નહીં જિન માર્ગ કેરી, જરૂતચું ઘાલી કીનો—ખાવા૦ ૩  
શ્રી જિનમાર્ગ છાંડી કરીનો, ઉનમાર્ગ મેં લીનો,  
કુગુર તણો ઉપહેશ અહીને જિમવારેં રહ કીનો—ખાવા૦ ૪  
સ્થાપ્યા ધુષ્યા જિન શુરૂ માને, તેણે કોણુ કહે રસ નિનો,  
આક ધંતુરાનો રસ પીનો, છારે સ્વાહ અમીનો—ખાવા ૫  
શુદ્ધ પરૂપક ઉપરે દ્વેષી, તત્ત્વઘ્�યાનનોં હીણો,  
નિર્મલ જિન મત કરી રાખે, ઉનકો જન્મ નગીનો—  
ખાવા તેં સૂત્ર લાણી કહા કીનો.

૭

ઇતિ સૂત્ર અમીરસ ૫૬ સંપૂર્ણઃ ॥૨૬॥ જે કોઈ એમ કહે  
જે ભિથ્યાત્વી પાસે સિદ્ધાંત સાંભલ્યાની તથા લાણ્યાની શા બાધા !  
તે ઉપર ઉત્તર લખીએ છીએ—આંખમાંહિ ગાયના દુધની જગ્યાએ  
આકડાનું દૂધ ઘાલ્યું, અવગુણ કરે. ગાહા—

હંસણુ સમકિત પરમત્થ સંથવો વા, સુદિઠ પરમત્થ,  
સેવણુ વાવિ, વાવણું કુંદસણું, વજણું સમ્ભતસ્સ, સદ્ધહણું ॥૧॥

ઇતિ વચ્ચનાત, ભિથ્યાત્વનાં ૪ લક્ષણુ કહીએ છીએ. મૂળ  
થકી જ વિતરાગનાં વચ્ચ સહૃદે નહીં, ૩૬૩ પાખંડીમત ॥૧॥

તथा કાંઈક સહે કાંઈક ન સહે, જમાલી પ્રમુખ ઉ નિન્હવવત् (૨) તથા આધાંપાણાં સહે પેટાલપુત્રવત् (૩) તથા નાણાં તરેહિ, ધલાદિ સંકાદિ વેહ (૪) એ ચાર લક્ષણઃ ૩૦ એલ ગણ્યા છે. હવે ભિથ્યાત્વી અસાધુ તથા વાતન કુદંસણુની સંગતિ ન કરવી. તે ઉપર પ હેતુ ૧ કારણ લખીએ છીએ.

૧ ભિથ્યાત્વીની સંગતિ ન કરવી. એ પક્ષ. (૧) ૨ શા માટે સમકિતને અતિચાર લાગે તે માટે, એ હેતુ ॥ ૨ ॥ ૩ ક્રોણ દ્ધ્યાંતે, નંદમણ્ણાયાર શેઠ તથા સોમિલ્લ આલણુને દ્ધ્યાંતે ॥ ૩ ॥ ૪ જે જે ભિથ્યાત્વીની સંગતે, તે તે ભિથ્યાત્વનું દર્શન (૪) ૫ તે માટે તે ન્યાયે કરી ભિથ્યાત્વીની સંગતિ ન કરવી. (૫) ૬ કારણ ભિથ્યાત્વીની સંગતિ વિના સમકિતને અતિચાર ન લાગો (૬) શ્રી વીતરાગ ગણુધર, શ્રી સાધુચારિત્રોયા, સંસારમાંહિ સાર પદાર્થ છે, વંદનીક પૂજનીક છે. એહેજ વિતરાગાદિક ગૃહવાસે હોય અને પટ્કાયને આરંભે વર્તે, તેવારે સાધુને વંદનીય નહીં. તો પ્રતિમા અજીવ અચેતન અને જ્યાં પટ્કાયનો આરંભ વર્તે તેવારે સાધુને વંદનીક કેમ હોય ॥ ૧ ॥ ૨ તથા તીર્થકર ગણુધર સાધુ એહની અકિત આરંભે ન થાય; તો અજીવની ભક્તિ કેમ થાય? ॥ ૨ ॥ ૩ તથા ગુણ વંદનીક કે આકાર વંદનીક, તો પ્રતિમામાંહિ કેહનો ગુણ છે? અને જે આકાર વંદનીક, તો આવડા પુરુષ આકારવંત છે તે કેમ વંદનીક નહિ ॥ ૩ ॥ ૪ પ્રતિમા કર્થ અવસ્થાની છે? જે ગૃહસ્થની તો સાધુને વંદનીક નહીં, અને જતિનો તો ચિન્હ દીસતો નથો. જે જતિ જણો તો ફૂલ પાણી દીવા કાં કરો, (૪) ૫ તથા દેવ મોટા કે ગુરુ મોટા, જે દેવને ફૂલ ચેઠે તો ગુરુને કેમ ન ચઠાવો! જે જણો ગુરુ મહાવતી, તો દેવ શું અવતી છે? (૫) ૬ તથા શ્રાવક

x શા ૧ કહેતા-શ્રવે અને વક=વચન સાધુના એટલે સાધુનાં વચનને સંબિંજનાર તથા સંલળી સહે તે માટે શ્રાવક.

સાધુને વાંદવા આવ્યો હોય અને કુલદળ કનેહોય તો અલગો રહે, સંઘર થાય તો દેવને કેમ ન થાય, તथા ગુરુને દીવાની ઉન્નેર્થાય તો દેવને કેમ ન થાય ॥૬॥ ૭ તથા કેટલાએક આવક પ્રાય: પ્રતિમા પૂજાવે છે, પૂજણુષાર ધર્મ જાણી પૂજે છે, તો જતિ કેમ ન પૂજે? ધર્મ તો જતિ ચે પણ કરે છે. તો કેટલેક હિસ્સે જે જતિ વિરતી છે, પણ જુઓને જતિને પાપ કરવાનો નીમ છે. પણ ધર્મ કરવાનો નીમ નથી. તો ડિકે કેમ ન પૂજે ॥૭॥ ૮ તથા પ્રતિમાના વાંદણુષાર પ્રતિમાને વાંદે, તેવારે વંદના કેહને કરે છે? જે એમ કહે જે હું પ્રતિમાને વાંદુ છું. તો વીતરાગ અલગા રહ્યા, વંદાણા નહી અને એમ કહે કે એહ વિતરાગ જુદા નહી. તો અજુવે જીવ સત્તા થાય અને જીવ એક સમે એ કિરિયા તો ન વેહ ॥૮॥ ૯ તથા કેટલા એકના દેવગુરુધર્મ સારંભી, સપરિયાં અને કેટલાએકના દેવ ગુરુ ધર્મ નિરારંભી, નિ: પરિયાં છે, વિચારી જે જે. ॥૯॥ ૧૦ તથા કેટલાએક એમ કહે છે, જુઓને જો પૂતલી દીડે રાગ ઉપજે, તો પ્રતિમા દીડે વૈરાગ્ય કેમ ન ઉપજે? તેહના ઉત્તર: કોઈક અનાર્ય પુરુષને ગ્રહાર મૂકે તો પાપ લાગે. તો તેહને વાંદે તો ધર્મ કેમ ન લાગે? તથા એટા વોસિરાવ્યા ન હોય તો તેહનું પાપ બાપને લાગે, પણ એટાનો કીધ્યો ધર્મ કેમ ન લાગે? ॥૧૦॥ ૧૧ તથા કેટલા એક એમ કહે: છાણુનો ગોરસ કીધ્યો હોય અને ભાંગીયે તો પાપ, તો તેહને વાંદે તથા દૂધ પાય તથા વોસામણ કીધ્યે ધર્મ કેમ નહિ? ॥૧૧॥ ૧૨ તથા કેટલાએક એમ કહે છે:-અમારે પ્રતિમા પૂજતાં હિંસા તે અહિંસા, તો રેવતીનો કીધ્યો કોહલા પાક શ્રી વિતરાગે કેમ ન લીધ્યો? આધાકર્મી આષાર કેમ ન લીએ? જે કુલ પાણીની લક્ષ્ણિ, તે ખાલ્ય વરતુ છે. અને લાડૂ જલેખી આદિ વીતરાગ ગણુધર સાધુને કાંજે કોઈ કરે તો, એતો અંતરંગ લક્ષ્ણિ છે. આગળ વળી ધર્મની વૃદ્ધિ ધણી થાય, વિચારી જે જે ॥૧૨॥ ૧૩ તથા વળી કોઈ એક ગલીના વાણિજનો નિયમ નવ લાંગે લ્યે અને ગલીના

વાણિજનો લાભ બીજને દેખાડે, તો તેહના નિયમ ભાંગે, તો જુઓને જેણે પંચ મહાપ્રત ઉચ્ચર્યા હોય, તે સાવદ્ર કરણી ભાંહિ લાભ દેખાડે, તો તેહનાં વ્રત દામ કેમ રહે ? વિચારી જેણે. ॥૧૩॥

૧૪ તથા શ્રી અરિહંતની સ્થાપના ભાંહિ શ્રી અરિહંતના ગુણ નથી અને ગુરુની સ્થાપના ભાંહિ ગુરુના ગુણ નથી. કેટલાએક એમ કહે છે, જે ગુણ તો સ્થાપના ભાંહિ નથી પણ આપણો ભાવ ભેદીએ.

તો વંદનીક પૂજનીક થાય. જે ગુણ વિના દેવની તથા ગુરુની સ્થાપના ભાંહિ આપણો ભાવ ધારે ગરજ સરે, તો આપની ભાતાની તથા ઝપા સોનાની જવાહિરની ગુલખંડ સાકર પ્રમુખમાં, આપણો ભાવ ધારે ગરજ કેમ ન સરે ? આ ડાઢા હોય તે વિચારી જેણે. તો દેવગુરુની ગરજ કેમ સરે ? માટે ગુણ વિના ગરજ ન સરે. વંદનીક જ્ઞાનદર્શન ચારિત્ર સહી જાણે. ॥૧૪॥ એ પૂર્વોક્ત પ્રશ્ન તથા ઉત્તર લખ્યા તે કોણ આગળ પ્રકાશતાં કેટલાએક ઉત્તર દેવાને અસમર્થ પણે ઝૂઝ કરવા માંડે છે, તે ઉપર વિતરાગને વિનિતિ કરીને સલ્લ પદાર્થ પ્રકાશતાં પ્રલુદ તુમ્હારો શરણું છે. તે માટે લખીએ છીએ.

શ્રી જગગુરુ જિણુવર વિનિંબુ, વિનતડી અવધાર,  
ત્રિલુલન નાયક એ તો, જુગતા જુગતિ વિચાર. ૧  
દશમ અછેરો સખળ વળી, મિલિયા અહુ મિથ્યાત,  
તેણે કહેવા કો નવિ લહે, સાચી આગમ વાત. ૨

કોણ પ્રહેં અતિ ચતુર, પરમાર્થ અખુઅ,  
જે કોઈ સાચું કહે, તેહ શું મંડે ઝૂઝ. ૩

ઝૂઝ કર્યાનો લય નથી, જે ઓદે તુમહ પ્રાણી,  
તેહ તણું આગળ વચન, કૂડો કૂડ નિમાણી. ૪

સ્વામી તુમ્હારો જે વચન, છયકાય હિતકારી,  
તેમ એ પ્રલુદ કિમ દોપિએ, ત્રિલુલનનો આધારી. ૫

ત્રસ થાવર ને જીવ જગે, અશારણુ અને અનાથ,		
તેહિજ તેહનો પ્રભુ શરણુ, તેહનો તુંહીજ નાથ.	૬	
વેદ ન આપ સમાણુ તસુલાષી ત્રિભુવન સ્વામી,		
આગમે ગોયમ આગલે, નેવી હશે તુમ્હ નામી.	૭	
શરણું મેલ્હી સાધુનેં, ઝડી પરે લલાવી,		
છય કાય હિત ચિંતવી, પહુતા સિવ ઢાઈ-	૮	
અવિરત જને છકાય નેમ, ધસ મસ ધંધો લાઈ,		
દેખી વાહર ને કરે, તે વાહર કહાઈ.	૯	
ને તુમ્હે કીધા વાહરું, તેઈ ઉઠાડે ધાડે,		
ખાહુખલે અવગુણી ધાળી, ધંધો લે શ્રૂત વાડે.	૧૦	
તે તરું ફળ કેમ ઉછરે, ને ખાવા ધાવે વાડેં,		
વોલાવા ચારી કરે, તો કિમ લંઘિયર્દ ઉલાડે.	૧૧	
પુઢી શરણું કુલાલ ને, પોસે નિય પરિવાર,		
તેદ્જ ચાંપી ફુલવો, તો કુણુ રાખણુ હાર.	૧૨	
નાવડ જલેં આળવિકા, જન ઉત્તારે પાર,		
તેણુ પ્રવાહે પ્રવાહીયે, તો કુણુ રાખણુ હાર.	૧૩	
તર્યેં મધુ ધતિ ને સદા, ઈચ્છે લહીશું પાર,		
ધર પરણલે તેચ ને, તો કુણુ રાખણુ હાર.	૧૪	
જીવન ને જીવહ તણોા, વાયે વાયુ સુહુકાર,		
તેચ વિડાંખિં દેહને, તો કુણુ રાખણુ હાર.	૧૫	
તરું મળેં ને વેલદી, વિહુંગે કર્યો આધાર,		
સર્પ જ ચવી ને હણો, તો કુણુ રાખણુ હાર.	૧૬	
મંત્રિ પુરોહિત છત્રપતિ, સેવકનો સાધાર,		
મરણુ હેતુ તે ચિંતવે, તો કુણુ રાખણુ હાર.	૧૭	

વાડી ખાચે જે ચીલડાં, કિહાં હોય તાસ પોકાર,	
જે રાજ ચોરી કરે, તો કુંણુ રાખણુ હાર.	૧૮
પાવક પ્રગટે નીરથી, હાર હોય જે સાપ,	
તો કહે લોક કિસ્યું કરે, જુઓ વિચારી આપ.	૧૯
જિણે મહાવત આદ્યા, પ્રભુ તુમહુ પ્રવચન લાધ,	
જે તે જીવ રાખે નહીં, બીજનો શો અપરાધ.	૨૦
નિત્ય વાસિ અતિ જિહાં રહે, મમત કરે સંભાળ,	
અર્થે કરાવી જેહને, તે કિમ પોસહ સાલ.	૨૧
તેય ઉપાશ્રય બોલીએ, જેહ હુધણુ નહીં કોય,	
આપ અર્થે કીધો ગૃહી, ઘર લ્યે સુધો જેય.	૨૨
યદ્યપિ ઘર જિમ પૂરિયાં, દીસે ગરથ લંડાર,	
ધરણી વિણું તંહ ચિહું નહીં, ઘર ભાષા વ્યવહાર.	૨૩
પોસહ સાલા ન ઘર નહીં, નહીં ઉપાશ્રય જેણુ.	
લિક્ષાચર વસવા લાણું, મઠ બોલી જે તેણુ.	૨૪
તેહના પતિ જે મઠપતિ, તે કિમ ઓલે સાચ,	
લોલેહિ ગુરુ ભોલેં અહ્યા, રતન વરાસેં કાચ.	૨૫
હુજણુ બલી રાઉલ વળી, વાનર વીછી ખાધ,	
સેણુ ચડ્યો ચરડાહ કરે, દાધ કર હેવેં દાધ.	૨૬
તેહનો હિં કહેવું કિસ્યું, મંડચો નવલો રાજ,	
શુત વિપરીત પરંપરા, કરે દ્રોહે નિજ કાજ.	૨૭
અષભાદિક ચઉવીસ જિન, ભરતાદિક બહુ રાય,	
ઈસર તલવર માડંબી, કોડંબી સત્થવાહ.	૨૮
ઈસ શેહી સેના પતિ, આગે હૂવા અનેક,	
પ્રવચન જોઈ જાણુનો, મન આણુનો વિવેક.	૨૯

તેહનાં નામન ફેરવો, સંજમ અવસર લોય, ગુણ વિણુ નામે મોટ કે, ગુણુસાર વિહોય.	૩૦
ખાલલ ફૂડે પોગરે, કિમ ગજવેલિ કહાય, નામ બણે સંજમ વિના, કુણ નિરવાણ જય.	૩૧
નામ ફેર પ્રવચન વિનાં, એ કેહવો આચાર, કર્ણુ વેધ કીધે કહોા, કિમ લાલે ભવપાર.	૩૨
પ્રવચનેં પ્રલુ તુમહે કર્યો, પહેરે ઉજજળ વેશ, સિર દકેવા કંખલી, બહુ મૂલેંકસ વિસેસ.	૩૩
જણે લરી ગોળે ગાડુયા, રાખે વસતી મજારિ, ગાછ વિણુસે કાપુરિસ, એ આદરે સુ નારિ.	૩૪
આમંત્રણે જઈ ગોચરી, ધરે આસણે બેસાંતિ; અણુએ સેવતાં, ઓધિનાસ પાવંતિ.	૩૫
આધાકર્મ આહાર દ્યે; આજીવકા અવિચાર; સુહમંગલિયા જિમ કરે, પેટ કાજે કઈ વાર.	૩૬
સાલા લહુડી ને વડી; પાલહણુપુર લડ્યચ્ચ; ઇસી નાણુ કોરટા; વેગડ નામેંજિ ગંચ્છ.	૩૭
ભાણુ સઉલ ઇત્યાહિ બહુ, વિવિધ ગાછ જગમાંહિ, પર વચન કેડ પરંપરા, કિંવા લોક પ્રવાહિ.	૩૮
માંહોમાંહિ કમલ બલેં, જ્યુયા ફૂયા નામે, ચઉરાસિથી અધિક છે, તિહ કુણ આગમ ઢામે	૩૯
નેશા કરે આપ આપણું, શ્રાવક જિન પ્રસાદ, વાડ ઓલાં મંડી રહ્યા, ઈમ કિમ જિનમત નાદ (નામ)	૪૦
પ્રાસુક જલે જતન વિકરી, સર્વત દેશત નહાણુ, પ્રવચન વાસો જે કરે, ભંજે તે તુમહ આણુ.	૪૧

જિણુ તનિ પોતે ઉદ્દેશીએ, સુવિહિત ભણુ મને આણુ,	
તિણુ નિજ પોત ઉદ્દેઢે, આણુ લંગ પ્રમાણુ.	૪૨
પાય પખાલી પડિક્કમે, વિધિ માર્ગ ઓલાંતિ	
પયલેહણુ પ્રવચન વચ્ચન, ચંદન ખર તોલાંતિ.	૪૩
વડે પ્રવિં જિ જિકારવેં, ન ગિણે રાતિ નહીંહ,	
તે પ્રભુ આગળ શું કહું, તુમહ આણુ અખીહ.	૪૪
ચૈતર શુહિ તેરસ દિવસે, જન્મ થચો શ્રી વીર.	
ઉછલાદ્ર વિકારવે, જેવું સાહુસ ધીર.	૪૫
માત્ર આણુ વઈ એણિં મસિં, વલી વધારે તેય,	
પુત્ર જન્મ તેહવે હૂવે, એ આરોગે જેય.	૪૬
ચૈત્ય તાપ ઊજમાણુા, ખામાણુાદિક અનેક,	
ધન મેલવા કારણે, કરે ઉપાય અનેક.	૪૭
ઇમ ધન લેઈ ચેલાણુા, તેહને આપે હીક્ષ,	
કહો કિસીપરે પાલશો, તો પ્રત લંજક શીષ્ય,	૪૮
માંખી મધુ કણુ કીટિકા, સંચે તે કિણુ કાજે,	
તિમ લિક્ષુક ધન મેલવી, શું જાણી જિનરાજે.	૪૯

થત:—

વરત્યા કેરી રિધડી, જિહુભુંકે તિહુ જાય,	
હિયે ધ્રસકોં પેટે, ઝ્રલ આપણુ ભીક્ષી ખાય.	૫૦
જિન પ્રતિમા પોતે કરી, ધૂપ વાસ કર્પૂર,	
ઈણુ હિંસા પૂળ કરે, તેઝથી સિવપદ હૂર.	૫૧
જે અકાજ મુનિ નહુ કરે, કિમ કરાવે તેહ,	
તે અનુમોદે કેણુ પરે, એ મુઝને સંદેહ.	૫૨

સાધુ વેસે પૂજા લહે, નામગુરુ કહેવાય,	
દોક વચને તોહજ શુરુ, તો શ્રુત કૂડો થાય.	૫૩
બહુ મુંડા ચોડા શ્રમણ, વાસે હુસમકાલી,	
સાચું જાણી એ વચન, વિરતા દે સંલાળી	૫૪
નેય ચોર તે શુરુ કસ્યા, જે શુરુ તે ચોર,	
એ નતિ ભૂમદોકનો કિંવા કાળ કઠોર	૫૫
દોક તણો હુષણુ કસ્યો, શું હુષી જે કાળ,	
કર્મ ટાળો પુરા પુરુષ, કુણિંહી નદીએ આળ.	૫૬
પુણુ સ્વામી હું કિમ કરું, તુમહુ ઉપર અતિ ભાવ,	
દૈખી આણુ વિરાધના, મને મોટો હુઃખ થાય.	૫૭
શ્રુત વિપરીત સમાચરી, યોદેં શ્રુત વિપરીત,	
શ્રુત અવહીલેં બાહુ બદે, એણિ હુએ દાજે ચિત્ત	૫૮
દોક ન જણો ભાપડા, કાંઈ ધર્મ ઉપાય,	
ખાંધી રાખે બળદ જિમ, જિહાં સંચે ત્યાં જથ.	૫૯
અંતરંગ સંગતિ નહીં, બાહિર રંગે રમંતિ;	
શિખરે કલસ ત્રાંખા તણો, સોવનમય પલણુંતિ.	૬૦
પરમાર્થ ચોડું અછે, બહુ ગાડરી પ્રવાહ.	
નેતું રાસ લિમયણું થઈ, દોક સોક અવગાહ.	૬૧
ભાષા સમતિ જે કહે, ધર્મ તણો પરમત્થ,	
તે શુરુ નિશ્ચ જાણીએ, તારણુ તરણુ સમર્થ.	૬૨
ભાષા સુમતિ ન ભજિએ, જે જિન શાસન સાર,	
એ કિં સૂત્ર યોલીએ, રૂલિએ અનંત સંસાર	૬૩
શ્રાવક જિન શુરુની ભગતિ, આગે કરતાં નેય,	
તે પર દીસે થાપના, અંતર કરે ન કોય	૬૪

શુરુની પરે ગુરુ થાપના, હિવડાં સમ વડે થાય,	
અરિહુંત અરિહુંત સ્થાપના અંતર ધણેણું તિ કાય	૬૫
સમવસરણે અલિગમ લણ્યા, શ્રાવકને અધિકાર,	
જિણુ હરિપૂણુ તે જાઈએ, તેહ તેણુ અનુસાર	૬૬
અંથે પૂણુ ઈમિ સાક્ષી છે, ટાળે કદાચહ ઝુદ્ધ	
સમચિતે જે વિચરણે, તે લહેણે ઝળ સિદ્ધ	૬૭
એણું પરે જે માને તદા, જિન પ્રતિમા પ્રાસાદ,	
જિન બિંખ ઉથાપતાં, મંડે લોક વિવાદ	૬૮
જે મંડે તો મંડિ જે, તેમની નાવે રીસ,	
કુડ સાચ જેય છે, તે જણે જગહીશ (તે લહી ગીતીસગીતાર્થ)	
જગહીશર પથ સમરતાં, પાળતાં તુમહ આણુ,	
અપજશ જશ હુણ સુણ સહી, જે હુઈ તે સુપ્રમાણુ	૭૦

ઇતિ સમાપ્તં ॥ ૩૨ ॥

હવે ભિથ્યાત્વના ચાર બેદ લખીએ ધીએ. તે લોકિક ૧ કુમ્રાવ-  
ચનીક ૨ લોકોત્તર ૩ ખોલ મધ્યે લોકિક કુપ્રા વચ્ચનીક પ્રાય: એકજ  
ગણ્યો છે. એટલા માટે લોકિક ભિથ્યાત્વના ૩ બેદ. દેવગત ૧ ગુરુ-  
ગત ૨ પર્વગત ૩ એ મધ્યે લોકિક દેવગત ભિથ્યાત્વ તે કેને  
કહીએ, રાગદ્રોષ સહિત એવા જે લોકના દેવ તેને દેવ કરીને માને  
તે લોકિક દેવગત ભિથ્યાત્વ કહીએ. તે દેવ ક્યા ક્યા તે કહે છે.  
હરી ૧ હર ૨ અલ ૩ ગોગો ૪ ક્ષેત્રપાલ ૫ આસપાલ ૬ હનુમાન  
૭ અંબા ૮ લવાની ૯ ધર્ત્યાદિક દેવના જે નામ દીધાં તેને દેવ  
કરી માને. તે લોકિક દેવગત ભિથ્યાત્વ લાગે ॥ ૧ ॥ હવે લોકિક  
ગુરુગત ભિથ્યાત્વ કહે છે. જે આરંભ પરિમહ સહિત એવા જે  
લોકના ગુરુ, તેને ધર્મને હેતુએ ગુરુ કરી માને. તે લોકિક ગુરુગત  
ભિથ્યાત્વ કહીએ. તે લોકના ગુરુ કહીએ ધીએ. ખાલણુ ૧ ચોગી ૨

સન્યાસી મોટી જરાધારી ૩ કડી કાપડી ૪ તાપસ પંચામિ સાથે  
અને ધૂમ્રપાન કરે તે ૫ લગત દીલાં રૂપકાં કરે તે ૬ વૈરાગી  
માલા ધારી તે ૭ એટલા પ્રમુખ જેટલાં નામ દીધાં તેને ધર્મને  
હેતુએ ગુરુ કરીને માને. તે લૌકિક ગુરુ ભિથ્યાત્વ લાગે ॥૨૨॥ કોણિક  
પર્વગત ભિથ્યાત્વ કેને કહીએ. હોળા, અળેવ, સરાધ, નોરતાં છત્યા-  
દિકનાં પર્વ તેહને પર્વ કરી માને. તે બોણિક પર્વ ગત ભિથ્યાત્વ  
લાગે ॥૩॥ હવે કોકોતર દેવગત ભિથ્યાત્વ કેને કહીએ, શ્રી  
વિતરાગની પ્રતિભા કરીને પુત્રાદિક સંસારની લાલએ પૂજે, માને  
તો કોકોતર દેવગત ભિથ્યાત્વ લાગે. કોઈ કહેશે ને સંસારની  
ધર્ષણાએ વિતરાગની પ્રતિભા કરી પૂજે તો, ભિથ્યાત્વ કિમ લાગે ?  
તેનો ઉત્તર-શ્રી વિતરાગ તે સમક્તિ દણિ શું જાણે ભોગી કે  
અભોગી તો કહે શ્રી વિતરાગ અભોગી. તે વારે વિતરાગે ભોગ  
છાંડચા તો છાંડી વસ્તુ આમંત્રણ કરે તો સમક્તિ કેમ રહે ? શ્રી  
વિતરાગ કામભોગ, ૫ ઈદ્રિયના વિષય છાંડી, કર્મ ખપાવી મોક્ષ  
પહોંચ્યા, તેની પ્રતિભા કરી ધૂપાદિક ઉખેવી છકાયનો આરંભ  
કરી, વીતરાગની અક્તિ માને. એ ભિથ્યાત્વ, યથા દણાંતે-નેમ  
કોઈક પ્રમુખે વમન કર્યું. તે વારે કોઈક મૂર્ખ મિત્ર જેયું ને એ  
મિત્રને પાછું ખવરાવું. તેથી તે મૂર્ખ મિત્ર દીથ મધ્યે વમન કેર્છ, તે  
મિત્રના મોઢાં આગળ લાવી કહે, ને આ તમે ભોગવો. અહારી  
ધર્ષણા છે. અમને તમારી અક્તિ થાય. તે મિત્ર ભોગવે કે ન  
ભોગવે ? મિત્રને મૂર્ખ જાણે. તેમ ને શ્રી વિતરાગે ભોગ છાંડચા  
તેનાં નામની પ્રતિભા કરી પાંચ ઈદ્રિયના વિષય પૂરે તો વિતરાગ  
અક્તિ કેમ માને ? અપિતુ ન માને. શ્રી વિતરાગની આશાતના થાય.  
આશાતનાએ સમક્તિનો. અભાવ થાય. તે ભાટે ભિથ્યાત્વ લાગે તથા  
કોઈ કહેશે ને પ્રતિભા કરીએ, પણ છ કાયનો આરંભ ન કરીએ;  
દીપ ધૂપાદિક કાંઈ ન કરીએ. અને ધર્મ જાણી પરમાર્થે પ્રતિભા  
પૂજુએ. તે વારે ભિથ્યાત્વ ન લાગે; ધતિ પ્રશ્ને-અથોત્તરઃ—શ્રી વિત-

રાગની પ્રતિમા જે પૃથ્વીની કરે તો, આરંભ ધર્મથી થયો જ. અને જે પિતળ આદિકની કરે તો પરિયહ મધ્યે કહે છે, તો એ આશ્રવ શા અર્થે કરે? શ્રી વીતરાગ હતા તો પંચેન્દ્રિય પ્રતિમા એકેન્દ્રિયને પંચેન્દ્રિય જાણીએ તે ભિથ્યાત્વ લાગે. એ લોકોત્તર હેવગત ભિથ્યાત્વ ॥ ૪ ॥ હવે લોકોત્તર ગુરુગત ભિથ્યાત્વ તે કોને કહીએ. જતિનો વેશ લઈને પંચ મહાપ્રત ન પાણે. મનોગુરુાદિક ત્રણુ ગુરુનિ ન પાણે, ૬૬ દોષરહિત આહાર પાણી ન વહેઠે, તેને ગુરુ કરીને જાણો, વાંદે, પૂજે તે લોકોત્તર ગુરુગત ભિથ્યાત્વ લાગે ॥ ૬ ॥ એ છ બેદ ગ્રંથાંતરથી લખ્યા છે.

હવે ૫ પ્રકારે ભિથ્યાત્વ છે તે ગ્રંથાંતરથી લખીએ છીએ. અલિગ્રહિક ૧ અનાલિગ્રહિક ૨ અલિનિવેશિક ૩ સંશયક ૪ અણુભોગીક ૫ પાંચ નામ કલ્લાં. હવે પાંચના અર્થ લખીએ છીએ. અલિગ્રહિક ભિથ્યાત્વ તે કોને કહીએ-ધર્મની પરોક્ષા કર્યા વિષે, પોતાના વડાવડેરા કુળની રીતે જે ધર્મ કરતાં આવ્યા તેજ ધર્મ સાચો એમ માની-દોષ વાણીયાની પેરે હઠવાદ કરે, તે અલિગ્રહિક ભિથ્યાત્વ. (૧) અનાલિગ્રહિક ભિથ્યાત્વ તે કોને કહીએ-સર્વ હેવ, સર્વ ગુર, અલ્લા, રામ, એ સર્વને હેવ કરી માને, સર્વ ગુર કહેતા ઘાલણાદિકને માને, જતિ પ્રમુખને નમસ્કાર કરે, એ અનાલિગ્રહિક ભિથ્યાત્વ કહીએ. (૨) અલિનિવેશિક ભિથ્યાત્વ તે કોને કહીએ? વિતરાગનો માર્ગ ઓલખીને પોતાની આજીવિકાને અર્થે અથવા માનપૂજને અર્થે પ્રતિમા, પ્રતિષ્ઠા, જીજમણુા, રાત્રિજગરણાદિક ઉત્સૂત્ર ભાખે તે અલિનિવેશિક ભિથ્યાત્વ કહીએ. ॥ ૩ ॥ સાંશયિક ભિથ્યાત્વ તે કોને કહીએ? જે એટલા ભતમતાંતર છે તે માંહિ ન જાણે કયો ધર્મ ખરો, કયો ધર્મ ખોટો હરો! એવો સંશય મનમાં રાખી રહે તે સાંશયિક ભિથ્યાત્વ કહીએ ॥૪॥ અનાભોગિક ભિથ્યાત્વ તે કોને કહીએ? ધર્મ અધર્મનું સ્વરૂપ જાણે નહીં,

તે અનાભોગિક મિથ્યાત્વ કહીએ. ॥ ૫ ॥ એ મિથ્યાત્વના બેદ કણ્ણા. હવે સાંશયિક નિર્વાણું કરીએ.

પત્રમાં, પ્રશ્ન ત્રીજે એમ લખ્યું હતું જે વલી વિશેષે પૂછે. જે વેળા દ્રૌપદીને પરણુવાને અવસરે નેમનાથજનું પ્રવર્તન નહોતું કહ્યું તે કયા સૂત્રને અનુમાને ? તેનો ઉત્તરઃ—સૂત્ર શબ્દાતુમાનેજણ્ણાય છે જે, તે સ્વયંવરમંડપ મધ્યે શ્રી વાસુદેવ, બળદેવ, શ્રી નેમદુમાર એ ત્રણે ઉત્તમ પુરુષ આવ્યા દીસે છે. તે સૂત્ર-પદમંતાવ વિનિષ્પુંગવાણું, દસાર વર વીર પુરિસ, તિલ્બોકુઅલવગાણું, સત્તુસય સહરસ માણાવયહગાણું, અવસિદ્ધિય ॥૪૩॥ વરપુંડરિયાણું ચિલ્લગાણું સત્તુસય સહરસ અલ વીરિય, ઇવ જોવણ ગુણ લાવણુ, કિતણું કરેતિ । ધતિ પાઠમધ્યે લોક બ્લવગાણું કહ્યો, તે શ્રી નેમદુમારજ જાણવા. કેમકે શ્રી નેમનાથ વિના તણુ લોકમાંહિ બ્લવંત કોણ હોય ? ઉકાં ચ, અપરિમીય અલા જિણુ વરિંદા । ધતિ વચ્ચનાત । પહેલું ત્રણે લોકમાંહિ સર્વોત્કૃષ્ટ તીર્થીકરનું બળ લાર પછી ગણુધરનાં બળ, ત્યાર પછી ચૌદ પૂર્વધર સંદેહ ઉપજે, કેવળાને પૂછવા આહારિક લખિધ આહારિક શરીર નીપળવે, હાથ માડેરાં માત્ર, તેનાં રૂપ બળ, તેઢ થકી ઉત્તરતા પાંચ અનુત્તરવાસી દેવતાનાં બળ, અનુક્રમે ત્રૈવેદ્યકના, બાર દેવલોકનાં, ભવનપતિનાં, જ્યોતિષીના, બ્યંતરનાં બળ, લારપછી ચક્રવર્તીનાં બળ, વાસુદેવ, બળદેવ, મંડલિક રાજનાં બળ, તેથી ઉત્તરાં, તદ્દનંતરં છ સંધ્યાણ, છ સંસ્થાન વિશેષ બીજા મનુષ્યનાં બળ, તે માટે ત્રૈલોક મધ્યે બળવંત, શ્રી અહિંયા નેમનાથ; પણ શ્રી વાસુદેવ બળદેવ એ એ તેજ પણ નેમનાથ નહિ, એમ જે કહે તે ઘોટા, તે માટે શ્રી નેમનાથ ત્રૈલોક બળવંત શબ્દ માટે જાણવા.

હવે સૂત્ર તથા વૃત્તિ મધ્યે ફ્લાબ્યા છે તે લખીએ છીએ. શ્રી શાતાના પમા અધ્યયન મધ્યે રેવત નામા પર્વતનું વર્ણન ચાલ્યું છે. ત્યાં કહ્યું છે. રેવત પર્વત કહેવો છે. દસારવરવીરપુરિસ, તે

સોકું અલવગાણું, સોમે. સુલગે, પિયદંસણે, સુરવો પાસાધાયે (૪) દસારા સમુદ્ર વિજયાદ્ય: । તેષું ભધ્યે વરાસ્તે એવ ચ્યવરાવીરં, પુરુષા યેતે, તથા તે સોકું અલવગાણું, તૈલોક્યા દ્વિપિ અલવતો, અજિલ-અલ, નેમિનાથ યુક્તાત્ત્વાત્ત તે વાદ૦ સમુદ્રવિજય તે માંહિ વર૦ પ્રધાન એવા વીર પુરુષ જે તે, એટલે અલહેવ વાસુહેવ તથા તે૦ ત્રિલોક્ય થકી અલવંત, અતુલઅલ નેમિનાથયુક્તા જે તે, એટલે નેમિનાથ પ્રમુખને, તે પર્વત સોભ્ય સુભગ છે એટલે તે દોકઅલવગાણું શાખે નેમનાથ ઇલાભ્યા છે. તે માટે એ શાખાનુસારે તે દ્રૌપદીના સ્વયંવરમંડપ માંહિ, શ્રી નેમનાથ ૧ તથા વાસુહેવ ૨ અલહેવ ૩ એ ઉત્તમાદિક દીસે છે તે નકી જાણુનો. ॥ ૩ ॥ ૩૪ ॥

વલી કોઈ પૂછે, પ્રતિમા પુલો નહિ રા માટે? તેહને દૃષ્ટાંતે કરી જવાબ દઈએ છીએ. જેમ કોઈ ક્ષાખનો ધણી નિર્ધનને પગે લાગે તેમ પાંચ ઈદ્રિયને પામીને એકેન્દ્રિયને પગે લાગવું તે અયુક્તા, તથા અજીવ જડને પગે લાગવું તે અયુક્તા. વલી કોઈ કહે, જે એ તો અગવંતનો નમુનો છે. ઉત્તર-ભગવંતનો નમુનો એ પ્રતિમા નહીં, જે અણી બાજરીનો નમુનો બાજરી, તેમ પંચેન્દ્રિયનો નમુનો એકેન્દ્રિય નહીં. જેમ ધરનું ખત મોદું હોય ને નમુનો કરે તે વારે થોડા માંહિ ઉતારે, પણ બીજી વરસુએ ખતની ગરજ ન સરે, તેમ પાપાણુદિકની પ્રતિમાએ તીર્થીકરની ગરજ ન સરે ॥ ૩૫ ॥ વલી જિણુપડિમા તો અચ્ચેતિ જાવ ધૂવંદહઘાયે પાઠ છે. જિણુ શાખદે કેટલાએક ઓલ્યા, જે તીર્થીકરની પ્રતિમા છે. તેહનો ઉત્તર જુઓ:-અહો દેવાણુંપીયા, એ તીર્થીકરની પડિમા નહીં. એ કામ હેવ જિનની પ્રતિમા તે કેમ? ઈતિ પ્રશ્ને-અથોત્તર-એ પાઠ ભધ્યેજ ધૂવં ડહેઈ (૨)તા કહ્યું તો જિન પ્રતિમા આગળ ધૂપ ઉઘેઘે. તો જિન શાખદે તીર્થીકર કેમ કહીએ? જિન શાખદો અર્થ આવશ્યક નિવૃત્તિ ભધ્યે ઇલાભ્યા છે જે-જિણુ કહેતાં સામાન્ય મનુષ્યમાંહિ પ્રધાન એટલે કેવળી તથા અરિહંત અંતરંગ વૈરી હણ્યા છે. શ્રી

૩૪ અતિશય ૩૫ વાણીના ગુણ તેણે કરી સહિત, એહવા જિનની પડિમા આગળ ધૂપ ઉઘેવ્યો કહે તે બાલ મૂર્ખ જાણુવા. જેહ ભણી સિદ્ધાંતને વિષે કહ્યું છે. જે શ્રી અરિહંતના સમોસરણુને વિષે આવક જાય. તે વારે પૃથ્વી પાણી અનિ વનસ્પતિ ફૂલની ભાલા ધર્ત્યાદિક તેહનો ટાળો કરે. એટલે ગૃહસ્થ સરીઓ પોતાના મુખથી તંબોલાદિ સચિત વરસુ કાઢે, પાસે એકેન્દ્રિયનો સંધરો ન રાખે, તો ખુદ્ધવંત હોય તે વિચારી જેને. વલી બીજે ઉત્તર:-શ્રી જિન તીર્થકર તો નિર્વિષ્યી-પાંચ ધર્દિયના વિષયો વશ વાર્યા, તેહની પ્રતિમા હોય તો ધૂપ તો નાશિકાનો વિષય છે તો તેનો ભોક્તા કોણુ, તે માટે અત્ર વિષયી કામહેવની પડિમા. જે ભણી નિરવિષયીની આગળ ધૂપાદિક ન હોય તે માટે જિન શખ્દે કામહેવ તેહની પ્રતિમા માંડી દીસે છે. પણ તીર્થકરની પ્રતિમા નહી એહ પાઠને અનુમાને. સિદ્ધાંત સાક્ષી નક્કી જાણુને ॥૩॥૩॥ વલી સંવાદી પ્રતિ પૂછોએ. જે તમે તીર્થકરની પડિમા કહો છો, તો એટલા પ પ્રશ્નોનો ઉત્તર નીયો. તે લખીએ છીએ. ધૂપનો ભોક્તા કોણુ ૧ નિવેદનો ભોક્તા કોણુ ૨ તથા તાલ સારંગી પગે ધુધરા બાંધીને નાચો છો એનો ભોક્તા કોણુ, એ પાંચે ધર્દોયના વિષયનો ભોક્તા કોણુ, વળી એહનો કરણુહાર એમ જણે છે કે હું શ્રી તીર્થકરને રોજાંદું છું. અને જે તીર્થકર રીજે\* તો વિષયી કહેવાય. તે તો તમે નિર્વિષ્યી કહેલ છે. તો એ પાંચ ધર્દિના વિષયનો

\* રીજે પણ રોજવે ક્યાંથી ? કામ ભોગ આમંત્રી ખમાવવું પડે, સાક્ષી અનાથી અણુગારને શ્રેણ્યિક રાજએ કામભોગ આમંત્રી પછી ખમાવ્યું. તે ગાથા.

પૂછિ ઉણ મએ તુલાં, આણ વિગધાએ, જે કાચો,

નિમંત્તિયાય ભોગેદિં, તં સત્ત્વં ભરિસેદિમે ॥ ૧ ॥

સાધુને ભોગ આમંત્રો પછી ખમાવ્યું છે એ સૂત્ર આગળ સાક્ષી. તો શ્રી જિન આગળ ભોગ આમંત્રણે કરીને ધર્મ કહે એ ન નક્કી ઓટો જાણુને. ૩૦ ॥ ૪ ॥

ભોક્તા કોણું ? તે માટે તીર્થકરના નામની પ્રતિમા કરો છો, છકાયનો આરંભ કરો છો, પાંચ છદ્રિયના વિષય ચોખો છો, તે ધણું જ ભૂલો છો, વિચારી જો જો. આંખો ઉધાડી જો જો. ધણું શું લખીએ. ॥૩૭॥

હવે કામહેવ કુલ પાણી ધૂપાદિકના ભોક્તા છે તે માટે કામહેવની પ્રતિમા આગળ ધૂપાદિકે છંદ લોકે પ્રત્યક્ષ દેવમૂર્તિ આગળ, મહેમરિ પ્રમુખ પૂજન કરે છે, તે પોતાની છંદિંધા પૂર્ણ થાવા માટે અને સૂત્રે પણ કહ્યું છે. શ્રી અંતગડ સૂત્રે અર્જુન માલાગાર, મુહૃગર પાણી દેવની પ્રતિમા પૂજતાં મુહૃગર પાણીનું યક્ષ પ્રગટ થયો. તે સેવકનું કણ્ઠ લાંબું, પણ તીર્થકર નિર્વિષયી આગળ કુલ પાણી ધૂપાદિક ન હોય. જે ભાણી વિતરાગ મોક્ષ પહેંચ્યા તે ન આવે. તે માટે તીર્થકરની પ્રતિમા નહિં, ધર્ત્યાદિક સૂત્રે હરિણ ગમેષી દેવતાની મૂર્તિ આગળ પૂજ કરતાં તુદ્યો. સુલસાનો છંદિંધા પૂર્ણ થઈ. એ દેવતાની પ્રતિમા આગળ પૂર્વે અને હમણા પણ સંસારની છંદિંધાએ કુલ પાણી ધૂપાદિક કરે છે, પણ નિરવિષયી તીર્થકરની પ્રતિમા આગળ કુલ પાણી ધૂપ એ શું ? એ વિતરાગે જીવ કલ્યા તે રાખવા કલ્યા. તો તેહની જ પ્રતિમા છે એમ કેમ કહેવાય ? એ સત્ય ડાઢા હોય તે વિચારો જો જો. ॥ ૩ ॥ ૩૮

વળી કેટલાએક સુભતિ દ્રૌપદીની પૂજને જોત્ર દેવની પૂજા કહે છે એ પણ હોય. ॥ ૩૯ ॥ વળી કોઈ પૂછે જે આવડું કુપંથ ભથન કરો છો તે શા માટે, તે લખીએ છીએ. પોતાના કર્મની નિર્જરા તથા પર ઉપગારનો હેતુ માટે. વળી વિશેષે પૂછો—શ્રી પાશ્ર્ણનાથ સ્વામીએ કમઠ તાપસનો તપ દુષ્ટ અનર્થકારી છી, કુપંથ ભથન કર્યો કલ્યો છે !!! તત્ત્વ શ્લોકઃ—

વનિં જવાલાવલીં કુપથ ભથન ધીમાતુર સ્તોક લોકસ્યાત્રે  
સંદર્શ્ય નાગં કમઠ મુનિ તપઃ સ્કૃષ્ટયનુ દુષ્ટમુચ્યૈ: યઃ કારુષ્યામૃતા-  
ભિં વિધુરકિલ સ્વર્ય સઘઃ પ્રપદ ગ્રાજે: કાર્ય કુમાર્ણ સ્ખલનમિતિ  
જગાદેવ દેવસ્તમસ્ત ॥ ૧ ॥ ૪૦ ॥

ધત્યાપથ કથતથતયા તસ્યાપીહ, કશ્ચિત, મેદ શાસી-  
દ્ધુ ચિતમથો માકુપન્ન કેપિ યરમાત્ જિનભાંત્યા કુપથ પતિતાનુ,  
ગ્રેક્ષ્ય નૃસ્તતત્પ્રમોહા પોહાયેદ કિમપિ કુપયા લિખિતં ચ ॥૧॥૪૧॥

વ૦ અમ્રિ તેહનો, જ્વાં જ્વાલાએ કરી, અ૦ અધિઅલ્યો કું  
માર્ગ, મ૦ ભથવાને વિષે ધી૦ બુદ્ધિ છે જેની, માં ભાતાને અને,  
અ૦ રમસ્ત લોક. સ્યાં આગળ, સં૦ હેખાડીને, નાં સર્પને ક૦  
કુમઠનામા, મુ૦ તાપસનું, ત૦ તપ, સ્ક૦ પ્રગટ કરતો, હું હુણ કરે  
છે એવું અનથ્, ય૦ પાર્શ્વનાથ કાં દ્યા રૂપી, અ૦ અમૃતનો,  
અ૦ સમુદ્ર, વિ૦ કષ્ટમય, કિ૦ સંભાવનાયા, સ્વ૦ આત્માને સ૦  
તત્કષણાત, પ્ર૦ અંગીકાર કરીને, પ્રા૦ પંડિતે, કાં કરવું કું લુંડા  
માર્ગનું, સ્ખ૦ ઉથાપવું. મિ૦ ધમ્માલતાની પેરે ઓદ્યા. જ૦ પાર્શ્વનાથને.

(એ ચક્રધ્ય કાવ્ય છે એ કાવ્ય મધ્યે કહ્યું ને પંડિતે કુમાર્ગનું  
ઉથાપન કરવું પણ તે માટે એ પૂર્વોક્તા કુપથ ભથન કરવા થકી  
લુંડા ભત માન્યો તે માટે કાવ્ય ૧ કહેલ છે.)


ઈ૦ એણી પ્રકારે, મિ૦ ભિથ્યાત્વ માર્ગ તેહને, ક૦ કહેવે કરી,  
ત૦ સત્ય કહેવે કરી ક૦ કોઈનિર એ સંસારને વિષે, મે૦ રેષ૦ એ  
એ પૂર્વોક્તા, રાં જાણપણું, અ૦ અનુયોગ્ય, માં રખે કોઈ કોષ  
કર્યો, ય૦ જેણે કારણે, જી૦ તીર્થેકરની ભાંતિ કરી, કું કુમાર્ગને  
પામ્યાને, પ૦ પડયાને, પે૦ હેખીને, નું લોકને, રત૦ તે લોકનો  
પ્રકર્ષ મોહ તે, અ૦ ટાળવાને અર્થે, ઈ૦ એ પૂર્વ કહ્યું તે સર્વ  
કિ૦ કોઈક, કું દ્યા, કુપા કરીને, લિ૦ મેં લખ્યું છે.

એ પૂર્વોક્તા ઉત્તરોત્તર મુજને લાધા. તે સહગુરુના સંગથી, તે  
માટે શુદ્ધ ગુરુની સેવા કરવી. તે ઉપર ૬ બોલ ઉતારીએ છીએ. ૧  
ગુણવંત શુદ્ધ શ્રક્ષાવંત ગુરુનો સંગ કરવો. ૨ કોણ હેતુ? શુદ્ધ શાનાદિ  
ગ્રામિ હેતુત્વાત, એ હેતુ: ૩ કોણ દષ્ટાંતે? -ગૌતમાદિ તથા શુક પરિ-

પ્રાજકને દૃષ્ટાંતે. ૪ ઉપનયઃ— જે જે ગુણ ગુરુ તथા શુદ્ધ અદ્ધાવં-  
તના તે તે શાનાદિ પ્રામિનો હેતુ: ૫ તરમાત તથા ન્યાયેણ શુદ્ધ  
અદ્ધાવંત ગુરુનો સંગ કરવો, ૬ કિંડારણું-શુદ્ધ ગુરુના સંગ વિના  
શાનાદિકની પ્રાપ્તિ ન હોય. ॥૪૨॥

એ એંતાલીસ ઓલ ગણ્યા છે. સંભારી રાખવા માટે, પણ  
એકેક ઓલ ધણા અર્થ સહિત છે. તમેવ સર્વચં નિઃસંકં, જો  
જિષુહિં પવેધયં ॥ ઈતિ સમાપ્તેયં ॥ છ: ॥

લિપિકૃતં લાહાવરી બેઈતાદાસ મેવાસાહા ! ! !







## અમારાં છેદાં પ્ર

નૈન સિદ્ધાન્તની વાર્તાઓ	બા. ૧ લો.	
” ” ” ”	બા. ૨ જો.	૦—૫—૦
નૈન સાહિત્યની કથાઓ	બા. ૧ લો*	૦—૫—૦
” ” ” ”	બા. ૨ જો*	૦—૮—૦
આદર્શ નૈન રત્નો		૦—૮—૦
જાણુસવામી ચરિત્ર		૦—૮—૦
આદર્શ નૈન સ્તુતિ		૦—૪—૦
હિંદી જૈન સ્તુતિ.		૦—૩—૦
શ્રીમહ રાજયંત્ર વિચાર નિરીક્ષણ ( આ. ૨ જી )		૦—૧૦—૦
નૈન ધર્મનો ધતિહાસ અને પર્દૃવલી*		૨—૦—૦
પર્યુપણના વ્યાખ્યાનો ( વર્ષ ૪ થુ' )		૦—૪—૦
નૈનાગમ કથા ડોષ		૧—૪—૦
વીરભાણ ઉદ્ઘટાણ ચરિત્ર		૦—૭—૦
શ્રી લેંકાશાહ મત સમર્થન		૦—૮—૦
શ્રી દ્રૌપદીની ચર્ચા		૦—૪—૦

\* આ નિશાનીવાળાં પુરતકો ખલાસ થઈ ગયા છે. નવી આવૃત્તિનો વિચાર ચાલે છે. અમારા ઉપરોક્ત પ્રકાશનો ઉપરાંત નૈન ધર્મના તમામ જાતના પુરતકો, સુતો, અંથો, ચરિત્રા, પાઠ્ય પુસ્તકો, ટીડાવાળાં આગમો અન્ય હરકેાં પ્રકાશન સંસ્થાના પુરતકો આ કાર્યાલયમાંથી. મળો શકે છે. એડારના પ્રમાણુમાં વ્યાજાંથી વળતર મળે છે. વધુ માટે અમારે સૂચિપત્ર મંગાવો.—

સ્થાનકવાસી નૈન કાર્યાલય.

પંચભાઈની ચોણ:—અમદાવાદ.